

प्रतिक्षमणी व्याख्या

स्वस्थनाद् यत्परसथानं,
प्रमादस्य वशाद् गतः ।

तत्रैवकर्णं भूयः;
प्रतिक्रमण - मुच्यते ॥ १ ॥

प्रभादवश

शुभयोगथी अ्युत
थर्हने भिथ्यात्व, अप्रत,
प्रभाद, कषाय अने अशुभयोगमां
गयेलां आत्माने फरीथी
शुभयोगमां लाववो तेनुं नाम -

श्रावक
प्रतिक्षमण सूत्र

પ્રતિક્રમણાનો મહિમા

પડિકુંમળેણ ભંતે ! જીવે કિં જણયઇ ?

- પ્રશ્ન - હે ભગવન્ ! પ્રતિક્રમણ કરવાથી જીવને શું લાભ થાય છે ?

પડિકુંમળેણ વયચ્છિદાં પિહેઇ, પિહિયવયચ્છિદે પુણ જીવે નિરુદ્ધાસવે અસબલ-ચરિતે અદૃસુ પવયણમાયાસુ ઉવજતે અપુહત્તે સુપ્રણિહિએ વિહરઇ ॥

- ઉત્તર - હે શિષ્ય ! પ્રતિક્રમણ કરવાથી પ્રતોમાં લાગેલાં દોષોનું નિવારણ થાય છે. પછી પ્રતોના દોષોથી રહિત થઈને શુદ્ધ પ્રતધારી જીવ, આશ્રવોને (કર્મ આવવાના દ્વારાને) રોકીને, સબલાદિ દોષોથી રહિત શુદ્ધ સંયમવાન (મર જાના મંજૂર હૈ, લેક્ઝિન દોષ લગાના મંજૂર નહિ) થઈને આઠ પ્રવચન માતામાં (પાંચ સમિતિ+ત્રણ ગુપ્તિ) સાવધાન થાય છે અને સમાધિપૂર્વક સંયમમાર્ગમાં તલ્લીન રહેતો થકો પોતાની ઈન્દ્રિયોને ઉન્માર્ગથી હટાવીને સંયમમાર્ગમાં વિચરણ કરે છે.

ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન-૨૯

ઉભયકાળ શુદ્ધભાવે પ્રતિક્રમણ કરવાથી જીવ તીર્થકર નામ ગોત્રનો બંધ કરે છે.

- જ્ઞાતાધર્મકથા અધ્યયન-૮

શ્રાવક પ્રતિક્રિયા સૂત્ર

(પ્રતિક્રિયા કરવાના સમયે બિરાજમાન પૂજનીય સાધુ-
સાધીજીઓને અથવા તેઓ બિરાજમાન ન હોય તો પૂર્વ અને ઉત્તર
દિશા (ઇશાનકોણ) તરફ મુખ કરીને શ્રી સીમંઘરસ્વામીને ગુરુવંદન
સૂત્ર (તિક્ખૂતોનો) પાઠથી ત્રણ વખત વંદના કરીને પ્રતિક્રિયાના
પ્રથમ આવશ્યકની આજ્ઞા માંગવી. પ્રથમ મારો અને તમારો આત્મા
અનાદિકણથી મમત્વ ભાવમાં પરિણામ્યો છે તેને સમભાવમાં
પરિણામાવવા માટે સાવધયોગનું નિવર્તન કરવું. સમભાવનો લાભ
લેવો તેનું નામ સામાયિક.)

નમસ્કાર મંત્ર અને તિક્ખૂતોનો પાઠ બોલવો. પછી
સ્વામીનાથ ! પાપનું આલોયણ, પ્રતિક્રિયાની આજ્ઞા (એમ
બોલીને)

પાઠ : ૧ : આજ્ઞાસૂત્ર

ઇચ્છામિ	- ઇચ્છું છું.
ણાં	- વાક્યના અલંકારાર્થે વપરાય છે.
ભંતે	હે ભગવન્ !
તુખ્ભેહિં	- આપની
અખ્માણુષ્ણાએ	- આજ્ઞા
સમાણો	- મળ્યેથી અર્થાત આજ્ઞા લઈને

શ્રાવક સામાયિક પ્રતિક્રિયા સૂત્ર

દેવસિયં *	- દિવસ સંબંધી
પડિક્રમણં	- પ્રતિક્રિયા
ઠાઓમિ	- એક સ્થાને બેસીને કરું છું.
દેવસિય	- દિવસ સંબંધી
જ્ઞાન	- સમ્યગ્જ્ઞાન
દર્શન	- સમ્યગ દર્શન-યथાર્થ શ્રદ્ધા
ચારિત્ર	- શ્રાવકનાં દેશવિરતિ ચારિત્રમાં
તપ	- સમ્યક તપશ્ચયાદિ
અતિચાર	- લીધેલાં પ્રતોમાં દોષ લાગ્યાં હોય તેનું
ચિંતવનાર્થ	- ચિંતન કરવાને માટે
કરેમિ	- કરું છું.
કાઉસ્સગં	- કાયોત્સર્વ-કાયાને સ્થિર રાખવી

**નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં,
નમો ઉવજ્જાયાણં, નમો લોએ સવ્વસાહૂણં.**

* વિશેષ કાળની અપેક્ષાથી પ્રતિક્રિયાનાં પાંચ ભેદ પણ માનવામાં આવે છે. (૧) દિવસ સંબંધી કરવામાં આવે તે 'દેવસિય' (૨) રાત્રિ સંબંધી કરવામાં આવે તે 'રાઈય'. (૩) દર મહિનાની અમાસ અને પૂનમે (૧૫ દિવસે) કરવામાં આવે તે 'પક્ખિય'. (૪) ચાર, ચાર મહિને-કારતક સુદ પૂનમ, ફાગણ સુદ પૂનમ અને અષાઢ સુદ પૂનમના કરવામાં આવે તે 'ચાઉભ્રાસિય'. (૫) વર્ષમાં એક વખત ભાદરવા સુદ-પાંચમના કરવામાં આવે તે 'સંવચ્છરિય'.
× 'દેવસિય'ની જગ્યાએ (૧) 'રાઈય'. (૨) 'પક્ખિય' (૩) 'ચાઉભ્રાસિય'. (૪) 'સંવચ્છરિય' શબ્દ બોલવા.

(૧) સામાયિક આવશ્યક

કરેની ભંતે ! ૧ સામાઈં, સાવજું જોગં પચ્ચકખામિ, જાવ નિયમ
પજુવાસામિ, દુવિહં, તિવિહેણાં, ન કરેની, ન કારવેની, મજાસા,
વયસા, કાયસા, તસ્સ ભંતે ! પડિકુભામિ, નિંદામિ, ગરિહામિ,
અખ્યાણાં વોસિરામિ.

પાઠ : ૨ : કાઉસ્સગ સૂત્ર^૨

ઇચ્છામિ	- (હું) ઇચ્છું છું
ઠામિ	- એક સ્થાને સ્થિર રહીને
કાઉસ્સગાં	- કાઉસ્સગા (મન, વચન અને કાયાને સ્થિર રાખવા)
જો-મે	- જે, મારા જીવે

* આવશ્યકનાં ૬ અધ્યયન છે. તેનાં નામ - (૧) સામાયિક.
(૨) ચઉવીસત્થો. (૩) વંદના. (૪) પ્રતિક્રિયા. (૫) કાઉસ્સગા
અને (૬) પચ્ચકખાણા.

સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા (ચતુર્વિધ સંઘ) એ
ઉભયકાળમાં અવશ્ય કરવું જોઈએ. તેનું નામ 'આવશ્યક' છે.

૧. આ પાઠના અર્થ સામાયિકના છઢા પાઠમાં આવી ગયેલ છે.
૨. આ પાઠ ઘણો જ અગત્યનો છે. આખા દિવસમાં આપણે
જે જે પાપો કર્યા હોય તે સર્વ પાપો યાદ કરીને ખંરા અંતઃકરણ
પૂર્વક તેનો પશ્ચાત્તાપ કરવાનો છે. આખાયે પ્રતિક્રિયાના સાર
રૂપ આ પાઠ છે. તેથી 'સંક્ષિપ્ત પ્રતિક્રિયા સૂત્ર' પણ
કહેવાય છે.

શ્રાવક સામાચિક પ્રતિકમણ સૂત્ર

દેવસિઓ	- દિવસ સંબંધી
અઈયારો	- અતિચાર [?]
કુઓ	- કર્યા હોય (કયા અતિચાર ?)
કાઈઓ	- કાયાથી-શરીરથી
વાઈઓ	- વચનથી
માણસિઓ	- મનથી (ત્રણેનું સ્પષ્ટીકરણ)
ઉસ્સુતો	- સૂત્ર વિરુદ્ધ કર્યું હોય
ઉભુગ્ગો	- સાચા જૈનમાર્ગ વિરુદ્ધ
અકૃપો	- કલ્પે નહિ (તેવું કાર્ય કર્યું હોય)
અકરણિજજો	- અકરણીય-ન કરવા યોગ્ય (કાર્ય કર્યું હોય)
દુજ્જાઓ	- આર્ત-રૌદ્રધ્યાન ધર્યું હોય [?]
દુલ્વિચિંતિઓ	- માઠી ચિંતવણા કરી હોય,
આણાયારો	- નહિ આચરવા યોગ્ય
અણિચ્છિયવ્વો	- નહિ ઈચ્છવા યોગ્ય

1. યથાકાળ પ્રતિકમણમાં (૧) 'રાઈઓ'. (૨) 'પક્ખિઓ'
(૩) 'ચઉમાસિઓ' અને (૪) 'સંવચ્છરિઓ' બોલવું.
2. અતિકમ, વ્યતિકમ, અતિચાર અને અનાચાર : એ ચાર પાપના પગથિયાં છે. અતિકમ - પાપ કરવાનું મન થાય તે, વ્યતિકમ - પાપ કરવાને પગલું ભરવું તે, અતિચાર - વસ્તુને સ્પર્શ કરવો તે, અનાચાર - વસ્તુને સેવી પાપ કરવું તે. દરેકમાં કમ અનુસાર વધારે, વધારે પાપ છે. અનાચારમાં તો સર્વથા ભંગ છે.
3. ધ્યાન ચાર ગ્રકારનાં છે - (૧) આર્તધ્યાન, (૨) રૌદ્રધ્યાન, (૩) ધર્મધ્યાન અને (૪) શુક્લધ્યાન. આ ચારમાં પહેલાં બે ધ્યાન છોડવા યોગ્ય છે અને છેલ્લા બે ધ્યાન આદરવા યોગ્ય છે.

શ્રાવક સામાચિક પ્રતિક્રિયા સૂત્ર

અસાવગ પાઉંગો - શ્રાવકને નહિ કરવા યોગ્ય પાપ
(આ અતિયાર ક્યા વિષય સંબંધી હોય છે ?)

નાણો	- જ્ઞાનને વિષે
તહ	- તેમજ
દંસણો	- સમ્ભગ્રદર્શનને વિષે
ચરિતાચરિતો	- શ્રાવકના દેશવિરતિ ચારિત્રમાં ।
સુઅ	- શુત્રજ્ઞાનને વિષે,
સામાઈએ	- સમતારૂપ સામાચિક વિષે
તિષ્ઠું	- ત્રણ પ્રકારની
ગુતીણાં	- ગુમિઓ *
ચઉષું	- ચાર પ્રકારના
કસાયાણાં	- કષાય (કોઘ, માન, માયા અને લોલ)
પંચષું	- પાંચ પ્રકારના
મણુષ્યવ્યાણાં	- (અણુષ્યવ્યાણાં) અણુષ્ટ્રત ×

૧. જેટલા અંશે પચ્ચક્ખાણ તેટલા અંશે ચારિત્ર, અને જેટલા અંશે
અપચ્ચક્ખાણ તેટલા અંશે અચારિત્ર.

* ગુમિ ત્રણ પ્રકારની છે; (૧) મનગુપ્તિ. (૨) વચનગુપ્તિ અને
(૩) કાયગુપ્તિ. મન, વચન અને કાયાને ગોપવી રાખવાં.
અશુભથી નિવૃત્તિ યા સર્વથા નિવૃત્તિ તે ગુપ્તિ.

× સાધુ-સાધીજીઓને પાંચ મહાષ્રત હોય છે. તે મહાષ્રતોમાં કોઈ
જીતની ધૂટ નહિ હોવાથી તેમજ જિંદગીપર્યતનાં હોવાથી, તે
'મહાષ્રતો' કહેવાય છે; જ્યારે શ્રાવક-શ્રાવિકાઓને આ પ્રતો
જીવજીવના તથા અમુક સમયના તેમજ અમુક-અમુક
ધૂટછાટોવાળા હોવાથી તે 'અણુષ્ટ્રતો' કહેવાય છે, આ પાંચ
અણુષ્ટ્રતોની હકીકત આગળ ઉપર આવશે.

શ્રાવક સામાચિક પ્રતિકમણ સૂત્ર

તિથં	- ત્રણ પ્રકારના
ગુણવ્યાણં	- ગુણપ્રતો (૬, ૭ અને ૮મું વ્રત)
ચર્ચિથં	- ચાર પ્રકારના
સિક્ખાવ્યાણં	- શિક્ષાપ્રત (૯, ૧૦, ૧૧, ૧૨મું વ્રત)
બારસ	- એ બાર
વિહેસ્સ	- પ્રકારના
સાવગ ધમ્મસ્સ	- શ્રાવકધર્મનું
જું ખંડિયં	- જે કાંઈ ખંડન (દેશ-ભંગ) કર્યું હોય
જું વિરાહિયં	- જે કાંઈ વિરાધના (સર્વથા ભંગ) કરી હોય
તસ્સ	- તેનું-તે સંબંધી
મિચ્છા મિ દુક્કડં	- મારું પાપ નિષ્ફળ થાઓ. * * *

અહીં 'તસ્સ ઉત્તરી કરણેણં' નો આખો પાઠ કહેવો અને ત્યારબાદ ૮૮ અતિચારનો કાઉસ્સગ્ગ કરવો.

૮૮ અતિચાર ન આવડતા હોય તેઓ 'ચાર લોગસ્સ' નો કાઉસ્સગ્ગ કરે છે.

૮૮ અતિચાર નીચે મુજબ : -

જું વાઈદ્ધં, વચ્ચામેલિયં, હીણક્ખરં, અચ્યક્ખરં, પયહીણં, વિણયહીણં, જોગહીણં, ધોસહીણં, સુહુદિનં, દુહુપડિચ્છિયં, અકાલે કાંઈ સજ્જાઓ, કાલે ન કાંઈ સજ્જાઓ, અસજ્જાઈએ સજ્જાયં, સજ્જાઈએ ન સજ્જાયં;

શંકા, કંખા, વિતિગિચ્છા, પરપાસંડ પરસંસા, પરપાસંડ સંથવો, બંધે, વહે, છવિચ્છેએ, અઈભારે, ભત્તપાણ વોચ્છેએ; સહસાભક્ખાણો, રહસ્સાભક્ખાણો, સદાર-મંતલેએ, મોસોવએસે, કૂડલેહકરણો; તેનાહે, તક્કરખાણો,-વિરુદ્ધ રજ્ઝાઈકુમે, કૂડતોલે-

કૂડમાણે, તપ્પદિરુવગવવહારે; ઈતરિયપરિગાહિયાગમાણે,
અપરિગાહિયાગમાણે, અનંગંકીડા, પરવિવાહકરણે, કામભોગેસુ
તિવ્વાભિલાસા, ખેતવત્થુપમાણાઈકુંમે; હિરણ્ય-સુવણ્યા
પમાણાઈકુંમે, ધન ધાન -પમાણાઈકુંમે, દુપદ-ચઉપદ
પમાણાઈકુંમે, કુવિય પમાણાઈકુંમે, ઉરૂઢિસિ પમાણાઈકુંમે,
અઘોદિસિ પમાણાઈકુંમે, તિરિયદિસિ પમાણાઈકુંમે, ખેતવુર્ધી,
સઈઅંતરદ્વાએ, સચિત્તાહારે; સચિત્તપદિબધાહારે, અપોલિઓ
સહિભક્ખણયા; દુપોલિઓસહિભક્ખણયા, તુચ્છોસહિ
ભક્ખણયા, ઈગાલકુંમે; વણકુંમે, સાડીકુંમે, ભાડીકુંમે,
ફોડીકુંમે, દંતવાણિજે, લક્ખવાણિજે. કેસવાણિજે
વિસવાણિજે, જંતપીલણકુંમે, નિલંછણકુંમે, દવળિંદાવણયા, સર
દહ તલાગ પરિસોસણયા, અસઈજણ પોસણયા; કંદપે, કુકુરીએ,
મોહરિએ, સંજુતાહિગરણે, ઉવભોગ પરિભોગ અઈરતો, મણ
દુષ્પણિહાણે, વય દુષ્પણિહાણે, કાય દુષ્પણિહાણે, સામાઈયસ્સ સઈ
અકરણયા, સામાઈયસ્સ આણવહિયસ્સ કરણયા; આણવણાપ્પાગો,
પેસવણાપ્પાગો, સદ્ધાણુવાએ; રૂવાણુવાએ; બહિયાપોગલ-
પક્ખેવે; અપરિલેહિય દુષ્પરિલેહિય સિજજા સંથારએ,
અપમજ્ઞિય દુષ્પમજ્ઞિય સિજજા સંથારએ; અપરિલેહિય
દુષ્પરિલેહિય ઉચ્ચાર પાસવણ ભૂમિ, અપમજ્ઞિય દુષ્પમજ્ઞિય
ઉચ્ચાર પાસવણ ભૂમિ, પોસહસ્સ સમ્મં આણાણુ પાલણયા, સચિત
નિફ્ખેવણયા, સચિત પેહણયા, કાલાઈકુંમે; પરોવઅસે,
મચ્છરિયાએ, ઈહલોગા સંસપ્પાગો, પરલોગા-સંસપ્પાગો,
જવિયા સંસપ્પાગો, મરણા સંસપ્પાગો, કામભોગા સંસપ્પાગો
તસ્સ મિચ્છા મિ દુકુંડ.

એમ હ્ય અતિચારના કાઉસ્સગમાં કાનો, માત્રા, મીડી, પદ,
અક્ષર, ગાથા, સૂત્ર, ઓછું, અધિક, વિપરીત ભણાયું હોય તો
અનંત સિદ્ધ, કેવલી ભગવંતોની સાક્ષીએ તસ્સ મિચ્છા મિ દુકુંડ.

નમસ્કારમંત્ર બોલીને કાઉસ્સગ પાળવો.

(૨) ચઉવીસત્યો આવશ્યક

કાઉસગુ પાળીને, બીજા આવશ્યકની આજા (એમ કહીને)
લોગસ્સ ઉજ્જોયગરે' નો પાઠ બોલવો.

(અનુષ્ટૃપ્ત છંદ)

લોગસ્સ ઉજ્જોયગરે, ધમતિત્થયરે જિણો,
અરિહંતે કિતાઈસં, ચઉવીસં પિ કેવલી. (૧)
(આર્ય છંદ)

ઉસભમજિયં ચ વંદે, સંભવ મલિનંદણાં ચ સુમર્દ્ધ ચ;
પઉમપ્પહં સુપાસં, જિણાં ચ ચંદપ્પહં વંદે. (૨)
સુવિહિ ચ પુષ્ટદંતં, સીયલ-સિજ્જંસ-વાસુપુજ્જં ચ;
વિમલમણાંતં ચ જિણાં, ધમ્મં સંતિ ચ વંદામિ. (૩)
કુંથું અરં ચ મહિં, વંદે મુણિસુવ્વયં નમિજિણાં ચ;
વંદામિ રિહુનેમિં, પાસં તહ વદ્ધમાણાં ચ. (૪)
એવંમએ અભિથુઆ, વિહુયરય-મલા, પહીણ જર મરણા:
ચઉવીસં પિ જિણાવરા, તિત્થયરા મે પસીયંતુ, (૫)
કિત્તિય, વંદિય મહિયા, જે એ લોગસ ઉત્તમા સિદ્ધા;
આરુગુ બોહિલાભં, સમાહિ વર મુતમં દિંતુ. (૬)
ચંદેસુ નિમ્મલયરા, આઈચ્યેસુ અહિયં પયાસયરા;
સાગર વર ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. (૭)

(૩) વંદના આવશ્યક

પાઠ : ૩ : દ્વાદશાવર્ત્ત ગુરુવંદના સૂત્ર

(‘ઈચ્છામિ ખમાસમણાનો’ પાઠ ગુરુને ઉત્કૃષ્ટ વંદના
કરવાનો અને તે ઉભડક-ઉત્કટુક આસને બે વાર બોલવાનો છે.)
ત્રીજા આવશ્યકની આજા એમ કહીને.

શાબ્દક સામાચિક પ્રતિક્રિયા સૂત્ર

ઈચ્છામિ	- (હું) ઈચ્છું છું
ખમાસમણો !	- હે ક્ષમાશ્રમણ !
વંદિંદ	- (આપને) વંદના કરવાને
જાવણિજજાએ	- (શરીરની) યથાશક્તિ પ્રમાણે
નિસીહિયાએ	- અશુભયોગ=પાપક્રિયાને નિષેધાને
અણુજાણાહ	- અનુજ્ઞા-આજ્ઞા આપો.
મે	- મને,
મિઉંગાહં	- અવગ્રહમાં આવવાની.
નિસીહિ	- અશુભ પાપક્રિયાને રોકીને
અહોકાયં	- (આપના) ચરણોને
કાયસંફાસં	- મારા શરીરથી, મસ્તકથી યા હાથથી સ્પર્શ (કરું છું)
ખમણિજજો	- ક્ષમા કરજો
ભે !	- હે પૂજ્ય ! (મારા સ્પર્શથી) આપને
કુલામો	- બાધા પીડા થઈ હોય તો
અપ્પકિલંતાણં	- અલ્ય ગ્લાન અવસ્થામાં રહીને
બહુ સુભેણં	- ઘણા શુભયોગે - સમાધિભાવે
ભે	- હે પૂજ્ય ! આપનો
દિવસો	- આજનો દિવસ
વઈક્કંતો *	- વ્યતીત થયો છે ? - પસાર થયો છે ?
જતા ભે ?	- આપની સંયમયાત્રા સુખરૂપ છે ?
જવણિજ્જં	- મન તથા ઈદ્રિયોની પીડાથી રહિત છે ?
ચ	- અને
ભે ?	- હે પૂજ્ય ! હું આપની
ખામેમિ	- ક્ષમા માગું છું.

* રાઈય આદિ પ્રતિક્રિયામાં (૧) 'રાઈ વઈક્કંતો'.

(૨) 'પદ્ધતિઓ વઈક્કંતો'. (૩) 'ચાઉમાસિઓ વઈક્કંતો'.

(૪) 'સંવચ્છરીઓ વઈક્કંતો' આ રીતે શબ્દ બોલવા.

શ્રાવક સામાયિક પ્રતિકમણ સૂત્ર

ખમાસમણો !	- હે ક્ષમાશ્રમણ !
દેવસિયં +	- (હું) દિવસ સંબંધી
વઈકુમં	- અપરાધ થયો હોય ?
આવસ્સિયાએ	- આવશ્યકકરણી કરતાં થયેલ અતિચારથી
પડિકુમામિ	- નિવૃત્ત થાઉં છું.
ખમાસમણાણં	- ક્ષમાવંત સાધુજીઓની
દેવસિયાએ*	- દિવસ સંબંધી
આસાયણાએ	- આશાતના વડે
તિતીસત્ત્રયરાએ	- તેત્રીશમાંથી કોઈ પણ
જું કિંચિ	- જે, કાંઈ પણ
મિથ્યાએ	- મિથ્યાભાવે કરેલી
મણ દુકુડાએ	- દુષ મનથી કરેલી
વય દુકુડાએ	- દુષ વચનથી કરેલી
કાય દુકુડાએ	- શરીરની દુષ ચેષ્ટાથી કરેલી.
કોહાએ	- કોઘથી કરેલી
માણાએ	- માનથી કરેલી
માયાએ	- કપટથી કરેલી
લોહાએ	- લોભથી કરેલી
સવ્ય કાલિયાએ	- સર્વ કાળ સંબંધી
સવ્યમિથ્યોવયારાએ-	સર્વ પ્રકારનાં મિથ્યા આચરણો વડે

+ યથાકાળ પ્રતિકમણમાં (૧) રાઈયં. (૨) પક્ષિયં.

(૩) ચાઉભ્રાસિયં અને (૪) સંવચ્છરિયં શબ્દ બોલવા.

* યથાકાળ પ્રતિકમણમાં (૧) રાઈયાએ, (૨) પક્ષિયાએ,
(૩) ચાઉભ્રાસિયાએ અને (૪) સંવચ્છરિયાએ શબ્દ બોલવા.

શ્રાવક સામાયિક પ્રતિકમણ સૂત્ર

સવ્ય ધર્માઈકમણાએ-	સર્વ ગ્રકારનાં ધર્માનું ઉલ્લંઘન કરનારી
આસાયણાએ	- આશાયતના વડે
જો મે	- જે, મારા જીવે
દેવસિઓ*	- દિવસ સંબંધી
અઈયારો	- અતિચાર
કાઓ	- કર્યા હોય,
તસ્સ	- તેનું (અતિચારનું)
ખમાસમણો !	- હે ક્ષમાશ્રમણ !
પડિકુકમાભિ	- પ્રતિકમણ કરું છું
નિંદાભિ	- આત્માની સાક્ષીએ નિંદા કરું છું.
ગરિહાભિ	- (ગુરુની સાક્ષીએ) ઘિક્કારું છું.
અધ્યાણાં વોસિરાભિ	- આત્માને તે પાપથી દૂર રાખું છું.

સ્વામીનાથ ! સામાયિક એક, ચઉવીસત્થો બે અને વંદના ત્રણ,
એ ત્રણો આવશ્યક પૂરા થયા, તેને વિધે શ્રી વીતરાગદેવની આજામાં
કાનો, માત્રા, મીંડુ, પદ, અક્ષર, ગાથા, સૂત્ર, ઓછું, અધિક,
વિપરીત ભણાયું હોય, તો અનંત સિદ્ધ કેવલી ભગવાનની સાખે
તસ્સ મિચ્છા મિ દુકુડં.

(અહીં જિભા થઈને વિધિપૂર્વક વંદના કરી યોથા આવશ્યકની
આજ્ઞા માગવી.)

* યથાકાળ પ્રતિકમણમાં (૧) રાઈઓ. (૨) પક્ષિખાઓ.

(૩) ચાઉભ્રાસિઓ અને (૪) સંવચ્છરિઓ શબ્દ બોલવા.

(૪) પ્રતિક્રમણ આવરણક

પાઠ : ૪ : શાનના અતિચાર

આજના દિવસ સંબંધી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને
વિષે જે અતિચાર લાગ્યા હોય તે આલોઉં છું -

આગમે	- સૂત્ર, સિદ્ધાંત
તિવિહે	- ગ્રામ પ્રકારનાં
પત્રતે	- કથાં છે.
તં જ્ઞા	- તે જેમ છે તેમ (કહું છું)
સુત્તાગમે	- સૂત્રરૂપ આગમ
અત્યાગમે	- અર્થરૂપ આગમ
તહુભયાગમે	- સૂત્ર અને અર્થ ઉભયરૂપ આગમ

એવા શ્રી જ્ઞાનને વિષે જે અતિચાર લાગ્યા હોય તે
આલોઉં છું -

જી	- જે
વાઈદ્ધ	- સૂત્રો આધા પાછા ભજાયા હોય, (૧)
વચ્ચામેલિયં	- જ્ઞાન વિના સૂત્રો ભજાયા હોય, (૨)
હીણાફૂખરં	- અક્ષરો ઓછા ભજાયા હોય (૩)
અર્યફૂખરં	- અક્ષરો અધિક ભજાયા હોય, (૪)
પયહીણં	- પદ ઓછું ભજાયું હોય, (૫)
વિષાયહીણં	- વિનય રહિત ભજાયું હોય, (૬)
જોગહીણં	- મન, વચ્ચન, કાયાના અસ્થિર યોગે ભજાયું હોય, (મન ક્યાંય ફરતું હોય અને ભજતો હોય) (૭)
ઘોસહીણં	- શુદ્ધ ઉચ્ચાર વિના ભજાયું હોય, (૮)

શ્રાવક સામાચિક પ્રતિક્રમણ સૂત્ર

- સુદૃદ્ધિનં - રૂહું જ્ઞાન અવિનીતને દીધું હોય, (૮)
- દુદૃપડિચ્છયં - દુષ્ટભાવથી જ્ઞાન લીધું હોય, (૧૦)
- અકાલે કાંઈ સજ્જાઓ - અકાળે સજ્જાય કરી હોય, * (૧૧)
- કાલે ન કાંઈ સજ્જાઓ - સજ્જાય કરવાના સમયે સજ્જાય ન કરી હોય. (૧૨)
- અસજ્જાઈએ સજ્જાયં - સજ્જાય ન કરવા યોગ્ય સ્થળે સજ્જાય કરી હોય, (૧૩)
- સજ્જાઈએ ન સજ્જાયં - સજ્જાય કરવા યોગ્ય સ્થળે સજ્જાય ન કરી હોય. (૧૪)

એમ ભાષાતાં, ગણાતાં, ચિંતવતાં ચૌદે પ્રકારે કોઈ પાપ દોષ લાગ્યો હોય, તો અરિહંત અનંત સિદ્ધ ભગવાનની સાખે તરસ્સ મિચ્છા મિ દુક્કડં.

* બાર અકાળની સમજણ-પ્રાતઃકાળ, મધ્યાન્હકાળ, સંધ્યકાળ અને મધ્યરાત્રિ. તેમાં સવારે અને સાંજે સંધ્યાની એક ઘડી પહેલાં અને એકઘડી પછી અને મધ્યાન્હકાળે, મધ્યરાત્રિએ ગ્રાયઃ ૧૨ થી ૧ વાગ્યા સુધી તેમજ (૧) ચૈત્ર સુદ પૂનમ અને ચૈત્ર વદ એકમ, (૨) અષાઢ સુદ પૂનમ, વદ એકમ, (૩) ભાదરવા સુદ પૂનમ, વદ એકમ, (૪) આસો સુદ પૂનમ, વદ એકમ, તથા (૫) કારતક સુદ પૂનમ, વદ એકમ, આટલા દિવસો અકાળનાં છે, તે સમયમાં સૂત્રોનાં મૂળ પાઠ વંચાય કે ભાગ્યાય નહિ. (ફાગણ સુદ પૂનમ-હોળીની તથા ધુળેટીની અસ્વાધ્યાય આગમમાં બતાવેલ નથી. પરંતુ પરંપરાથી મનાય છે).

પાઠ : ૫ : દર્શન સમ્યકૃત્વ

“અરિહંતો મહદેવો, જાવજીવાએ સુસાહુણો ગુરુણો,
જિષા પત્રતં તત્તં, ઈય સમ્મતં મહે ગહિયં”

(સાચા દેવ, ગુરુ અને ધર્મને ઓળખી તેમના પર શ્રદ્ધા રાખવાનો)

દંસણ	- દર્શન-યથાર્થ શ્રદ્ધા
સમકિત	- સુદેવ, સુગુરુ, સુધર્મ પ્રત્યે સાચી શ્રદ્ધા તે દર્શન.
પરમત્થ	- એવા પરમ અર્થને બતાવનાર તે (સિદ્ધાંતનો)
સંથવો	- પરિચય કરવો,
વા	- અને, અથવા
સુદિક્ષ	- ભલી દ્રષ્ટિથી જોયા છે, (એવા)
પરમત્થ	- સિદ્ધાંતને, તત્ત્વને, (એવા સાધુજીની)
સેવણા	- સેવા કરવી, ઉપાસના કરવી,
વા વિ	- અને વળી
વાવત્ર	- શાન-દર્શન-ચારિત્રને પામીને બષ્ટ થયા હોય, તેની તેમજ
કુદંસણ વજ્ઞણા	- ખોટી શ્રદ્ધાનો (પાપ કરીને ધર્મ માનનારાઓનો) જેનું દર્શન ખોટું છે તેવા ઉત્ત પાખંડીના મતનો ત્યાગ કરવો.

૧. કેવલી (વિતરાગ) પ્રરૂપિત ધર્મની દીક્ષા લઈને પછી પાળી ન શકવાથી દીક્ષા મૂકી દીધી હોય, શ્રદ્ધા અને ચારિત્ર બન્નેથી બષ્ટ થયા હોય તેઓનો પરિચય ન કરવો.. કારણ કે તેઓનો પરિચય કરવાથી આપણા ઉચ્ચ વિચારો પણ મલિન થઈ જાય છે.

શ્રાવક સામાયિક પ્રતિક્રિયા સૂત્ર

સમ્મત સદ્ગુણા	- સમક્રિતની શ્રદ્ધા
એહવા સમક્રિતના	- એવા સમક્રિત જીવ
સમજોવાસઅણાં	- શ્રમજોપાસક શ્રાવકને
સમ્મતસ્સ	- સમક્રિતના
પંચ અર્દ્યારા	- પાંચ અતિચાર
પેયાલા	- પ્રધાન, મુખ્ય, પાતાળ કળશા સમાન, મોટા ભયંકર,
જાણિયવ્યા	- જાગ્રવા યોગ્ય (પણ)
ન સમાયરિયવ્યા	- આચરવા યોગ્ય નહિ,
તં જહા	- તે જેમ છે તેમ
તે આલોઉં	- કહું છું.
શંકા	- જૈનધર્મને વિષે શંકા રાખવી તે
કુંખા	- મિથ્યાત્વીના મતની ઈચ્છા કરવી ^૨
વિતિગિચ્છા	- કરણીના ફળમાં સંદેહ રાખવો, ^૩
પરપાસંડ પરસંસા	- બીજા પાખંડીમતના વખાણ કર્યા હોય

૧. જૈનધર્મ સાચો હશે કે ખોટો ? આવી શંકા ન કરવી. અને કોઈ વાત ન સમજાતી હોય તે ગુરુજીને પૂછી શંકાનું નિવારણ કરવું, પણ આપણો કેવલી પ્રતૃપિત ધર્મ સાચો હશે કે કેમ ? વગેરે શંકા કરવી નહિ. આપણો કેવલી પ્રતૃપિત જૈનધર્મ સો ટચનું સોનું છે, તેમાં શંકા કરવા જેવું કાંઈ છે જ નહિ, એવી દ્રઢ શ્રદ્ધા રાખવી.

૨. અન્ય ધર્મના ઠાક્કાઠ આંદબર દેખી તેવા ધર્મની ઈચ્છા કરવી તે. એટલો નિશ્ચય રાખવો કે ધામધૂમ ધમાલ હોય ત્યાં ધર્મ હોઈ શકે જ નહિ. ધર્મ તો શાંતિમાં જ છે.

૩. હું આટલી ધર્મજીયા કરું છું. તેનું ફળ મળશે કે નહિની વગેરે શંકા કરવી, દરેક ચીજનું ફળ હોય છે, તો સામાયિક, સંવર, પૌષ્ઠ વગેરેનું ફળ કેમ ન હોય ? ફળ જરૂર મળશે જ અને તે પણ અતિ ઉત્તમ. માટે જરા પણ શંકા રાખ્યા વગર એકાંત કર્માની નિર્જરા માટે શુભકરણી કરવી.

શ્રાવક સામાયિક પ્રતિકમણ સૂત્ર

પરપાસંડ સંથવો - બીજા પાખંડી મતનો પરિચય કર્યો
હોય,

એમ સમકિતરૂપ રત્નને વિષે મિથ્યાત્વરૂપ ૨૭, મેલ, દોષ
લાગ્યો હોય, તો અરિહંત, અનંત સિદ્ધ ભગવાનની સાખે તરસ્સ
મિથ્યામિ દુક્કડં

પાઠ : ૬ : પહેલું અણુગ્રત

(સ્થૂલ-પ્રાણાત્તિપાત-વેરમણ ગ્રત)

મોટી જીવહિસાનો ત્યાગ

(આત્માનો ગુણ અહિસક હોવા છતાં, એ ભાવથી બષ થઈ,
હિસકભાવ ઉત્પત્ત કરી, ત્રસ, સ્થાવર જીવોની હિસા કરીને જે કર્મો
બાંધેલાં છે, તે તોડી મારા અમરપદનું રક્ષણ કરવા માટે ત્રસ જીવોની
હિસા નહિ કરવા વિષે.)

પહેલું - પહેલું

અણુગ્રત - નાનુ ગ્રત *

૧. પહેલાં પોતાનાં ધર્મનાં ઉર શાસ્ત્રો વાંચી - વિચારી પછી ગીતાર્થ
હોય તે અન્ય ધર્મના પુસ્તકો વાંચે તો વાંધો નહિ, પણ પોતાના ધર્મમાં
શું કહું છે, તે જાણ્યા વગર બીજા ધર્મનો પરિચય કરે, તો જરૂર તે
બીજા ધર્મમાં ફસાઈ જાય આજકાલ આવું બહુ જોવામાં આવે છે.

* સાધુ-સાધીજીને મન-વચન-કાયાથી હિસા કરવી નહિ, કરાવવી
નહિ તથા અનુમોદવી નહિ, એમ નવું કોટિએ જિંદગીપર્યતના
પચ્ચકખાળ હોય છે, તેથી તેઓનાં ગ્રતને 'મહાગ્રતો' કહેવામાં આવે છે.
જ્યારે શ્રાવક-શ્રાવિકાઓને મન, વચન, કાયાથી ત્રસ જીવોની હિસા
કરવી નહિ, કરાવવી નહિ, એમ છ કોટિએ પચ્ચકખાળ હોય છે. તેથી
'અણુગ્રતો' કહેવાય છે.

શ્રાવક સામાચિક પ્રતિક્રમણ સૂત્ર

થૂલાઓ	- મોટા
પાણાઈવાયાઓ	- પ્રાણોના વ્યતિપાત-હિસાથી
વેરમણાં	- નિવર્તું છું
ત્રસ જીવ	- હાલતા ચાલતા જીવો (જેવા કે)
બે ઈદિય	- બે ઈદ્રિયવાળા (સ્પર્શ, રસ)
તેઈદિય	- ત્રણ ઈદ્રિયવાળા (સ્પર્શ, રસ, ધ્રાણ)
ચઉરિંદિય	- ચાર ઈદ્રિયવાળા (સ્પર્શ, રસ, ધ્રાણ, ચક્ષુ)
પંચેદિય	- પાંચ ઈદ્રિયવાળા (સ્પર્શ, રસ, ધ્રાણ, ચક્ષુ અને કાન)
જીવ	- જીવોને
જાણી પ્રિધી	- જાણીને, ઓળખ્યા છતાંયે,
સ્વ સંબંધી	- પોતાના તથા સંબંધીના
શરીર ભાંડેલા	- શરીરમાં પીડા ઉપજાવે તેવા
પીડાકારી	
સ અપરાધી	- પોતાનો અપરાધ કર્યો હોય તેવા (પણ)
વિગલેન્દ્રિય વિના	- બે, ત્રણ, ચાર ઈન્દ્રિયવાળા જીવો વર્જને બાકીના પંચેન્દ્રિય જીવોને,
આકુણ્ઠિ	- જાણી જોઈને ઈરાદાપૂર્વક
હણવા નિમિત્ત	- હણવાની બુદ્ધિએ
હણવાના	
પચ્યક્રખાણ	- મારી નાખવાનાં પ્રત્યાખ્યાન
(તથા સૂક્ષ્મ એકેન્દ્રિય પણ હણવાના પચ્યક્રખાણ ×)	

× સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો આપણાથી માર્યા મરતા નથી, હણ્યા
હણાતા નથી, પણ પચ્યક્રખાણ કર્યો ન હોય તો, કિયા આવે છે.
તેથી આ વાક્ય બોલાય છે.

શ્રાવક સામાચિક પ્રતિક્રમણ સૂત્ર

જાવજળવાએ	- જવું ત્યાં સુધી
દુવિહં	- બે કરણો
તિવિહેણં	- ત્રણ જોગે કરી
ન કરેમિ	- હું પોતે (ત્રસજીવોની) હિંસા કરું નહિ, અને (પહેલી કિયા)
ન કારવેમિ	- હું બીજા પાસે (ત્રસજીવોની) હિંસા કરાવું નહિ (બીજ કિયા),
મણસા	- મને કરી
વયસા	- વચને કરી
કાયસા	- કાયાએ કરી ત્રણ યોગ ($2 \times 3 = 6$) કોટીએ હણવાનાં પ્રત્યાખ્યાન
એહવા પહેલા	- એવા પહેલા
થુલ પ્રાણાતિપાત	- મોટા જવની હિંસાથી
વેરમણં વ્રતના	- નિવર્તવાના, વ્રતના
પંચ અઈયારા	- પાંચ અતિચાર
પેયાલા	- પાતાળ કળશા સમાન મોટા
જાણિયવ્યા	- જાણવા યોગ્ય (પણ)
ન સમાયરિયવ્યા	- આચરવા યોગ્ય નહિ
તં જહા	- તે જેમ છે તેમ
તે આલોઉં	- કહું છું.
બંધે	- ત્રસ જવને ગાઢે બંધને બાંધ્યા હોય,
વહે	- ત્રસ જવને લાકડી પ્રમુખના પ્રણાર કર્યા હોય, (નાક, કાનાદિ અવયવો છેદાં હોય,)
છવિચ્છેએ	

શ્રાવક સામાચિક પ્રતિકમણ સૂત્ર

અઈભારે - ગજા ઉપરાંત ભાર ભર્યો હોય, અથવા
ગજા ઉપરાંત કામ કરાવ્યું હોય.

ભત્તપાણ વોચ્છેએ - દ્વેષબુદ્ધિથી ભોજન-પાણીની અંતરાય પાડી
હોય,

એહવા પહેલા વ્રતને વિષે આજના દિવસ સંબંધી કોઈ
પણ પાપ દોષ લાગ્યો હોય તો; અરિહંત અનંતા સિધ્ય કેવળી
ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છા મિ દુકુંડ.

**પાઠ : ૭ : બીજું અણુંત
(સ્થૂલ-મૃષાવાદ-વેરમણ વ્રત)**

મોટું જૂઠું બોલવાનો ત્યાગ

(આપણો આત્મા સત્ય ભાવથી ભરપૂર હોવા છતાં સત્યથી
બણ થઈ અસત્ય ઉત્પત્ત કરી દરેક પદાર્થ પ્રત્યે અસત્ય બોલી જે
કર્મા બાંધે છે, તે કર્માથી મુક્ત થઈ સત્યનું રક્ષણ કરવા માટે
મોટું જૂઠ નહિ બોલવા સંબંધી)

બીજું અણુંત	- બીજું નાનું વ્રત
થૂલાઓ મુસાવાયાઓ	- મોટું જૂઠ બોલવાથી
વેરમણાં	- નિર્વર્તું છું
કત્તાલિક	- વરકન્યાના રૂપ, ગુણ અને ઉભ્મર સંબંધી જૂઠ,
ગોવાલિક	- ગાય, ભેંસ વગેરે ચોપગા પશુમાં રૂપ, ગુણ, વર્ષ સંબંધી જૂઠ,
ભોમાલિક	- જમીન સંબંધી જૂઠ,
થાપણમોસો	- થાપણ ઓળવવા સંબંધી જૂઠ

શ્રાવક સામાયિક પ્રતિકમણ સૂત્ર

મોટકી કુડી સાખ	- મોટી ખોટી સાકી આપવા સંબંધી જૂઠ,
ઈત્યાદિ મોટકુ જુહુ	બોલવાનાં પચ્ચકુખાણા, જાવજળવાએ,
દુઃખિં, તિવિહેણાં, ન કરેમિ, ન કારવેમિ, મણાસા, વયસા,	
કાયસા; એવા બીજા થૂલ મૃષાવાદ વેરમણાં પ્રતના પંચ	
અઈયારા, જાણિયવ્યા, ન સમાયરિયવ્યા, તં જહા તે આલોઉ	
સહસાભકુખાણો	- ઉતાવળમાં ધ્રાસકો પડે તેવું બોલવું.
રહસાભકુખાણો	- કોઈની છાની વાત ઉઘાડી કરવી.
સદાર મંતલેએ*	- પોતાની સ્ત્રીનાં મર્મ ઉઘાડાં કરવાં.
મોસોવએસે	- ખોટો ઉપદેશ, ખોટી સલાહ આપવી.
કુડલેહકરણો	- ખોટા લેખ દસ્તાવેજ, બીલ, ચોપડા વગેરે લખ્યા હોય,

એહવા બીજા પ્રતને વિષે આજના દિવસ સંબંધી કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો; અરિહંત અનંતા સિદ્ધ કેવળી ભગવાનની સાકીએ તસ્સ મિચ્છા મિ દુકું.

પાઠ : ૮ : ત્રીજું અણુવ્રત

(સ્થૂલ અદત-ત્યાગ પ્રત)

મોટી ચોરી કરવાનો ત્યાગ

ત્રીજું અણુવ્રત	- ત્રીજું નાનું પ્રત
થૂલાઓ અદિત્રાદાણાઓ	- મોટી ચોરી કરવાથી
વેરમણાં	- નિવર્તું છું.
ખાતરખણી	- ખાતર પાડી,

* શ્રાવિકાઓએ 'સભતરી-મંતલેએ' પાઠ બોલવો.

શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર

- | | |
|--------------------------|---|
| ગાંઠડી છોડી | - ગાંઠડી છોડી, ખીસાં કાતરી, |
| તાળા પર કુંચીએ કરી | - કોઈનું તાળું બીજુ ચાવીથી
ઉધાડીને લેવું. |
| પડી વસ્તુ ઘણીયાતી જાણી - | રસ્તામાં પડેલી વસ્તુની પોતે
માલિકી કરી લેવી. |

ઈત્યાદિ મોટકું અદત્તાદાન લેવાનાં પચ્ચકુખાણા, સગાસંબંધી
તથા વ્યાપાર સંબંધી નભરમી × વસ્તુ ઉપરાંત અદત્તાદાન
લેવાનાં પચ્ચકુખાણા; જાવજજીવાએ, દુવિહં, તિવિહેણં, ન
કરેમિ, ન કારવેમિ, મણસા, વયસા, કાયસા; એવા ત્રીજા થૂલ
અદત્તાદાન વેરમણં ક્રતના પંચ અઈયારા, જાણિયવ્યા, ન
સમાયરિયવ્યા, તં જહા તે આલોઉં

- | | |
|---|--|
| તેનાહડે | - ચોરાઉ વસ્તુ લીધી હોય, |
| તક્કરઘારોગે | - ચોરને મદદ કરી હોય, |
| વિરુદ્ધ રજ્ઝાઈકુમે | - રાજ્ય વિરુદ્ધ દાણચોરી વગેરે કરી
હોય, |
| ફૂડતોલે-ફૂડમાણો | - ખોટાં તોલાં, ખોટાં માપ રાખ્યાં
હોય, |
| તઘડિરુવગ્ગ વવહારે | - સારી વસ્તુ દેખાડી નરસી આપી
હોય, ભેળસેળ કરી આપી હોય, |
| એહવા ત્રીજા ક્રતને વિષે આજના દિવસ સંબંધી કોઈ પણ
પાપ દોષ લાગ્યો હોય તો; અરિહંત અનંતા સિધ્ય કેવળી
ભગવાનની સાક્ષીએ તસ્સ મિથ્યા મિ દુકું. | |

× કલમ, પેન્સીલ વગેરે તુચ્છ વસ્તુ લેવાથી “આ ચોરી કરે
છુ”, એવો બ્રમ ન થાય, તેવી ચીજો.

પાઠ : ૮ : ચોથું આણુગ્રત

(સ્વદાર - સંતોષગ્રત)

(આત્મા વેદાતીત હોવા છતાં એ ભાવથી બ્રહ્મ થઈ વેદભાવ (સ્ત્રી, પુરુષ, નપુંસક ભાવ) ઉત્પત્ત કરી દેવ-દેવીઓ, મનુષ્ય-મનુષ્યાણી, તિર્યંચ-તિર્યંચાણીઓમાં ઉત્પત્ત થઈ, સ્ત્રી, પુરુષ, નપુંસકપણે, મન, વચન, કાયાએ, કરી દ્રષ્ટિ, ખોરાક, પોષાક, ભાષાપણે વિવિધ પ્રકારની અભ્રલયર્થની કિયા કરી, કરાવી જે ચીકણાં કર્મા બાંધેલાં છે, તે કર્માનો ક્ષય કરી, મારા અવેદીભાવનું રક્ષણ કરવા માટેનું અને પરસ્તીનો ત્યાગ કરવા સંબંધીનું ગ્રત)

ચોથું આણુગ્રત	- ચોથું નાનું ગ્રત
થૂલાઓ મેહુણાઓ	- મોટકા મૈથુનથી
વેરમણાં	- નિવર્તું છું.
સદાર * સંતોસિએ	- પોતાની સ્ત્રીથી સંતોષ રાખવો
અવસેસ મેહુણાવિહિના	તે સિવાય બીજી કોઈ સ્ત્રીની
પચ્યકુખાણ	- સાથે મૈથુન સેવવાના પ્રત્યાખ્યાન
અને જે સ્ત્રી-પુરુષને મૂળ થકી કાયાએ કરી મેહુણ સેવવાનાં પચ્યકુખાણ હોય તેને દેવતા, મનુષ્ય, તિર્યંચ સંબંધી મેહુણાનાં પચ્યકુખાણ જાવજજીવાએ, દેવતા સંબંધી દુવિહં, તિવિહેણાં, ન કરેમિ, ન કારવેમિ, મણસા, વયસા, કાયસા, મનુષ્ય તિર્યંચ સંબંધી.	
એગવિહં	- એક કરણ
એગવિહેણાં	- એક જોગે

* બહેનોએ અહીં 'સભતાર-સંતોસિએ' પાઠ બોલવો.

- ન કરેમિ, કાયસા - કાયાથી મૈથુન સેવું નહિ
- એહવા ચોથા થૂલ મેહુણ વેરમણાં વ્રતના પંચ અઈયારા,
જાણિયવ્વા, ન સમાયરિયવ્વા, તં જહા તે આલોઉં :
- ઈતરિય પરિગણિયાગમણો - નાની ઉંમરની પોતાની પરણેલી
સ્ત્રી સાથે ગમન કર્યું હોય,
- અપરિગણિયાગમણો - જે સ્ત્રીની સાથે સગાઈ થઈ છે
પણ લગ્ન થયાં નથી તેની સાથે
ગમન કર્યું હોય,
- અનંગકીડા - સ્વભાવિક અંગ સિવાય અનેરા
અંગે કામ કીડા કરી હોય,
- પરવિવાહકરણો - પોતાના પુત્ર-પુત્રી કે પોતાના
પરિવાર સિવાય બીજાના વિવાહ
મેળવી આપ્યા હોય,
- કામભોગેસુ તિવ્વાભિલાસા - કામભોગને વિષે તીવ્ર અભિલાષા
કરી હોય,

એહવા ચોથા વ્રતને વિષે આજના દિવસ સંબંધી કોઈ પણ
પાપ દોષ લાગ્યો હોય તો; અરિહંત અનંતા સિદ્ધ કેવળી
ભગવાનની સાક્ષીએ તસ્સ મિથ્યા મિ દુક્કડં.

પાઠ : ૧૦ : પાંચમું અણુવ્રત

(નવ પ્રકારના પરિગ્રહ મર્યાદા-વ્રત)

- પાંચમું અણુવ્રત
- થુલાઓ પરિગણાઓ
- વેરમણાં
- ખેતર, વાડી, બાગ, બગીચા
- પાંચમું નાનું વ્રત
- સ્થૂલ પરિગ્રહથી
- નિવર્તું છું.

શ્રાવક સામાયિક પ્રતિક્રિમણ સૂત્ર

યથાપરિમાણ

- વગેરે ખુલ્લી જમીન અને
- ઘર, દુકાન, વખાર આદિ ઢાંકી જમીનની જે મર્યાદા કરી હોય,
- રૂપું તથા સોનાની જે પ્રમાણે
- મર્યાદા કરી હોય,
- ચલણી નાણું અને ચોવીસ જાતનાં ધાન્યની જે પ્રમાણે મર્યાદા કરી હોય,
- બે પગાં મનુષ્ય, પક્ષી અને ચોપગાં પશુની જે પ્રમાણે મર્યાદા કરી હોય.

દુપદ-ચઉપદનું

યથાપરિમાણ

- ઘરવખરીની જે પ્રમાણે મર્યાદા કરી હોય,
- ધરવખરીની જે પ્રમાણે મર્યાદા કરી હોય,

કુવિયનું યથાપરિમાણ

- ધરવખરીની જે પ્રમાણે મર્યાદા કરી હોય,

એ યથા પરિમાણ કીધું છે, તે ઉપરાંત પોતાનો પરિગ્રહ કરી રાખવાનાં પચ્ચકખાણ જાવજજીવાએ

એગવિહં

- એક કરણ

તિવિહેણં

- ત્રણ યોગથી

ન કરેમિ, મણસા, વયસા, કાયસા, એવા પાંચમા થૂલ પરિગ્રહ પરિમાણ વેરમણાં વ્રતના પંચ અઈયારા, જાણિયવ્યા, ન સમાયરિવ્યા, તં જહા તે આલોઉં : -

ખેત-વત્સુ પમાણાઈકુમે

- ખેતર આદિ ખુલ્લી અને ઘર આદિ ઢાંકી જમીનની મર્યાદાનું ઉલલંઘન કરેલ હોય,

હિરણ્યા-સુવણ્ણા પમાણાઈકુમે

- રૂપા અને સોનાની મર્યાદાનું ઉલલંઘન કરેલ હોય,

શ્રાવક સામાયિક પ્રતિકમણ સૂત્ર

ધન-ધાન પમાણાઈકુમે - રોકડ નાણું તથા અનાજની મર્યાદાનું ઉલ્લંઘન કરેલ હોય,

દુપદ-ચઉપદ-પમાણાઈકુમે - મનુષ્ય, પક્ષી આદિ બે પગાં અને પશુ આદિ ચોપગાંની મર્યાદાનું ઉલ્લંઘન કરેલ હોય.

કુવિય પમાણાઈકુમે - ઘરવખરીની મર્યાદા ઓળંગી હોય.

એહવા પાંચમા વ્રતને વિષે આજના દિવસ સંબંધી કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો; અરિહંત અનંતા સિધ્ય કેવળી ભગવાનની સાક્ષીએ તસ્સ મિથ્યા મિ દુકુંડ.

પાઠ : ૧૧ : છહું દિશા પરિમાણ વ્રત

(પહેલું - ગુણપ્રત)

છહું દિસિ વ્રત - છહું દિશાઓની મર્યાદા બાંધવાનું વ્રત

ઉદ્દિસિનું યથા પરિમાણ - ઊંચી દિશાની જે મર્યાદા કરી હોય,

અધોદિસિનું યથા પરિમાણ - અધો (નીચી) દિશાની જે મર્યાદા કરી હોય,

તિરિયદિસિનું યથા પરિમાણ - તિરછી દિશા=પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર-દિશાની જે મર્યાદા કરી હોય,

શ્રાવક સામાયિક પ્રતિકમણ સૂત્ર

- એ યથા પરિમાણ કીધું છે, તે ઉપરાંત સઈચ્છાએ+કાયાએ
જઈને પાંચ × આશ્રવ સેવવાનાં પચ્ચકખાણા, જાવજજીવાએ
દુવિહં, તિવિહેણાં, ન કરેમિ, ન કારવેમિ, મણસા, વયસા,
કાયસા, એવા છઢા દિસિ વેરમણાં ક્રતના પંચ અઈયારા,
જાણિયવ્યા, ન સમાયરિયવ્યા, તં જહા તે આલોઉં
ઉડુઠદિસિષ્પમાણાઈકુમે* - ઊંચી દિશાની મર્યાદાનું ઉલ્લંઘન
કરેલ હોય,
અધોદિસિષ્પમાણાઈકુમે - નીચી દિશાની મર્યાદાનું ઉલ્લંઘન
કરેલ હોય.,
તિરિય દિસિષ્પમાણાઈકુમે - તિર્યગ=પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ,
અને ઉત્તર દિશાની મર્યાદાનું
ઉલ્લંઘન કરેલ હોય,
ખેત વુડઢી - એક દિશાની મર્યાદા ઘટાડી બીજ
દિશાની મર્યાદા વધારી હોય.
સઈઅંતરદ્વાએ - સંદેહ પડ્યા છતાં આગળ વધાયું
હોય

એહવા છઢા ક્રતને વિષે આજના દિવસ સંબંધી જે કોઈ
પણ પાપ દોષ લાગ્યો હોય તો; અરિહંત અનંતા સિદ્ધ કેવળી
ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છા મિ દુકુડં.

+ પોતાની ઈચ્છાથી મર્યાદા કરેલ જગ્યાની બહાર જવું નહિ.
× મિથ્યાત્વ, અપ્રત, પ્રમાદ, કષાય, અશુભ યોગ: એ પાંચ
આશ્રવ છે.

* ગિરનારની ટોચ પહોંચતાં પંથ જ માઈલનો થાય પરંતુ
ઊંચાઈ તો એક જ માઈલથી ઓછી છે તેથી ઊંચાઈ એક માઈલ
જ સમજવી તેવી જ રીતે બધી દિશામાં સમજવું.

પાઠ : ૧૨ : સાતમું બ્રત

(ઉપભોગ - પરિભોગ પરિમાણ - બીજું ગુણવ્રત)

સાતમું બ્રત

- સાતમું બ્રત

ઉવભોગ

- એક વખત ભોગવાય તે ખાન,
પાન આદિ

પરિભોગવિહિં

- વારંવાર ભોગવાય તે (કપડાં
ઘરેણાં વગેરે) તે મર્યાદા
ઉપરાંતના પચ્ચક્ખાણ

પચ્ચક્ખાયમાણે

- પચ્ચક્ખાણ સાથે કરતાં થકાં

ઉદ્ધંષિયાવિહિં

- અંગલૂચ્છા, ટુવાલ વગેરેની જાત
અને સંખ્યાની મર્યાદા (૧)

દંતણવિહિં

- દાતણાની જાત અને સંખ્યાની
મર્યાદા (૨)

ફલવિહિં

- અરીઠા પ્રમુખ નાહવાના ફળની
જાત અને સંખ્યાની મર્યાદા (૩)

અભ્યંગાણવિહિં

- મર્દન કરવા યોગ્ય તેલની જાત
અને તેનાં પ્રમાણની મર્યાદા (૪)

ઉવ્યક્તણવિહિં

- પાઠી વગેરે શરીરે ચોળવાની
વસ્તુની જાત અને તેની મર્યાદા
(૫)

મજૂરણવિહિં

- નહાવાના પાણીની મર્યાદા (૬)
(એક દિવસમાં કેટલી વાર અને
કેટલા પાણીએ સ્નાન કરવું)

વત્થવિહિં

- પહેરવાના વસ્ત્રોની મર્યાદા,
અગર એક વરસમાં પોતાનાં માટે

શ્રાવક સામાચિક પ્રતિક્રમણ સૂત્ર

|||

કેટલા રૂપિયાનાં વસ્ત્ર રાખવા.

(૭)

વિલેવણવિહિં

- સુખડ, અતર, તેલ, આદિ વિલેપન કરવાની વસ્તુની મર્યાદા

(૮)

પુષ્ટવિહિં

- ફૂલની જાત; સંખ્યાની મર્યાદા

(૯)

આભરણવિહિં

- ઘરેણાંની જાત, સંખ્યાની મર્યાદા

(૧૦)

ધૂવણવિહિં

- ધૂપની જાત; વજનની મર્યાદા

(૧૧)

પેઢવિહિં

- પીવાનાં પદાર્થાની અને માપની મર્યાદા (ચા, દૂધ ઓસડ આદિ)

(૧૨)

ભક્ષણવિહિં

- સુખડી વગેરે ભિષાનાની જાત અને તેનાં વજનની મર્યાદા (૧૩)

ઓદણવિહિં

- ચોખા વગેરે ૨૪ પ્રકારના ધાન્યની જાત અને તેનાં માપની મર્યાદા (૧૪)

સૂવવિહિં

- કઠોળની જાત; માપની મર્યાદા (૧૫)

વિગયવિહિં

- ધી, તેલ, દૂધ, દહી, ગોળ, સાકર વગેરે વસ્તુની જાત અને તેનાં માપની મર્યાદા (૧૬)

સાગવિહિં

- શાકની જાત, વજનની મર્યાદા (૧૭)

શ્રાવક સામાયિક પ્રતિક્રિમણ સૂત્ર

માહુરયવિહિં

- મધુરા ફળની જાત; માપની મર્યાદા (તરખૂચ, દ્રાક્ષ વગેરે)

જેમણવિહિં

- જમવાનાં પદાર્થોની મર્યાદા (૧૯)

પાણિયવિહિં

- પીવાના પાણીની મર્યાદા (૨૦)

મુહવાસવિહિં

- મુખવાસની જાત અને માપની મર્યાદા (સોપારી, લવિંગ વગેરે (૨૧))

વાહણવિહિં

- બેસવા માટે વાહનની જાત અને સંખ્યાની મર્યાદા (૨૨)

ઉવાણાહવિહિં

- પગરખાંની જાત અને મર્યાદા (૨૩)

સયણવિહિં

- સુવા-બેસવાનાં સાધનોની જાત અને સંખ્યાની મર્યાદા (૨૪)

સચિતવિહિં

- સચેત વસ્તુ ખાવાની જાત અને સંખ્યાની મર્યાદા (૨૫)

દવ્યવિહિં

- ખાવા-પીવાના દ્રવ્યોની મર્યાદા (૨૬)

ઇત્યાદિનું યથા પરિમાણ કીધું છે, તે ઉપરાંત ઉવભોગ પરિભોગ, ભોગ નિમિત્તે ભોગવવાનાં પચ્ચકખાણ, જાવજજીવાએ ઓગવિહિં, તિવિહેણાં, ન કરેમિ, મણસા, વયસા, કાયસા-એહવા સાતમા ઉવભોગ-પરિભોગ

દુવિહે

- બે પ્રકારે

પત્રતે

- કણ્ણા છે.

તં જહા

- તે આ પ્રમાણે

ભોયણાઉ ય

- ભોજન સંબંધી અને

શ્રાવક સામાયિક પ્રતિક્રિયા સૂત્ર

કુભ્રાણ

- કર્મ (વ્યાપાર) સંબંધી

ભોગણાઉ

- ભોજન સંબંધી

સમણોવાસઅણાં

- શ્રમણોપાસક-શ્રાવકને

પંચ અઈયારા, જાણિયાવ્યા, ન સમાયરિયાવ્યા તં જહા તે
આલોઉં :

સચિતાહારે

- મર્મદાથી ઉપરાંતની સચેત
વસ્તુનો ઉપયોગ થયો હોય.

સચિત પડિબદ્ધાહારે

- સચેત વસ્તુ સાથે લાગેલ અચેત
વસ્તુનો ઉપયોગ થયો હોય
(વૃક્ષને લાગેલો ગુંદર, ઝાડને
લાગેલાં પાકાં ફળ વગેરે)

અખ્યોલિઓસહિ ભક્તભણયા-

થોડી કાચી અને થોડી પાકી
વસ્તુનો ઉપયોગ કર્યો હોય
(તરતનાં તૈયાર કરેલ ખારિયાં
વગેરે)

દુષ્પોલિઓસહિ ભક્તભણયા -

દુષ્પક્રિય એટલે માઠી રીતે પક્વેલી
વસ્તુનો ઉપયોગ કર્યો હોય
(રીંગણાનાં ભડથાં ઓળો, પોંક
વગેરે)

તુચ્છોસહિ ભક્તભણયા

- તુચ્છ આહારનો ઉપયોગ કર્યો
હોય (ખાવું થોડું અને નાખી દેવું
જાણું, શેરડી, સીતાફળ વગેરે)

કુભ્રાણાં

- કર્મ એટલે વ્યાપાર સંબંધી

સમણોવાસઅણાં

- શ્રમણોપાસક - શ્રાવકને

પત્રરસ કુભ્રાણાઈ

- પંદર કર્મદાન (જે કામો તથા

શ્રોવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર

વેપાર કરવાથી ગાડાં પાપ બંધાય
તે)

જ્ઞાણિયત્વા, ન સમાયરિયત્વા, તં જહા તે આલોઉં :

ઈગાલક્રમે

- લુણાર, ભાડભૂંજા વગેરેના ઘંધા
કે-જેમાં અભિનનો આરંભ કરવો
પડે તેવો વેપાર કરવો. (૧)

વણક્રમે

- વનનાં જાડો કાપવાનો વેપાર
કરવો. (૨)

સાડીક્રમે

- ગાહું, રથ, જહાજ, મોટર, આદિ
બનાવી વેચવાનો વેપાર કરવો.
(૩)

ભાડીક્રમે

- ગાડાં, ઘોડાં, મકાન, રીક્ષા,
ટેક્સી વગેરે રાખી ભાડાં ખાવાનો
વેપાર કરવો (૪)

ફોડીક્રમે

- પૃથ્વીનાં પેટ ફોડવાના ઘંધા કર્યા
હોય (૫) (કૂવા, વાવ, તળાવ
આદિ ખોદાવવાના ઘંધા)

દંતવાણિજ્ઝે

- દાંત, હાડકાં, શીંગડા વગેરેનો
વેપાર કર્યા હોય. (૬)

લક્ષ્યવાણિજ્ઝે *

- લાખ, રંગ, મીણ આદિનો વેપાર
કર્યા હોય. (૭)

કેસવાણિજ્ઝે

- ચમરી ગાય આદિનાં કેશ
(વાળ)નો વેપાર કર્યા હોય. (૮)

* 'ભગવતીસૂત્ર'માં ઉપર મુજબ કર્મદાનનો કમ આપેલ છે.

શ્રાવક સામાચિક પ્રતિકમણ સૂત્ર

રસવાણિક્રે

- દાહુ, માંસ, મધ, માખળા,
ચરબી, આદિ રસનો વેપાર કર્યો
હોય. (૮)

વિસવાણિક્રે

- જેર, અફીણા, સોમલ, જંતુ
મારવાની દવા આદિનો વેપાર
કર્યો હોય. (૧૦)

જંત પિલણ કર્મે

- તલ, શેરડી, મગફળી, કપાસ,
બીયા વગેરેને ઘાડી, ચરખાદિ
સંચાઓ વડે પીલવાનો વેપાર કર્યો
હોય. (૧૧)

નિષ્ઠંછણકર્મે

- અંગોપાંગ છેદવા, સ્ત્રી, પુરુષ,
આખલા, ઘોડા આદિને ખસી કર્યા
હોય, ડામ દીધા હોય. (૧૨)

દવણિદાવણિયા

- જંગાલ, ખેતર, પર્વત આદિને
આગ લગાડવાના વેપાર કર્યો
હોય. (૧૩)

સર દહ તલાગ પરિસોસણયા - સરોવર, કૂવા, તળાવ વગેરે
ઉલેચવાના વેપાર કર્યો હોય
(૧૪)

અસઈ જણ પોસણયા

- હિંસક પશુ, ગુલામ, દુરાચારી
મનુષ્યો વગેરેનું આજીવિકા અર્થ
પાલનપોષણ કર્યું હોય (૧૫) *

એહવા સાતમા વ્રતને વિષે આજના દિવસ સંબંધી પાંચ

* આ પંદર જાતના વેપાર મહાપાપથી ભરેલા છે, તેથી
શ્રાવકોએ આમાંના કોઈ પણ વેપાર કરવાં જોઈએ નહિ.

શ્રાવક સામાયિક પ્રતિકીમણ સૂત્ર

ભોજનના અતિચાર અને પંદર કર્માદાન સંબંધી કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો; અરિહંત અનંતા સિધ્ય કેવળી ભગવાનની સાક્ષીએ તસ્સ મિથ્યા મિ દુક્કડ.

પા� : ૧૩ : આઠમું વ્રત

(અનર્થદંડ ત્યાગ - ત્રીજું ગુણવ્રત)

આપણો આત્મા વિના પ્રયોજને દંડાય છે તેનાથી અટકવા વિષે
આઠમું વ્રત - આઠમું વ્રત

અણાત્મદંડનું વિરમણાં - વિના પ્રયોજને આત્મા દંડાય છે,
તેથી નિવર્તું છું.

ચારિવ્યિહે

- ચાર પ્રકારે

અણાત્મદંડે

- અર્થ વિના દંડાય તે અનર્થદંડ

પત્રતે

- કષ્યા છે

તં જહા

- તે આ પ્રમાણે

અવજ્જાણાચરિયં

- માહું ધ્યાન (આર્તધ્યાન અને રૌદ્ર ધ્યાન) ધરવાથી

પમાયાચરિયં

- પ્રમાદ કરવાથી * (બીજાના પ્રાણ હરણ થાય તે, ઓઢા વાસણ ખુલ્લા રાખવા, પોંજ્યા વિના ચૂલા, ગેસ સળગાવવા, ઘી, તેલ, સરબત આદિના વાસણ ખુલ્લા રાખવા.)

* ધાર્મિક કાર્યોમાં આળસ અને પાપના કાર્યમાં ઉઘમ, તેનું નામ પ્રમાદ-તેના પાંચ પ્રકાર છે - મધ્ય, વિષય, કષાય, નિદ્રા અને વિકથા. સાધક આત્માએ પાંચ પ્રમાદનો ત્યાગ કરવો જોઈએ.

શ્રાવક સામાચિક પ્રતિક્રિયા સૂત્ર

હિંસપ્રયાણં

- હિંસા થાય તેવા શસત્રો આપ-
વાથી (ચાપુ-છરી, તલવારે,
રીવોલ્વર ભાલા, બંદૂક વગેરે)

પાવકમોવઅસં

- પાપકર્મનો ઉપદેશ આપવાથી;

એહવા આઈમા અણાત્યદંડ સેવવાનાં પચ્ચાખાણા;
જાવજજીવાએ, દુંઘિં, તિવિહેણાં, ન કરેમિ, ન કારવેમિ,
મણસા, વયસા, કાયસા.

એહવા આઈમા અણાત્યદંડ વેરમણાં વ્રતના પંચ અઈયારા,
જાણિયવ્યા, ન સમાયરિયવ્યા, તં જહા તે આલોઉં : -
કંદપ્પે

- વિષય-વિકાર વધે તેવાં વચ્ચનો
બોલવાં,

કુકુકુઈએ

- આંખ, મુખ, હાથ આદિથી કુચેણા
કરવી.

મોહરિએ

- જેમતેમ નિરર્થક બોલવું, (હાંસી-
મશકરી કરવી; એપ્રિલફુલ
બનાવવા વગેરે)

સંજુતાહિગરણો

- હિંસાકારી જૂનાં હથિયારને
સજાવી નવા કર્યા હોય તેમજ
હિંસા થાય તેવા હથિયાર ભેગા
કર્યા હોય.

ઉવભોગ પરિભોગ

- ૧ ઉપભોગ-૨ પરિભોગની
વસ્તુઓમાં

અઈરતે

- અતિ આસક્ત ભાવ રાખ્યો હોય.

(૧) એકવાર ભોગવાય તેવી. (૨) વારંવાર ભોગવાય તેવી.

શ્રાવક સામાયિક પ્રતિક્રિયા સૂત્ર

એહવા આઠમા પ્રતને વિષે આજના દિવસ સંબંધી કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો; અરિહંત અનંત સિધ્ય કેવળી ભગવાનની સાક્ષીએ તસ્સ મિથ્યા મિ દુકુડં.

પાઠ : ૧૪ : નવમું સામાયિક પ્રત (પહેલું શિક્ષાપ્રત)

- | | |
|---|--|
| નવમું સામાયિક પ્રત | - નવમું સમભાવમાં રહેવારૂપ સામાયિક પ્રત. |
| સાવજજં જોગનું વેરમણાં | - પાપના કાર્યથી નિવર્તુ છું. |
| જાવ નિયમં | જ્યાં સુધી મર્યાદા કરી હોય. |
| પજજુવાસામિ | - ત્યાં સુધી સમભાવમાં રહું. |
| દુવિહં, તિવિહેણાં, ન કરેમિ, ન કારવેમિ, મણસા, વયસા, કાયસા.
એવી મારી (તમારી) સદ્ધહણા પ્રરૂપણાએ કરી સામાયિકનો અવસર આવે અને સામાયિક કરીએ, તે વારે સ્પર્શનાએ કરી શુદ્ધ હોજો ! એહવા નવમા સામાયિક પ્રતના પંચ અઈયારા જાણિયવ્યા ન સમાયરિયવ્યા, તં જહા, તે આલોઉં : - | |
| મણા દુષ્પણિહાણો | - સામાયિકમાં મન માહું પ્રવર્તાવ્યું હોય, |
| વય દુષ્પણિહાણો | - સામાયિકમાં વચન માહું પ્રવર્તાવ્યું હોય, |
| કાય દુષ્પણિહાણો | - સામાયિકમાં કાયા માઠી રીતે પ્રવર્તાવી હોય, |
| સામાઈયસ્સ સઈ અકરણાયા | - સામાયિક વેઠની જેમ, જેમતેમ કરી હોય, સામાયિક કરી છે, |

શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર

સામાઈયસ્સ

છતાં કરી છે કે નથી કરી તેની

ખબર ન રહી હોય;

- સામાયિકનું બરાબર રીતે પાલન
ન કર્યું હોય.

સામાયિકનો સમય પૂર્જ થયા

- પહેલાં પાળી લીધેલ હોય.

અણવણીયસ્સ કરણાયા

- એહવા નવમા પ્રતને વિષે આજના દિવસ સંબંધી કોઈ પણ
પાપ દોષ લાગ્યો હોય તો; અરિહંત અનંતા સિદ્ધ કેવળી
ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છા મિ દુકુડં.

પાઠ : ૧૫ : દશમું દેશાવગાસિક પ્રત

(બીજું શિક્ષાપ્રત)

દશમું દેશાવગાસિકપ્રત - દશમું દિશા અને ભોગોપભોગની
અમુક મર્યાદાવાળું પ્રત

દિન પ્રત્યે પ્રભાત થકી પ્રારંભીને પૂર્વાદિક છ દિશા જેટલી
ભૂમિકા મોકળી રાખી છે, તે ઉપરાંત સઈચ્છાએ કાયાએ જઈને
પાંચ આશ્રવ સેવવાનાં પચ્ચક્ખાણા.

જાવ અહોરતાં - એક દિવસ અને રાત્રિ સુધી

દુવિહં, તિવિહેણાં, ન કરેમિ, ન કારવેમિ, મણસા, વયસા,
કાયસા; જેટલી ભૂમિકા મોકળી રાખી છે, તે માંહે દ્રવ્યાદિકની
જે મર્યાદા કીધી છે, તે ઉપરાંત ઉવભોગ, પરિભોગ, ભોગ
નિમિત્ત ભોગવવાનાં પચ્ચક્ખાણા, જાવ અહોરતાં, એગવિહં,
તિવિહેણાં, ન કરેમિ, મણસા, વયસા, કાયસા, એહવા દશમા
દેશાવગાસિક વેરમણાં પ્રતના પંચ અઈયારા જાણિયવ્યા, ન

શ્રાવક સામાયિક પ્રતિકમણ સૂત્ર

સમાયરિયવા, તં જહા તે આલોઉં.

આણવણાપ્યાગો

- મર્યાદાની બહારથી વસ્તુ મંગાવી હોય,

પેસવણાપ્યાગો

- મર્યાદાની બહારથી ચાકર દ્વારા વસ્તુ મંગાવી હોય અગર મર્યાદા બહાર વસ્તુ મોકલી હોય.

સદાણુવાએ

- સાદ (અવાજ) કરીને મર્યાદાની બહારથી કોઈને બોલાવેલ હોય,

રૂવાણુવાએ

- પોતાનું રૂપ બતાવીને મર્યાદા બહારથી કોઈને બોલાવેલ હોય અથવા વસ્તુ મંગાવેલ હોય,

બહિયા પોગગાલપક્ષભેવે

- કંકરો આદિ નાંખી મર્યાદા બહારથી કોઈને બોલાવેલ હોય.

એહવા દશમા વ્રતને વિષે આજના દિવસ સંબંધી કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો; અરિહંત અનંત સિધ્ય કેવળી ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છા મિ દુકુડં.

(વ્રત લેવાની તથા પાળવાની વિષિ પુસ્તકમાં છેલ્લે આપેલ છે.)

પાઠ ૧૬ : અગિયારમું પરિપૂર્ણ પૌષ્ઠ્રવ્રત

(ત્રીજું - શિક્ષાપ્રત)

(ધર્મધ્યાન વડે આત્માને પોષવો તે પૌષ્ઠ્રવ્રત અથવા અનાદિકાળથી હિંસા, આહાર, મૈથુન અને પરિગ્રહના ભાવો તોડી, અહિસક, અણાણારી, અવેદી અને અપરિગ્રહી પદ પ્રાપ્ત કરવા માટેનું વ્રત)

અગિયારમું પડિપુરુષા

- અગિયારમું ધર્મકરણીથી

શ્રાવક સામાયિક પ્રતિક્રિયા સૂત્ર

પૌષ્ઠ્રવ્રત

અસણાં, પાણાં, ખાઈમં

સાઈમંના પચ્ચકુખાણા

અબંભના પચ્ચકુખાણા

મણિસોવનનાં પચ્ચકુખાણા

- આત્માને પોષવાનું વ્રત.

- અત્ર, પાણી, મેવો અને

મુખવાસ ખાવાના પ્રત્યાખ્યાન.

- મૈથુન સેવવાનાં પ્રત્યાખાન.

- જવેરાત, સોનું વગેરે રાખવાના પ્રત્યાખ્યાન.

માલાવત્રગ વિલેવણાના

પચ્ચકુખાણા

સત્ય મુસલાદિક સાવજ્ઞ

જોગનાં પચ્ચકુખાણા

જાવ અહોરતં પદ્જૂવાસામિ

- ફૂલની માળા, ચંદન વગેરે

- વિલેપન કરવાના પ્રત્યાખ્યાન

- શસ્ત્ર, સાંબેલાં વગેરે પાપકાંતી

- કાર્યનાં પ્રત્યાખાન.

- એક દિવસ અને રાત્રિ (આઠ પ્રછર સુધી) તે પ્રમાણે કરીશ.

દુવિહં, તિવિહેણાં, ન કરેમિ, ન કારવેમિ, માણસા, વયસા,
કાયસા, એહવી મારી સદ્દહણા પ્રતુપણાએ કરી પૌષ્ઠ્રવ્રતનો શુભ
અવસર આવે અને પૌષ્ઠ્ર કરું, તે વારે સ્પર્શનાએ કરી શુદ્ધ
હોજો ! એહવા અગિયારમા પડિપુણણ પૌષ્ઠ્રવ્રતના પંચ
અઈયારા જાણિયવ્યા, ન સમાયરિયવ્યા, તં જહા તે
આલોઉં : -

અઘડિલેહિય દુઘડિલેહિય - પાટ, પથારી આદિની પ્રતિલેખના
સિક્કાસંથારએ

- ન કરી હોય, અને કરી હોય તો
માઠી રીતે (ઉપેક્ષાપૂર્વક) કરી
હોય.

અઘમજીય દુઘમજીય -

સિક્કાસંથારએ

- પાટ, પથારી આદિની પ્રમાર્જના
કરી ન હોય, અને કરી હોય તો
માઠી રીતે (ઉપેક્ષાપૂર્વક)

	પ્રમાર્જના કરી હોય.
અખ્યાર પાસવણ ભૂમિ	લઘુનીત, વડીનીત ભૂમિની પ્રતિલેખના કરી ન હોય, અને કરી હોય તો માઠી રીતે કરી હોય.
અખ્યમજ્ઞિય દુષ્પમજ્ઞિય	- * લઘુનીત તથા * વડીનીત (સ્થંડીલ) જવાની ભૂમિની પ્રમાર્જના કરી ન હોય; અને કરી હોય તો માઠી રીતે કરી હોય.
પોસહસ્સ સમ્બંધાણ્યા	- પૌષધરતનું વિધિપૂર્વક રૂડી રીતે પાલન ન કર્યું હોય,

એહવા અગિયારમા વ્રતને વિષે આજના દિવસ સંબંધી કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો; અરિહંત અનંત સિધ્ય કેવળી ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છા મિ દુકુડં.

(વ્રત લેવાની તથા પાળવાની વિધિ પુસ્તકમાં છેલ્લે આપી છે.)

પાઠ ૧૭ : બારમું અતિથિ સંવિભાગ વ્રત (ચોથું - શિક્ષાવ્રત)

(અનાદિકાળથી લાજ, શરમ, ભય અગર સાંસારિક પદાર્થોની આશાએ તથારૂપના સાધુ-સાધ્વીજીઓને, આધાકભી, અસૂજતાં

* લઘુનીત=પેશાબ * વડીનીત=જાડો

આહાર, પાણી વહોરાવી વ્રતની વિરાધના કરી હોય, તેને તોડી
અનંત ગુણો પ્રગટાવવા માટે સાધુ-સાધ્વીજીને નિર્દોષ, પ્રાસુક
આહાર પાણી વહોરાવવાનું વ્રત)

બારમું

અતિથિ

સંવિભાગ વ્રત

સમણો

નિર્ગંધે

ફસુય

એસણિજજોણાં

અસણાં

પાણાં

ખાઈમાં

સાઈમાં

વત્થ

- બારમું
- જેઓને આહાર, પાણી વહોરવા આવવાની નક્કી-તિથિ નથી; તે અતિથિ
- પોતાનામાંથી વિભાગ કરવા રૂપ વ્રત (સાધુ-સાધ્વીજ પધારે તો મારે જે ખાવાપીવાની ચીજો છે, તેમાંથી તેઓને વહોરાવું એવી ભાવના ભાવવી તે)
- સાધુ-મુનિને (સાધ્વીજાને)
- નિર્ગંધને (જેમને કોઈ પણ જાતનો બાદ્ય કે આલ્યંતર પરિગ્રહ નથી,)
- જીવરહિત-અચિત (પ્રાસુક)
- નિર્દોષ (૪૨, ૪૭, ૮૬ દોષ રહિત)
- અન (ભોજન)
- પાણી (પીવા યોગ્ય અચિત)
- મેવા, મીઠાઈ આદિ (ખાવા યોગ્ય)
- મુખવાસ આદિ (સ્વાદ યોગ્ય)
- વસ્ત્ર (સુતરાઉ, ઊન, શાઢા

આવક સામાજિક પ્રતિકમળ સૂત્ર

વગેરે)

- પડિંગાહ
 - કુંબલ
 - પાયપુછુણોણાં
 - પાઢિયારુ
 - પીઠ
 - ફલગ
 - સિજજા સંધારઅણાં
 - ઓસહ
 - ભેસજજેણાં
 - પડિલાભેમાણો
 - વિહરિસસામિ
- પાત્રાં (કાણ, તુંબીના, માટીના)
 - કુંબલ, (કામળી)
 - રજોહરણ-ગુચ્છાદિ
 - આપીને પાછી લેવાય તેવી વસ્તુ
 - બાજોઠ, પાટલા આદિ,
 - પાટીયું, પાટ આદિ,
 - શાખા (મકાન), ઘાસની પથારી આદિ.
 - ઔષધ (જેમાં એક વસ્તુ હોય,
તેવીઃ (જેમ કે-હરેની ફાડી)
 - ઘણી વસ્તુ ભેગવીને કરેલી દવા,
(જેમ કે - ત્રિફળા આદિ)
 - ભાવથી આપતો થકો
 - વિચરીશ

એહવી મારી સદ્ધણા પ્રરૂપણાએ કરી સુપાત્ર સાધુ-
સાધ્વીજની જોગવાઈ મળે અને નિર્દોષ આહાર-પાણી
વહોરાવું, તે વારે સ્પર્શનાએ કરી શુદ્ધ હોજો !

એહવા બારમા અતિથિ સંવિભાગતના પંચ
અઈયારા, જાણિયવ્યા, ન સમાયરિયવ્યા, તં જહા તે
આલોઉં : -

- સચિત નિકુભેવણાયા
- અચેતમાં સચેત વસ્તુ નાખીને;
જેમ કે - ખમણ પર કોથમીર
(ઘાણા), ચુરમાના લાડવા પર
ખસખસ છાંટેલ હોય. (ભલરાવી

શ્રાવક સામાયિક પ્રતિક્રિમણ સૂત્ર

(હોય) અથવા અચેત વસ્તુને સચેત
ઉપર રાખી હોય.

સચિતપેહણયા

- અચેત વસ્તુને સચેત વસ્તુથી ટાકી
હોય.

કાલાઈક્કમે

- વસ્તુનો કાળ વીતી ગયા પછી
બગડેલી વસ્તુ વહોરાવી હોય,

પરોવએસે

- પોતે સુજતો હોવા છતાં બીજાને
વહોરાવવાનું કહું હોય.

મય્યરિયાએ

- દાન આપી અહંકાર કર્યો હોય.

એહવા બારમા બ્રતને વિષે આજના દિવસ સંબંધી કોઈ
પણ પાપ દોષ લાગ્યો હોય તો; અરિહંત અનંત સિદ્ધ કેવળી
ભગવાનની સાક્ષીએ તસ્સ મિયા મિ દુકુંડ.

પાઠ : ૧૮ : સંથારો-સંલેખના સૂત્ર

અપચિદમ

- છેદ્ધી (હવે બીજું કાંઈ કામ
કરવાનું બાકી રહેલ નથી.)

મારણાંતિય

- મરણ વખતે કરાતી,

સંલેહણા

- તપથી શરીર અને કષાયોનું
શોષણ કરવાની કિયા;

પોષધશાળા પૂંજને

- મયારિદિત ભૂમિને પૂંજને,

ઉચ્ચાર-પાસવણ

- વડીનીત-લઘુનીત ભૂમિને

ભૂમિકા પડિલેહીને

- નજરે જોઈને,

ગમણાગમણો

- જતાં-આવતાં, ગમનાગમનની
અયતના થઈ હોય તેનું,

પડિક્કમિને

- પ્રાયશ્ચિત લઈને,

શ્રાવક સામાચિક પ્રતિકમણ સૂત્ર

દર્ભાદિક સંથારો	- ડાબ આદિ તરણાની પથારી
સંથરીને	- પાથરીને,
દર્ભાદિક સંથારો	- ડાબ વગેરે તરણાની પથારી
દુરુહીને	- ઉપર બેસીને,
પૂર્વ તથા ઉત્તર દિશા	- પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ (યા ઈશાન કોણ તરફ) મુખ કરીને,
પલ્યંકાદિ આસને બેસીને	- પલાંડીવાળીને અગર અનુકૂળ પડે તેવા આસને બેસીને,
કરયલ સંપરિંગહિયં	- બંને હાથ જોડીને,
સિરસાવતાં	- મસ્તકે આવર્તન કરીને,
મત્થાઓ	- મસ્તકે
અંજલી કરું	- અંજલી (જોડેલા હાથ) અડાડીને,
એવં વયાસી	- એમ કહે,
નમોત્થુણાં	- નમસ્કાર હોજો,
અરિહંતાણાં	- અરિહંત
ભગવંતાણાં	- ભગવંતોને
જાવ સંપત્તાણાં	- યાવત્ મોક્ષ પહોંચેલાઓને
એમ અનંતા સિદ્ધને નમસ્કાર કરીને, વર્તમાન પોતાના ધર્મગુરુ - ધર્મચાર્યને નમસ્કાર, કરીને પૂર્વ જે પ્રત આદ્યાં છે;	
તે	
આલોવી	- પ્રતોમાં અતિકમાદિક દોષો લાગ્યા હોય તેને યાદ કરી, ગુરુ આદિની સેવામાં કહી સંભળાવી,
પડિકુમિ	- તેનું પ્રાપ્તશીત લઈને,
નિંદી	- દોષોની નિંદા કરીને,

શ્રાવક સામાયિક પ્રતિક્રિમણ સૂત્ર

નિ:શલ્ય થઈને	- ત્રણો પ્રકારના શલ્ય રહિત થઈને,
સવ્યં પાણાઈવાયં પચ્યક્રખામિ	- સર્વ પ્રકારની હિંસાને તજું છું.
સવ્યં મુસાવાયં પચ્યક્રખામિ	- સર્વ પ્રકારના જૂઠને તજું છું.
સવ્યં અદિત્તાદાણાં પચ્યક્રખામિ	- સર્વ પ્રકારની ચોરીને તજું છું.
સવ્યં મેહુણાં પચ્યક્રખામિ	- સર્વ પ્રકારના મૈથુનને તજું છું.
સવ્યં પરિગંહં પચ્યક્રખામિ	- સર્વ પ્રકારના પરિગંહને તજું છું.
સવ્યં કોહં પચ્યક્રખામિ	- સર્વ પ્રકારના કોઘને તજું છું.
જાવ	- યાવત (વચ્ચેના માન, માયા વગેરે સહિત અઢારમા)
મિથ્યા દંસણ સહં	- મિથ્યા દર્શન શલ્યને
અકુરણિજ્ઞં જોગં	- ન સેવવા જેવા યોગના
પચ્યક્રખામિ	- પચ્યક્રખાણ કરું છું.
જાવજળવાએ	- જીવું ત્યાં સુધી
તિવિહં	- ત્રણ કરણા
તિવિહેણં	- ત્રણ યોગે કરીને
ન કરેમિ	- નહિ કરું (પાપ)
ન કારવેમિ	- નહિ કરાવું (પાપ)
કરંતં પિ અસં નાણાદ્ય	- (પાપ) કરનારની અનુમોદના ન
સમાણજાણામિ અદ્ય	કરું, ભલું જાણું નહિ.
મણસા, વયસા, કાયસા	મનથી, વચ્ચનથી, કાયાથી
એમ અઢારે પાપ	- એવી રીતે અઢારે પ્રકારના પાપના
સ્થાનક પચ્યક્રખીને	પ્રત્યાખ્યાન કરીને,
સવ્યં	- સર્વ પ્રકારના
અસણાં પાણાં-ખાઈમં-સાઈમં-	અસ, પાણી, મેવો, મુખવાસ
ચઉલ્વિહં પિ આહારં	- એ ચારે પ્રકારના આહારના

શ્રાવક સામાચિક પ્રતિક્રિયા સૂત્ર

પચ્યકુખામિ	પ્રત્યાખ્યાન કરું છું.
જાવજળવાએ	- જીવું ત્યાં સુધી
એમ ચારે આધાર	- એ ચારે પ્રકારના આધારના
પચ્યકુખીને	પ્રત્યાખ્યાન કરીને
જું પિયં	- જે, પણ અને
ઈમં શરીરં	- આ, શરીર
ઈહું	- ઈષ્ટકારી
કંતં	- કંત, સુંદર
પિયં	- પ્રિય
મણુત્તં	- મનોજ્ઞ (મનગમતું)
મણામં	- મનને અતિ વહાલું
ધિજું	- ધૈર્યરૂપ
વિસાસિયં	- વિશ્વાસના ઠેકાણાવાળું
સમયં	- સમ્મત (માનવા યોગ્ય)
અણુમયં	- વિશેષ માનવા યોગ્ય
બહુમયં	- બધા વડે માનવા યોગ્ય
ભંડ કરંડગ સમાણં	- આભૂષણોના કરંડિયા (ડાબલા) સમાન
રથણ કરંડગ ભૂયં	- રત્નના કરંડિયા (પેટી) સમાન
મા	- રખે !
ણાં	- અવ્યય છે, વાક્યની શોભાર્થ છે, સ્વતંત્ર કોઈ અર્થ નથી.
સીયં	- ઠંડી લાગે,
મા ણાં ઉણું	- રખે ! તાપ લાગે,
મા ણાં ખુણા	- રખે ! ભૂખ લાગે,

શ્રાવક સામાચિક પ્રતિક્રમણ સૂત્ર

મા ણાં પિવાસા	- રખે ! તરસ લાગે,
મા ણાં બાલા	- રખે ! સાપ કરે,
મા ણાં ચોરા	- રખે ! ચોર હેરાન કરે
મા ણાં દંસા	- રખે ! ડાંસ કરે,
મા ણાં મસગા	- રખે ! મચ્છર કરે,
મા ણાં વાઈં	- રખે ! વાતા થાય,
પિત્તિં	- પિત થાય,
સંભિં	- સળેખમ (કફ) થાય,
સન્નિવાઈં	- સન્નિપાત થાય, (ત્રિદોષ)
વિવિહા રોગાયંકા	- વિવિધ પ્રકારના આતંક રોગ, (તત્કાલ પ્રાણ લેનાર) પીડાઓ વગેરે થાય,
પરિસહોવસગ્ગા	- (૨૨ પ્રકારના) પરિસહો* અને ઉપસર્ગો ÷ થાય.
શસાકુસંતુ તિંક્કુ	- તે, તે પ્રકારના કોઈ પણ સ્પર્શ થાય,
એયંપિયણાં	- એવું પણ (શરીરને થાય તો પણ)
ચરમેહિ	- છેલ્ખા
ઉસ્સાસ નિસ્સાસેહિ	- શાસોચ્છવાસ સુધી,
વોસિરામિ	- તજું દું,
તિકું	- એમ કરીને, વિચારીને,

* પરિષહ=મોક્ષમાર્ગથી ચૂત ન થવા માટે અને કર્મનિર્જરાના ભાવથી જે સહન
કરવામાં આવે તેને 'પરિષહ' કહે છે. પરિષહ દીર્ઘકાળના હોય છે

÷ ઉપસર્ગ=સમીપમાં આવીને અચાનક આવી પડેલી પીડા (દુઃખ)ને 'ઉપસર્ગ'
કહે છે. ઉપસર્ગ અલ્પકાળના હોય છે.

શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર

- એમ શરીર વોસિરાવીને - એમ શરીરના મમત્વને છોડીને,
 કાલં અણવકુંખમાણો - મૃત્યુને અણવાંછતો થકો
વિહિતિસ્સામિ - વિચરીશ.

**એવી સદ્ગણા પ્રરૂપણાએ કરી, અણસણાનો અવસર
 આવ્યે, અણસણા કરું તે વારે સ્પર્શનાએ કરી શુદ્ધ હોજો ! એવા
 અપચ્છિમ મારણાંતિય સંલેહણા**

- જૂસણા - (અણસણા) સેવવાના
 આરાહણાના - આરાધવાના

**પંચ અઈયારા, જાળિયવ્યા, ન સુમાયરિયવ્યા તં જહા તે
 આલોઉં -**

- ઇહલોગાસંસઘાઓગે - આ લીકના સાંસારિક સુખની
 ઇચ્છા કરે કે - મરીને મોટો
 સઆટ, અથવા મંત્રી વગેરે બનું.
 પરલોકના સુખની ઇચ્છા કરે કે
 મરીને મોટો મહિદ્ધિક દેવ બનું.
 જીવવાની ઇચ્છા કરે (વધુ દિવસ
 જવું તો ઠીક, જેથી સંથારો લંબાય
 તો લોકોમાં મારી આબરૂ વધે).
 મરણાસંસઘાઓગે - મરણની ઇચ્છા કરે (બહુ દુઃખ
 પામું છું, તેથી હવે તુરત મરી જાઉં
 તો સારું.)

- કામલોગાસંસઘાઓગે - મનુષ્ય અથવા દેવ સંબંધી કામ-
 ભોગો મેળવવાની ઇચ્છા કરી
 હોય.

શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર

તસ્સ મિથ્યા મિ દુક્કડં - તેનું મારું પાપ મિથ્યા થાઓ.
 એમ સમકિતપૂર્વક બાર પ્રત સંલેખણા સહિત નવ્યાણું
 અતિચાર, તેને વિષે જે કોઈ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર,
 અનતિચાર જાણતાં, અજાણતાં મન, વચન, કાયાએ કરી સેવ્યાં હોય,
 સેવરાવ્યાં હોય, સેવતાં પ્રત્યે અનુમોદના કરી હોય તો; અરિહંત,
 અનંત સિદ્ધ ભગવાનની સાક્ષીએ તસ્સ મિથ્યા મિ દુક્કડં.

પાઠ : ૧૯ : અઢાર પાપસ્થાનકસૂત્ર

(જે મે જીવ વિરાધીયા; સેવ્યા પાપ અઢાર,
 પ્રભુ તુમ્હારી સાખ્થી, વારંવાર ધિક્કાર.)

અઢાર પ્રકારના પાપ સ્થાનક સંબંધી પાપ દોષ લાગ્યા હોય
 તે આલોઉં -

- | | |
|-----------------|---|
| (૧) પ્રાણાતિપાત | - પ્રાણોનો અતિપાત કરવો -
આત્માથી દ્રવ્ય-પ્રાણોને જુદાં
કરવા અર્થાત् હિંસા + કરવી. |
| (૨) મૃધાવાદ | - અસત્ય બોલવું. |
| (૩) અદતાદાન | - અણાદીધેલી વસ્તુ લેવી, ચોરી
કરવી. |

+ હિંસાના ત્રણ બેદ - (૧) સંરંભ = જીવોની હિંસાનો સંકલ્પ
 કરવો. (૨) સમારંભ = હિંસાને માટે પ્રયત્ન કરવો. (૩) આરંભ
 = હિંસા કરવી. અર્થાત् પ્રાણહરણ કરવા.

શ્રાવક સામાયિક પ્રતિકમણ સૂત્ર

- (૪) મૈથુન - અભ્રહચર્ય (સ્ત્રી આદિ સંગ)
- (૫) પરિગ્રહ - નવ પ્રકારના બાધ અને ચૌદ +
પ્રકારના અભ્યંતર પરિગ્રહની
ઈચ્છા.)
- (૬) કોધ - કોધ-(ગુસ્સો)
- (૭) માન - માન, અહંકાર
- (૮) માયા - કૃપટ
- (૯) લોભ - અસંતોષ (પદાર્થોની અધિક
ઈચ્છા)
- (૧૦) રાગ - પ્રિય વસ્તુ પર આસક્તિ રાખવી.
- (૧૧) દ્વાષ - અપ્રિય વસ્તુ પર દુર્ભાવ રાખવો.
- (૧૨) કલહ - કળિયો (લડાઈ-જઘડાં)
- (૧૩) અભ્યાખ્યાન - ખોટું આળ ચડાવવું,
- (૧૪) પૈશુન્ય - ચાડી-ચુગલી કરવી. (નારદવૃત્તિ)
- (૧૫) પર-પરિવાદ - બીજાની નિંદા કરવી, વાંકુ
બોલવું,
- (૧૬) રઈ-અરઈ - પાપના કાર્યમાં ખુશ થવું અને
ધર્મના કાર્યમાં નાખુશ થવું.
- (૧૭) માયા મોસો - કૃપટ સહિત જૂઢું બોલવું.
- (૧૮) મિથ્યા દંસણ સહં - કુદેવ, કુગુરુ અને કુધર્મની શ્રદ્ધા
કરી હોય - સેવવાની ઈચ્છા કરી
હોય.

+ નવ પ્રકારનો બાધ પરિગ્રહ 'પાંચમા અણુવ્રત'માં આવી ગયેલ છે.
૧૪ પ્રકારનો અભ્યંતર પરિગ્રહ - (૧) કોધ (૨) માન (૩) માયા (૪) લોભ
(૫) હાસ્ય (૬) રતિ (૭) અરતિ (૮) ભય (૯) શોક (૧૦) દુગુંચ્છા (૧૧)
સ્ત્રીવેદ (૧૨) પુરુષવેદ (૧૩) નપુંસકવેદ અને (૧૪) મિથ્યાત્વ.

એ અદ્દાર પ્રકારના પાપ સ્થાનક મારા જીવે (તમારા જીવે)
સેવ્યાં હોય, સેવરાવ્યાં હોય, સેવતા પ્રત્યે અનુમોદના કરી હોય
તો; અનંતા સિદ્ધ કેવળીની સાક્ષીએ તસ્સ મિચ્છા મિ દુકું.

પાઠ : ૨૦ : પચ્ચીશ પ્રકારના મિથ્યાત્વ

પચ્ચીશ પ્રકારના મિથ્યાત્વ સંબંધી પાપ દોષ લાગ્યો હોય
તે આલોઉં -

- (૧) અભિગ્રહિક મિથ્યાત્વ - સાચા ખોટાનો નિર્ણય કર્યા
વિના ખોટાને હઠથી પકડી
રાખવું તે,
- (૨) અનાભિગ્રહિક મિથ્યાત્વ - બધા દેવ, ગુરુને માનવા તે,
- (૩) અભિનિવેશિક મિથ્યાત્વ - પોતાના મતને ખોટો જાણવા
છતાંયે છોડવો નહિ તેમજ
કુયુક્તિથી તેનું પોષણ કરવું
તે,
- (૪) સાંશાચિક મિથ્યાત્વ - (સત્ય ધર્મમાં પણ) શંકા
શીલ રહેવું તે,
- (૫) અણાભોગ મિથ્યાત્વ - જેમાં બિલકુલ જાણપણું નથી
તે,
- (૬) લૌકિક મિથ્યાત્વ - આ દુનિયામાં જે દેવ, ગુરુ
ધર્મની વિપરીત સ્થાપના
કરેલી છે, તેને માનવા અને
તેમના પર્વ વગેરે ઉજવવાં
નેવેદ આદિ કરવા તે,

- (૭) લોકોત્તર મિથ્યાત્વ - બીજા પાખંડી મતની એઠે
તીર્થકર દેવની માનતા કરે,
(સ્થાપેલ ચિતરેલ કે ઘડેલ
ચીજ કે જેમાં કોઈ પણ
જાતના ગુણ નથી તેની
માનતા પૂજા કરે, પાસત્થા-
ઓમાં (શાયિલાચારી)
ગુરુપણાની બુદ્ધિ કરે.
- (૮) કુપ્રાવચન મિથ્યાત્વ - ઉદ્ગત પાખંડીના મતને માને.
- (૯) જીવને અજીવ શ્રદ્ધે (કહે) તે મિથ્યાત્વ.
- (૧૦) અજીવને જીવ શ્રદ્ધે (કહે) તે મિથ્યાત્વ.
- (૧૧) સાધુને કુસાધુ શ્રદ્ધે (કહે) તે મિથ્યાત્વ.
- (૧૨) કુસાધુને સાધુ શ્રદ્ધે (કહે) તે મિથ્યાત્વ.
- (૧૩) આઠ કર્મથી મુકાણા તેને નથી મુકાણા શ્રદ્ધે (કહે) તે
મિથ્યાત્વ.
- (૧૪) આઠ કર્મથી નથી મુકાણા તેને મુકાણા શ્રદ્ધે (કહે) તે
મિથ્યાત્વ.
- (૧૫) ધર્મને અધર્મ શ્રદ્ધે (કહે) તે મિથ્યાત્વ.
- (૧૬) અધર્મને ધર્મ શ્રદ્ધે (કહે) તે મિથ્યાત્વ.
- (૧૭) જિનમાર્ગને અન્ય માર્ગ શ્રદ્ધે (કહે) તે મિથ્યાત્વ.
- (૧૮) અન્ય માર્ગને જિનમાર્ગ શ્રદ્ધે (કહે) તે મિથ્યાત્વ.
- (૧૯) જિનમાર્ગથી ઓછું પ્રરૂપે તે મિથ્યાત્વ.
- (૨૦) જિનમાર્ગથી અધિક પ્રરૂપે તે મિથ્યાત્વ.
- (૨૧) જિનમાર્ગથી વિપરીત પ્રરૂપે તે મિથ્યાત્વ.
- (૨૨) અવિનય મિથ્યાત્વ - ગુરુ, આદિ વડિલ સંત
પુરુષોનો વિનય ન કરે તે.

(૨૩) અક્રિયા મિથ્યાત્વ

- સંયમ આદિ ક્રિયાને માને
નહિ તે, ચારિત્રવાનને
'ક્રિયાજડ' કહીને તિરસ્કાર
કરવો તે.

(૨૪) અજ્ઞાન મિથ્યાત્વ

- અજ્ઞાનને શ્રેષ્ઠ માનવું તે.

(૨૫) આશાતના મિથ્યાત્વ

- સુદેવ, સુગૃહુ, સુધર્મ અને
નિર્ગ્રથ પ્રવચનની આશા-
તના કરવી તે.

આ પચ્ચીશ પ્રકારનું મિથ્યાત્વ મારા જીવે (તમારા જીવે)
સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવતા પ્રત્યે અનુમોદના કરી હોય
તો; અરિહંત અનંત સિધ્ય કેવળી ભગવાનની સાક્ષીએ તસ્સ
મિથ્યા મિ દુકું.

પાઠ : ૨૧ : ચૌદ પ્રકારના સંમૂચ્યીમ જીવ

ચૌદ પ્રકારના સંમૂચ્યીમ મનુષ્ય સંબંધી પાપદોષ લાગ્યા
હોય તે આલોઉં -

(૧) ઉચ્ચારેસુ વા	- વડીનીત (જાડા)માં ઉપજે તે, અને
(૨) પાસવણેસુ વા	- લઘુનીત (પેશાબ)માં ઉપજે તે "
(૩) ખેલેસુ વા	- કઢ (બળખા)માં ઉપજે તે "
(૪) સિંધાણાએસુવા	- નાકના મેલ (લીંટ)માં " "
(૫) વંતેસુ વા	- વમન (ઉલ્ટી)માં " "
(૬) પિતેસુ વા	- લીલા પીળા પિત્તમાં " "
(૭) પૂઅસુ વા	- પરૂ (રસી)માં " "
(૮) સોણાએસુ વા	- લોહી (શોણિત)માં " "
(૯) સુક્કેસુ વા	- વીર્ય (શુક)માં " "

શ્રાવક સામાયિક પ્રતિકમણ સૂત્ર

- | | |
|---------------------------------|---|
| (૧૦) સુક્ક પુગલ
પરિસાડેસુ વા | વીર્ય આદિના સૂક્પાયેલાં પુદ્ગલો
ફરી ભીનાં થાય, તેમાં ઉપજે તે.
અને |
| (૧૧) વિગય જીવ
કલેવરેસુ વા | - મરેલા જીવોના કલેવરોમાં ઉપજે
તે, અને |
| (૧૨) ઈત્થી પુરિસ
સંજોગેસુ વા | - સ્ત્રી પુરુષના સંયોગથી
(યોનિમાં) ઉપજે તે, અને |
| (૧૩) નગર નિદ્રમણેસુ વા- | શહેરોની ગટરોમાં ઉપજે તે, અને |
| (૧૪) સવ્યેસુ ચેવ
અસુઈકૃણેસુ | - સર્વ પ્રકારનાં અશુચિ સ્થાનોમાં
ઉપજે તે. |

એ ચૌદ પ્રકારનાં સંમૂચ્યિત મનુષ્યની વિરાધના કરી હોય
તો; અરિહંત અનંત સિધ્ય કેવળી ભગવાનની સાક્ષીએ તસ્સ
મિચ્છા મિ દુક્કડં.

(અ) આ સ્થાને પાઠ : ૨ : કાઉસરગ સૂત્ર' ના પાઠમાં
'ઈચ્છામિ ઠામિ કાઉસરગં શબ્દો છે, તે સ્થાને ઈચ્છામિ, ઠામિ
આલોઉં જો, મે, દેવસિઓથી, તસ્સ મિચ્છા મિ દુક્કડં સુધીનો પૂરો
પાઠ બોલવો. *

(બ) (ત્યાર પદ્ધી) નમસ્કારમંત્રનો પાઠ બોલવો.

(ક) (ત્યાર પદ્ધી) કરેમિ ભંતે ! સામાઈયં.... થી....અઘાણં
વોસિરામિ સુધીનો પૂરો પાઠ બોલવો.

પાઠ : ૨૨ : માંગલિકનો પાઠ

(‘ચતારિ મંગલં’ નો પાઠ બોલતાં સમયે જમણો ઢીંચણ ઊંચો કરી, તાબો ઢીંચણ ધરતીએ સ્થાપીને, બંને હાથ જોડી, મસ્તકે અંજલી કરી બોલવો.)

ચતારિ મંગલં

- સંસારમાં ચાર (અલૌકિક = લોકોત્તર) પદાર્થ મંગલ છે.

અરિહંતા મંગલં

- અરિહંત દેવો મંગલ છે.

સિદ્ધા મંગલં

- સિદ્ધ ભગવંતો મંગલ છે.

સાધ્ય મંગલં

- સાધુ (સાધ્વીજી)ઓ મંગલ છે.

કેવલિ-પત્રતો

- કેવલી (સર્વજ્ઞ) પ્રરૂપિત

ધર્મો મંગલં

- ધર્મ મંગલ છે.

ચતારિ લોગુતમા

- લોકને વિષે ચાર ઉત્તમ છે.

અરિહંતા લોગુતમા

- અરિહંત દેવો લોકમાં ઉત્તમ છે.

સિદ્ધા લોગુતમા

- સિદ્ધ ભગવંતો લોકમાં ઉત્તમ છે.

સાધ્ય લોગુતમા

- સાધુ (સાધ્વીજી)ઓ લોકમાં ઉત્તમ છે.

કેવલિ-પત્રતો

- કેવલી પ્રરૂપિત

ધર્મો લોગુતમો

- ધર્મ લોક=સંસારમાં ઉત્તમ=શ્રેષ્ઠ છે.

ચતારિ શરણાં

- ચારનાં શરણાને

પવજજામિ

- અંગીકાર કરું છું.

અરિહંતા શરણાં

- અરિહંત દેવોનું શરણ

પવજજામિ

- અંગીકાર કરું છું.

શ્રાવક સામાયિક પ્રતિક્રિમણ સૂત્ર

સિદ્ધા શરણાં	- સિદ્ધ ભગવંતોનું શરણા
પવજજામિ	- અંગીકાર કરું છું.
સાધૂ શરણાં	- સાધુ (સાધ્વીજી) ઓનું શરણા
પવજજામિ	- અંગીકાર કરું છું.
કેવલિ પત્રતાં	- કેવલી પ્રરૂપિત ધર્મનું શરણા
ધર્માં શરણાં પવજજામિ	- અંગીકાર કરું છું.

(૪૬)

એ ચાર શરણા, ચાર મંગલ, ચાર ઉત્તમ

કરે જેહ; ભવ સાગરમાં ન દૂબે તેહ.

સકલ કર્મનો આણો અંત; મોક્ષ તણાં સુખ લહે અનંત,
ભાવ ધરીને જે ગુણ ગાય, તે જીવ તરીને મોક્ષે જાય.

સંસારમાંઠી શરણા ચાર; અવર શરણ નહિ કોય,

જે નરનારી આદરે; અક્ષય અવિયળ પદ હોય.

અંગૂઠે અમૃત વસે; લઘ્ય તણા ભંડાર
ગુરુ ગૌતમને સમરીએ, મનવાંછિત ફળ દાતાર

(ક) આ સ્થાને “ઈચ્છામિ, પડિક્કમિઉં જો, મે દેવસિઓ,
અઈયારો....થી.... તસ્સ મિચ્છા મિ દુક્કડં” સુધીનો પૂરો પાઠ
બોલવો.

(ખ) (ત્યાર પછી) “ઈચ્છામિ, પડિક્કમિઉં, ઈરિયા
વહિયાંએ, વિરાહણાએ.... થી.... તસ્સ મિચ્છામિ દુક્કડં”
સુધીનો સામાયિક સૂત્રનો ‘ઈયાપથિકસૂત્ર’નો પૂરો પાઠ બોલવો

આલોયણા

ચાર ગતિ, ચોવીસ દંડક, ચોરાસી લાખ જીવાયોનિ,
એક કોડ સાડી સતાણું લાખ કુલ કોટીના જીવને મારા જીવે,
(તમારા જીવે) આજના દિવસ સંબંધી આરંભે, સમારંભે,
મન, વચન, કાયાએ કરી દુભવ્યા હોય; દ્રવ્યપ્રાણ,
ભાવપ્રાણ દુભાવ્યા હોય; પરિતાપના કિલામના ઉપજાવી
હોય; કોધે, માને, માયાએ, લોભે, રાગે, દ્વેષે, હાસ્યે, ભયે,
ખળાયે, ધ્રીઠાયે, આપ-થાપનાએ, પરઉથાપનાએ, દુષ્ટ
લેશ્યાએ, દુષ્ટ પરિણામે, દુષ્ટ ધ્યાને (આર્ત, રૌદ્રધ્યાને)
કરીને, ઈષ્યાએ, મમતે, હઠપણે, અવજ્ઞા કરી હોય; દુઃખમાં
જોડયાં હોય, સુખથી ચુકવ્યા (છોડાવ્યા) હોય; પ્રાણ,
પર્યાય, સંજ્ઞા, ઈન્દ્રિય આદિ લઘિદ્ધ-ગ્રદ્ધિથી ભષ્ટ કર્યા
હોય;; તો તે સર્વ અઢાર લાખ, ચોવીશ હજાર, એકસો
વીસ પ્રકારે * પાપ દોષ લાગ્યો હોય તો; અરિહંત, અનંતા
સિદ્ધ કેવળી ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છા મિ દુકુડં.

* સંસારી જીવનાં ૫૮૭ લેદ-તેને અભિહયાથી જીવિયાઓ,
વવરોવિયાના ૧૦ પદથી ગુણતાં ૫૮૩૦. તેને રાગ દ્વેષ-બેધી
ગુણતાં ૧૧૨૫૦. તેને મન વચન કાયા ઉ થી ગુણતાં ૩૩૭૮૦.
કરવું કરાવવું - અનુમોદવું ત્રણ થી ગુણતાં ૧૦૧૩૪૦. તેને ભૂત-
ભવિષ્ય-વર્તમાન-ઉ થી ગુણતાં ૩૦૪૦૨૦. તેને અરિહંત, સિદ્ધ,
આચાર્ય, ઉપાધ્યાય, ગુરુ તથા પોતાનો આત્મા આ ૬ ની સાક્ષીથી
ગુણતા ૧૮, ૨૪, ૧૨૦ પ્રકાર થયા.

શ્રમણસૂત્ર પહેલું શ્રમણસૂત્ર *

પાઠ : ૨૩ : શાખા - સૂત્ર +

(નિદ્રાદોષથી નિવર્તવાનો પાઠ)

ઈચ્છામি	- (હું) ઈચ્છું છું.
પડિક્કમિઉં	- પ્રતિક્રિયા કરવાને
પગામસિજ્જાએ	- વધારે સૂતાં રહેવાથી
નિગામસિજ્જાએ	- ઓઢવા-પાથરવાનાં ઘણાં ઉપકરણ રાખી, ઘણું
સંથારા ઉવહૃણાએ	- સૂતાં, સૂતાં વગર પૂંજ્યે પડખાં કરવવાથી

* પાંચ 'શ્રમણસૂત્ર મુખ્યત્વે પૂ. સાધુ-સાધ્વીજીઓને આલોચવાના છે. પરંતુ પ્રતિધારી શ્રાવક-શ્રાવિકાઓને અને તેમાંથે ખાસ કરીને પૌષ્ટ આદિ પ્રતમાં નિદ્રાદિ દોષ અને અતિચારોની શુદ્ધિ માટે આવશ્યકતા રહે છે. તેથી શ્રાવકોએ પણ શ્રમણસૂત્ર બોલવામાં કોઈ વિરોધ સમજવો નહિ. તેમજ શ્રદ્ધા, પ્રતૃપણ માટે તો જરૂરી છે જ. તેથી બોલવા ઉચિત લાગે છે.

+ કોઈ પણ પ્રતમાં નિદ્રા કરેલ હોય ત્યારે નિદ્રામાંથી નિવૃત્ત થયા પછી પહેલા શ્રમણસૂત્ર (શાખા-સૂત્ર) નો અવશ્ય કાયોત્સર્ગ કરવાનો હોય છે. અને 'ચાર લોગસ્સ' નો કાયોત્સર્ગ પણ ભાવ વિશુદ્ધ માટે કરવામાં આવે છે.

શ્રાવક સામાચિક પ્રતિકમણ સૂત્ર

પરિયદૃષ્ટાએ

આઉદૃષ્ટાએ પસારણાએ

છપુઈ સંઘદૃષ્ટાએ

કુઈએ

કક્કરાઈએ

છીએ

જંભાઈએ

આમોસે

સસરક્રખામોસે

આઉલમાઉલાએ

સોવણાવત્તિયાએ

ઈત્થી *

વિષરિયાસિયાએ

દિંકી

વિષરિયાસિયાએ

મણા

વિષરિયાસિયાએ

- વારંવાર વગર પૂંજ્યે પડખા

કેરવવાથી,

- વગર પૂંજ્યે હાથ, પગ વગેરે

અંગો સંકોચવા અને લાંબા

કરવાથી,

- છપગળી=જૂ વગેરે જીવ કચરવાથી,

- અયતનાથી ખાંસી ખાવાથી.

- શય્યાના દોષો બોલવાથી અર્થાત્

શય્યા સંબંધી કચકચ કરવાથી

તથા ઉધાડે મોઢે બોલવાથી.

- (અયતનાથી) છીંક ખાવાથી,

- (અવિધિથી) બગાસું ખાવાથી,

- વગર પૂંજ્યે શરીર ખંજવાળવાથી

- સચેત ૨૪ યુક્ત વસ્તુને સ્પર્શવાથી

- આકુળ - વ્યાકુળતાથી,

- સ્વખના નિમિત્તથી,

- સ્ત્રીના વિપર્યાસ અમથી,

(સ્વખનામાં મૈથુન સેવવાની ઈચ્છા

થઈ હોય)

- દ્રષ્ટિના વિપર્યાસથી (સ્વખનાં

દ્રષ્ટિથી કીડા કરી હોય).

- મનના વિપર્યાસ થી (સ્વખનાં

મનથી કીડા કરી હોય)

* બહેનોએ 'પુરિસ વિષરિયાસિયાએ' પાઠ બોલવો.

શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર

પાણ ભોયણા

- પાણી અને ભોજનના વિપર્યાસથી

વિષરિયાસિયાએ

- (સ્વખમાં સારા નરસા આહાર
પાણીનો વિપર્યાસ થયો હોય.

જો મે દેવસિઓ+અઈયારો કાઓ તસ્સ મિચ્છા મિ દુકુડં.

પાઠ : ૨૪ બીજું શ્રમણસૂત્ર

ગોચરચર્યાસૂત્ર

(ગોચરીના દોષોથી નિવર્તિવાનો પાઠ)

પડિક્રમાભિ

- પ્રતિક્રમણ-કરું છું.

ગોચર ચરિયાએ

- ગાયના ચરવાની માફિક જેમાં
ફરવાનું છે એવી,

ભિક્ખાચરિયાએ

- લિક્ષા-ચર્યામાં
(ક્યાં દોષ લાગ્યા ?)

ઉગ્ધાડ કવાડ

- અર્ધ ખુલ્ખાં કમાડ (બારણા)ને

ઉગ્ધાડણાએ

- પૂરાં ખોલીને લિક્ષા
લેવા વડે,

સાણા વર્ચા દારા

- ઝૂતરાં, વાછરડાં, બાળકને
અડીને

+ યથાકાળ પ્રતિક્રમણમાં (૧) રાઈઓ (૨) પક્ખિઓ (૩)
ચાઉભાસિઓ (૪) સંવર્ચરિઓ શબ્દ બોલવા.

* શ્રાવકોએ ગોચરી દયા (દશમું વ્રત) માં આહારાદિ લાવ્યા
પછી 'ઈર્યાપથિકસૂત્ર' અને 'બીજા શ્રમણસૂત્ર' નો કાયોત્સર્ગ
કરવાનો હોય છે.

શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર

સંઘર્ષણાએ	- તુ અલોંગીને જવા વડે,
મંડી પાહુડિયાએ	- કોઈ નિમિત્ત રાજેલ હોય તે લેવા વડે. (અગ્રપિંડ=કૂતરા આદિને માટે બનાવેલ પહેલી રોટલી આદિ)
બલિ પાહુડિયાએ	- ઉછાળંવા માટે જે બાહુણા કર્યા હોય તે લેવા વડે, (બલિકર્મ)
ઠવણા પાહુડિયાએ	- નિમિકુદોને દાન આપવા માટે સ્થાપિત કરી રાજેલ નિમિકા લેવા વડે,
સંકિએ	- શંકાવાળો આહાર લેવા વડે,
સહસ્રસાગારે	- ઉતાવળથી લેવા વડે,
અણોસણાએ	- સૂજતા-અસૂજતાની ગવેષણા કરીન હોય, અસૂજતનું લેવા વડે,
પાણોસણાએ ×	- સૂજતા - અસૂજતા પાણીની ગવેષણા કરી ન હોય.
આણાભોયણાએ ×	- સૂજતા-અસૂજતાની ગવેષણા કર્યા વગરનું ભોજન લેવા વડે
પાણ ભોયણાએ	- પ્રાણીવાળું (વિકલેન્દ્રિયવાળું) ભોજન લેવા વડે,
બીય ભોયણાએ	- બીજવાળું ભોજન લેવા વડે,
× ધણી આધુનિક પ્રતોમાં 'પાણોસણાએ' 'આણ ભોયણાએ' શબ્દો અહીં જોવા મળે છે. પરંતુ પ્રાચીન પ્રતોમાં આ શબ્દોનો ઉદ્દેખ જોવામાં આવેલ નથી. તત્ત્વ કેવળી ગમ્ય.	

શ્રાવક સામાયિક પ્રતિકમણ સૂત્ર

- હરિય ભોયણાએ - લીલોતરીવાળી લિક્ષા લેવા વડે,
- પચ્છાકમિયાએ - પશ્ચાતકર્મવાળી લિક્ષા લેવા વડે, (વહોરાવ્યા પછી સચેત પાણીથી હાથ ધોવે વગેરે દોષો)
- પુરેકમિયાએ - પૂર્વ કર્મવાળી લિક્ષા લેવા વડે, (વહોરાવ્યા પહેલા સચેત પાણીથી હાથ ધોવે વગેરે દોષો)
- અદિકૃહડાએ - નજરે દેખાતું નથી, તેવા સ્થાનેથી લાવેલ લિક્ષા લેવા વડે.
- દગ સંસકૃહડાએ - સચેત પાણીના સ્પર્શવાળી લિક્ષા લેવા વડે.
- રય સંસકૃહડાએ - સચેત રજના સ્પર્શવાળી લિક્ષા લેવા વડે.
- પારિસાડણિયાએ - વેરાતી, ઢોળાતી, છાંટા પડતાં હોય, તેવી લિક્ષા લેવા વડે,
- પારિણાવણિયાએ - ઘણાં કાંટાં, ગોઠલી વગેરે યુક્ત આહાર કે જે પરઠવો પડે તેવો પરઠવા યોગ્ય આહાર (અર્થાત્ વધારે પ્રમાણમાં આહાર લીધેલ હોય; જેથી પરઠવો પડે.) લેવા વડે.

શ્રાવક સામાચિક પ્રતિકમણ સૂત્ર

ઓહાસણભિક્ખાએ

જુ
ઉંગમેણાં

ઉપ્પાયણોસણાએ

અપરિસુદ્ધ
પરિગણિયં
પરિભુતં
વા

ન પરિદ્વિયં
તસ્સ મિથ્યા મિ દુક્કડં

- વિશિષ્ટ વस્તુઓ માંગીને ભિક્ષા લેવા વડે.
- (અને) જે આધકમાદિ ૧૬ ઉદ્ગમના દોષ વહોરાવનાર (ગૃહસ્થ) થી લાગે તેવી,
- ઉપ્પાયણ=ઉત્પાદનના દોષો (વહોરનાર સાધુથી) એષણાએ = એષણાના દોષો (ગૃહસ્થ અને સાધુ બંનેથી) લાગે તેવી,
- અશુદ્ધ ભિક્ષા
- ગ્રહણ કરેલી હોય,
- ભોગવેલી હોય, (વાપરી હોય)
- અથવા
- (અને) જે ભૂલથી ગ્રહણ કરેલી અશુદ્ધ ભિક્ષા.
- પરઠવી ન હોય તો
- તેનું મારું પાપ મિથ્યા થાઓ.

ત્રીજું શ્રમણસૂત્ર ×

પાઠ ૨૫ કાલપ્રતિલેખના - સૂત્ર

(સ્વાધ્યાય અને પ્રતિલેખનના દોષથી નિવર્ત્તવાનો પાઠ)

પરિક્રમામિ

- (ધૂં) પ્રતિકમણ કરું ધૂં.
(કયા અતિચારોનું ?)

× પૌષ્ટ આદિ પ્રત આરાધનામાં પ્રતિલેખનથી નિવૃત્ત થયા પછી 'ત્રીજા શ્રમણસૂત્ર' નો કાયોત્સર્ગ કરવાની વિધિ છે.

શ્રાવક સામાયિક પ્રતિકમણ સૂત્ર

ચાઉકાલં

- (સ્વાધ્યાય કરવાના) ચાર કાળ (દિવસ અને રાત્રિના પહેલા અને ચોથા પ્રહરમાં)

સજ્ગાયસ્સ

- સ્વાધ્યાયને,

અકરણયાએ

- નહિ કરવા વડે (તેમજ)

ઉભઅકાલં

- બંને કાળ (દિવસના ગ્રથમ અને છલ્લા પ્રહરમાં)

ભંડોવગરણસ્સ

- પ્રાત્ર અને વર્ષત્ર આદિ ઉપધિની

અઘડિલેહણાએ

- પ્રતિલેખના ન કરવા વડે;

દુઘડિલેહણાએ

- માઠી રીતે પ્રતિલેખના કરવા વડે,

અઘમજ્જણાએ

- રજોહરણ આદિથી પ્રમાર્જના ન કરવાથી,

દુઘમજ્જણાએ

- માઠી રીતે પ્રમાર્જના કરવાથી,

અઈકુમે

- અતિકમને વિષે

વઈકુમે

- બતિકમને વિષે

અઈયારે

- અતિચારને વિષે, અને

અણાયારે

- અનાચારને વિષે

જો મે ટેવસિઓ * અઈયારો કાઓ તસ્સ મિચ્છા મિ દુકુડ.

* પથાકાળ પ્રતિકમણમાં (૧) રાઈઓ (૨) પંક્ષિઓ (૩) ચાઉમાસિઓ અને (૪) સંવચ્છરિઓ શબ્દ બોલવા.

ચોથું શ્રમણસૂત્ર ×

પા� : ૨૬ : અસંયમ - સૂત્ર

(૩૩ બોલમાં હેય, જોય, ઉપાદેય સંબંધીનો પાઠ)

પડિક્કમાભિ	- હું નિવર્તું છું.
એગવિહે	- એક પ્રકારના
અસંજમે	- (અવિરતિરૂપ) અસંયમથી
પડિક્કમાભિ	- નિવર્તું છું.
દોહિં બંધણોહિં	- બે પ્રકારનાં (સંસારના હેતુ રૂપ) બંધનોથી,
રાગ બંધણોણાં	- રાગના બંધનથી
દોસ બંધણોણાં	- દ્વેષના બંધનથી
પડિક્કમાભિ	- નિવર્તું છું.
તિહિં દંડેહિં	- ત્રણ પ્રકારના ચિચારિતરૂપ ઐશ્વર્ય અસાર બને તેવા)

× ચોથા શ્રમણસૂત્રમાં એકથી તેત્રીશ બોલનું વર્ણન સુંદર રીતે કરવામાં આવેલ છે, તેત્રીશે બોલ જોય (=જાણવા યોગ્ય) છે. વિરતિરૂપ પરિણામવાળા ઉપાદેય (= આદરવા યોગ્ય) છે અને આશ્રચ આદિના હેતુભૂત છે તે હેય (=ત્યાગવા યોગ્ય) છે.

÷ પડિક્કમાભિ પાછો ફરું છું. જેનો નિષેધ છે, તેમાં પ્રવૃત્તિ કરવા વડે અને જેનો નિષેધ નથી અર્થાત્ જે આચરણીય છે તેમાં પ્રમાદવશ અતિચાર કરવા વડે અથવા નહીં આચરવા વિષે.

શ્રાવક સામાન્યિક પ્રતિક્રમણ સૂત્ર

દંડથી

- મણદંદેણાં** - મનના દંડથી (અશુભ
વિચારોથી)
- વયદંદેણાં** - વચનના દંડથી (અહિતકર
વાણીથી)
- કાયદંદેણાં** - કાયાના દંડથી (કાયાના
અયત્નાપૂર્વકના પ્રવર્તનથી)
- પડિક્કમાભિ** - નિવર્તું છું.
- તિહિં ગુતીહિં** - ત્રણ પ્રકારની ગુમિઓથી,
(ગુમિના પાલનમાં પ્રમાદવશ
લાગેલાં અતિચારોથી)
- મણ ગુતીએ** - મન ગુમિથી
- વય ગુતીએ** - વચન ગુમિથી
- કાય ગુતીએ** - કાય ગુમિથી
- પડિક્કમાભિ** - નિવર્તું છું.
- તિહિંસદ્ધેહિં** - ત્રણ પ્રકારનાં શલ્ય=શૂળથી
- માયા સદ્ધેણાં** - કપટના શલ્યથી
- નિયાણ સદ્ધેણાં** - નિદાનના શલ્યથી
- મિદ્ધા દંસણ સદ્ધેણાં** - મિથ્યાત્વરૂપી શલ્યથી
- પડિક્કમાભિ** - નિવર્તું છું.
- તિહિં ગારવેહિં** - ત્રણ પ્રકારના; ગર્વ=ગારવથી
- ઈડ્ધી ગારવેણાં** - ત્રદ્ધિના ગર્વથી (પદવી,
સત્કાર, સન્માનાદિ પ્રામિંનાં
અભિમાન અને પ્રામ ન
થવાથી લાલસા રાખવી તે)

શ્રાવક સામાયિક પ્રતિક્રિયા સૂત્ર

રસ ગારવેણાં

- રસના ગર્વથી (સ્વાદની લોલુપતા)

સાયા ગારવેણાં

- શારીરિક, માનસિક સુખ શાતાનો ગર્વ કરવાથી

પડિક્કમાભિ

- નિવર્તું છું.

તિહિં વિરાહણાહિં

- ત્રણ પ્રકારની વિરાધનાથી

નાણ વિરાહણાએ

- જ્ઞાનની વિરાધનાથી (જ્ઞાન તથા જ્ઞાનીની નિંદા, જ્ઞાન ભાગવામાં પ્રમાદ, બીજાને અંતરાય, અકાળમાં સ્વાધ્યાય આદિ)

દંસણ વિરાહણાએ

- દર્શનની વિરાધનાથી (સમકિત અંને સમકિતધારી સાધકની નિંદા, મિથ્યાત્વ; મિથ્યાત્વીની પ્રશંસા વગેરે)

ચારિત વિરાહણાએ

- ચારિત્રની વિરાધનાથી (પ્રત આદિમાં દોષ લગાડવા વગેરે)

પડિક્કમાભિ

- નિવર્તું છું.

ચઉહિં કસાએહિં

- ચાર પ્રકારના, કષાયોથી

કોષ કસાએણાં

- કોષ કષાયથી,

માણ કસાએણાં

- માન કષાયથી,

માયા કસાએણાં

- માયા=કપટ કષાયથી,

લોષ કસાએણાં

- લોભ કષાયથી,

પડિક્કમાભિ

- નિવર્તું છું.

ચઉહિં સત્રાહિં

- ચાર પ્રકારની; સંજ્ઞા=ઈચ્છાઓથી

શ્રાવક સામાયિક પ્રતિકમણ સૂત્ર

આહારસત્તાએ	- આહારસંજ્ઞાથી,
ભયસત્તાએ	- ભયસંજ્ઞાથી,
મેહુણસત્તાએ	- મૈથુનસંજ્ઞાથી,
પરિગ્રહસત્તાએ	- પરિગ્રહસંજ્ઞાથી,
પડિક્કમાભિ	- નિવર્તું છું.
ચઉહિં વિકહાહિં	- ચાર પ્રકારની; વિકથાઓથી
ઈત્યીકહાએ	- સ્ત્રીના શુંગારાદિની કથાથી,
ભતકહાએ	- ભોજન સંબંધી કથાથી,
દેસકહાએ	- દેશ સંબંધી કથાથી,
રાયકહાએ	- રાજા, પ્રધાન વગેરેની કથાથી.
પડિક્કમાભિ	- નિવર્તું છું.
ચઉહિં જાણોહિં	- ચાર પ્રકારના; ધ્યાનોથી
અદેણાં જાણોણાં	- આર્તધ્યાન કરવાથી,
રૂદેણાં જાણોણાં	- રૌદ્રધ્યાન કરવાથી,
ધર્મદેણાં જાણોણાં	- ધર્મધ્યાન ન ધ્યાવવાથી,
સુક્કેણાં જાણોણાં	- શુક્લધ્યાન ન ધ્યાવવાથી,
પડિક્કમાભિ	- નિવર્તું છું.
પંચહિં કિરિયાહિં	- પાંચ કિયાઓથી (= પાપ આવવાના કારણોથી)
કાઈયાએ	- કાયા દ્વારા (અયત્નાએ) થનારી કિયા. તે કાયિકીકિયા.
અહિગરણિયાએ	- જે કિયા કરવાથી આત્મા નરક આદિ દુર્ગતિનો અધિકારી બને છે, તે અધિકરણિકી કિયાથી.
પાઉસિયાએ	- જીવ તથા અજીવ ઉપર

દ્વેષભાવ કરવો તે પ્રદેશિકી
કિયાથી.

પારિતાવણિયાએ

- પોતાને કે પરને મારપીટ
વગેરેથી સંતાપ આપવો તે
પારિતાપનિકી કિયાથી.

પાણાઈવાય કિરિયાએ

- સ્વ પરના પ્રાણનો નાશ થાય
તે પ્રાણાતિપાતિકી કિયાથી

પડિક્કમાભિ
પંચહિં કામગુણોહિં

- નિવર્તું છું.
- પાંચ કામ ગુણોથી (વિષય
ભોગને ઉત્તેજન આપનાર)

સદૃષાં

- શબ્દથી (વિકારી શબ્દો
સાંભળવાથી)

રૂવેષાં

- સ્ત્રી આદિના રૂપો નિરખવાથી
- ગંધથી (સુગંધી, ફૂલ, સેંટ,
અત્તરથી)

રસેષાં

- રસથી (પુષ્ટિકારક ભોજનથી)

ફાસેષાં

- સ્પર્શથી (કોમળ, મુલાયમ)

પડિક્કમાભિ

- નિવર્તું છું.

પંચહિં મહિષઅહિં

- પાંચ મહિષતોમાં લાગેલા દોષો
થકી જેવા કે

સવ્યાઓ પાણાઈવાયાઓ

- સર્વ પ્રાણાતિપાત=જીવ હિંસાથી,

વેરમણાં

- વિરમણમાં

સવ્યાઓ મુસાવાયાઓ

- સર્વ મૃષાવાદ=જૂઠું બોલવાથી,

વેરમણાં

- વિરમણમાં

સવ્યાઓ અદિત્રાદાણાઓ

- સર્વ અદત્તાદાન=ચોરી

વેરમણાં

- કરવાથી, વિરમણ માં

શ્રાવક સામાયિક પ્રતિક્રિમણ સૂત્ર

- | | |
|----------------------------------|--|
| સવ્વાઓ મેહુણાઓ
વેરમણાં | - સર્વથા પ્રકારે મૈથુનથી
- વિરમણા=પ્રભાગ્ય મહાપ્રત |
| સવ્વાઓ પરિગણાઓ
વેરમણાં | - સર્વથા પ્રકારે પરિગ્રહથી
- વિરમણા=અપરિગ્રહ મહાપ્રતમાં
લાગેલા દોષોથી. |
| પડિક્કમામિ | - નિવર્તું છું. |
| પંચહિં સમિઈહિં | - પાંચ પ્રકારની સમિતિમાં
લાગેલા દોષોથી |
| ઈરિયાસમિઈએ
ભાસાસમિઈએ | - ઈર્યા (ગમનાદિક) સમિતિમાં
- ભાષા (સર્વ જીવોને હિત,
મિત, પ્રિય બોલવું) સમિતિમાં |
| અસણાસમિઈએ | - અસણા (૪૨ દોષ રહિત
આહાર પાણી વ. લાવવા તે)
સમિતિમાં. |
| આયાણ ભંડમતા
નિક્ખેવણા સમિઈએ | - વસ્ત્ર, પાત્ર, આદિ ઉપકરણ
લેતાં - મૂકૃતાં યતના રાખવાની
સમિતિમાં લાગેલ દોષોથી. |
| ઉચ્ચાર-પાસવણા-ખેલ
જલ્દ-સિંધાણ | - વડીનીત, લઘુનીત, કઝ, શરીરના
મેલ, નાકનો મેલ તેને પરઠવાની |
| પારિદ્રાવણિયા સમિઈએ | સમિતિમાં લાગેલ દોષોથી. |
| પડિક્કમામિ | - નિવર્તું છું. |
| છહિં જીવનિકાએહિં | - છ પ્રકારના; (જીવ=આત્મા અને
નિકાય=સમૂહ) જીવ નિકાયોથી,
અર્થાત્ જીવોની હિંસાના દોષોથી |

શ્રાવક સામાચિક પ્રતિક્રિયા સૂત્ર

પુઢવિકાએણ	- પૃથ્વીકાયની હિંસાથી
આઉકાએણ	- અપ્રકાયની હિંસાથી,
તઉકાએણ	- તઉ (અજિન) કાયની હિંસાથી,
વાઉકાએણ	- વાયુકાયની હિંસાથી
વાણસ્સઈકાએણ	- વનસ્પતિકાયની હિંસાથી,
તસકાએણ	- ત્રસકાયના જીવોની હિંસાથી,
પડિક્રમામિ	- નિવર્ત્તુ ઈં.
ઇહિ લેસાહિં	- ઇ લેશ્યાઓથી, અર્થાત् પહેલી ત્રણ અધર્મ-લેશ્યામાં પ્રવૃત્તિ કરવાથી અને અંતિમ ત્રણ ધર્મ લેશ્યાનું આચરણ ન કરવાથી.
કુષ્ઠલેસાએ	- કૃષ્ણલેશ્યાથી (હિંસા આદિ અત્યંત ભલિન પરિણામ)
નીલલેસાએ	- નીલલેશ્યાથી (કોધ, દ્વેષ આદિ પરિણામ)
કાઉલેસાએ	- કાપોતલેશ્યાથી (વિષય અભિલાષા આદિ પરિણામ)
તઉલેસાએ	- તેજોલેશ્યાથી (આત્માના શુભ પરિણામનું આચરણ ન કરવાથી,)
પઉમલેસાએ	- પભલેશ્યાથી (આત્માના શુભતર પરિણામનું આચરણ ન કરવાથી,)
સુકુલેસાએ	- શુકુલેશ્યાથી (આત્માના શુભતમ પરિણામનું આચરણ ન

આવક સામાયિક પ્રતિકમણ સૂત્ર

પદિક્કમાભિ	- કરવાથી.)
સતહિ ભયઠાણોહિ	નિવર્તુ છું.
અહુહિ ભયઠાણોહિ	સાત+પ્રકારના ભયના સ્થાન સેવવાથી
નવહિ બંભચેરગુજીહિ	આઈ પ્રકારના મદના × સ્થાન સેવવાથી
દસવિહે સમણધમ્મે ÷	નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુમિમાં ÷પ્રમાદથી લાગેલા દોષો થકી દશ પ્રકારના સાધુ ધર્મમાં લાગેલા દોષોથી.

+ ૧ આલોકભય, ૨ પરલોકભય, ૩ આદાન ભય, ૪ અક્સમાત ભય,
૫ આણવિકાભય, ૬ મરણભય અને ૭ અપજશભય.

× આઈ મદ - ૧ જાતિમદ, ૨ કુળમદ, ૩ બળમદ, ૪ રૂપમદ, ૫ તપમદ,
૬ લાભમદ, ૭ શુદ્ધમદ અને ૮ ઐશ્વર્ય મદ.

× બ્રહ્મચર્યની નવ ગુમિ - (૧) પહેલી વાડે સ્ત્રી, પશુ અને નુપંસક સહિત
સ્થાનક સેવવું નહિ, અને સેવે તો ઉદ્ર બિલાડીનું દ્રષ્ટાંત, (૨) બીજી વાડે
સ્ત્રી પુરુષની વિષપરૂપ વિકથા કરવી નહિ, કરે તો લીંબુ ને દાઢનું દ્રષ્ટાંત,
(૩) ત્રીજી વાડે સ્ત્રી પુરુષના આસન પર અંતર્મુહૂર્ત ગયા સિવાય બેસવું નહિ.
બેસે તો કોણું ને કષ્ટકાળનું દ્રષ્ટાંત, (૪) ચોથી વાડે સ્ત્રી પુરુષના અંગોપાંગ વિષપ-
બુદ્ધિ નિરખવાં નહિ, નિરખે તો સૂર્ય ને નેત્રનું દ્રષ્ટાંત, (૫) પાંચમી વાડે
(કુડયાંતરે) ભીત ખપેડાને આંતરે ગૃહસ્થ વસતા હોય ત્યાં બ્રહ્મચારીએ વસવું
નહિ. વસે તો લાખ, અજિન અને મીળાનું દ્રષ્ટાંત, (૬) છઠી વાડે પૂર્વ ભોગવેલા
કામલોગ સંભારવા નહિ, સંભારે તો મુસાફરને (સાપના વલોજાંની) છાશનું
દ્રષ્ટાંત; (૭) સાતમી વાડે પ્રતિદિન અતિશાય સરસ આહાર કરવો નહિ, કરે
તે સન્જિપાતવાળાને દૂધ સાકરનું દ્રષ્ટાંત (૮) આઈમી વાડે અતિશાય ચાંપીને
આહાર કરવો નહિ, કરે તો શેરની તોલડી અને બશેરનું દ્રષ્ટાંત, (૯) નવમી
વાડે શરીર ઉપર શોભા શાસ્ત્રગાર કરવા નહિ, કરે તો રંક ને રલનું દ્રષ્ટાંત,

શ્રાવક સામાયિક પ્રતિક્રિયા સૂત્ર

એકારસહિં

ઉવાસગપદિમાહિં ×

બારસહિં લિકખુ પડિમાહિં + બાર પ્રકારની સાધુજીની
પડિમામાં લાગેલા દોષથી નિવર્તું
દુઃ.

- અગિયાર પ્રકારની શ્રાવકની

પડિમા સંબંધી લાગેલા દોષોથી.

બાર પ્રકારની સાધુજીની
પડિમામાં લાગેલા દોષથી નિવર્તું

÷ દશવિધ શ્રમણ ધર્મ - ૧ ક્ષમા, ૨ નિર્લોભતા, ૩ આર્જવ - સરળતા,
૪ માર્દવ - નિરાભિમાનપણું, ૫ લઘુતા, ૬ સત્ય, ૭ સંયમ, ૮ તપ, ૯ ત્યાગ
અને ૧૧ બ્રહ્મચર્ય.

× શ્રાવકની ૧૧ પડિમા - ૧. દર્શન પડિમા - એક માસ પર્યત નિર્મળ
સમકિત પાણે, શંકા, કંખા આદિ અતિચાર સેવે નહિ; ૨. વ્રત પડિમા - બે
માસ પર્યત સમ્યકત્વપૂર્વક વ્રત પ્રત્યાખ્યાન નિરતિચાર પાણે; ૩. સામાયિક
પડિમા ત્રણ માસ પર્યત સમકિત અને વ્રતો સહિત પ્રાતઃ અને સંધ્યા એમ
પ્રતિદિન બે સામાયિક નિરતિચાર કરે; ૪. પૌષ્ઠ્રપડિમા - ચાર માસ પર્યત
પૂર્વોક્ત ત્રણે બોલના આરાધન સહિત, અદાર દોષ રહિત દર માસે છ પોષા
કરે; ૫. નિયમ પડિમા - પાંચ માસ સુધી ઉપરના ચારે બોલ પાળવા ઉપરાંત
પાંચ પ્રકારના નિયમ પાણે - ૧. સ્નાન કરે નહિ, ૨. રાત્રિ ભોજન કરે નહિ,
૩. ધોતિયાની કાછડી વાળે નહિ, ૪. દિવસે બ્રહ્મચર્ય પાણે, ૫. રાત્રે બ્રહ્મચર્યનું
પરિમાણ કરવું, ૬. બ્રહ્મચર્ય પડિમા-છ મહિના સુધી ઉપરના બોલ પાળવા,
ઉપરાંત દિવસે અને રાત્રે નિરતિચાર બ્રહ્મચર્ય પાણે; ૭. સચિતપરિત્યાગ
પડિમા-સાત મહિના સુધી ઉપરના બોલ પાળવા, ઉપરાંત સચિત આહારનો
ત્યાગ કરે; ૮. અણારંભ પડિમા-આઠ મહિના સુધી ઉપરના બોલ પાળવા,
ઉપરાંત છકાયનો સ્વયં આરંભ કરે નહિ; ૯. પ્રેખારંભ પડિમા-નવ માસ સુધી
ઉપરના બોલ પાળવા, ઉપરાંત અન્ય પાસે આરંભ કરાવે નહિ, ૧૦. ઉત્કૃષ્ટ
ભક્ત પડિમા-દશ માસ સુધી ઉપલા બોલ પાળવા, ઉપરાંત કેશલીય કરે અથવા
શીખા રાખે પોતાને ઉદેશી થયેલા આહારાદિ ગ્રહણ કરે નહિ; ૧૧. સમજાભૂય
પડિમા-અગિયાર માસ સુધી ઉપરના બોલ પાળવા ઉપરાંત મસ્તક, દાઢી, મૂછનો
લોચ કરે, સાધુ જેવો વેષ રાખે. રજોહરણની દાંડી પર કપડું ન લાપેટે,
સ્વજાતિમાંથી નિર્દોષ ગોચરી કરે.

શ્રાવક સામાયિક પ્રતિક્રિયા ગ્રહણ સૂત્ર

તેરસહિં કિરિયાઠાણોહિં +

તેર ક્રિયાના સ્થાનકો સંબંધી
લાગેલા દોષોથી નિવર્તું છું.

ચઉદ્દસહિં ભૂયગામેહિં + -

ચૌદ પ્રકારના ભૂતગ્રામ એટલે-
પ્રાણી સમુદ્દરાય સંબંધી લાગેલા
દોષોથી નિવર્તું છું.

+ બાર પ્રકારની લિક્કખુની પડિમા - પહેલી એક માસની તે
એક માસ સુધી આહાર પાણીની એક એક દાત (અખંડિત ઘાર)
ગ્રહણ કરે, બીજી બે માસની તેમાં આહાર પાણીની બે દાત ગ્રહણ
કરે, એમ અનુક્રમે અકેક વધારતાં સાતમી પડિમા સાત માસની
તેમાં સાત દાત ગ્રહણ કરે, આઠમી પડિમા સાત અહો રાત્રિની-
તેમાં એકાંતર ચોવિહારો ઉપવાસ કરે, ગામની બહાર કાઉસ્સગ
કરે, ઉત્તાનાદિ આસને રહી ઉપસર્ગ સહન કરે, નવમી પડિમા સાત
અહોરાત્રિની. તેમાં ઉત્કટ આસને અથવા દંડાસને રહે, ચઉદ્દિહારા
ઉપવાસ કરે, ગામ બહાર કાઉસ્સગ કરી ઉપસર્ગ સહન કરે, દશમી
પડિમા ૭ અહોરાત્રિની, પૂર્વોક્ત ક્રિયા સહિત વીરાસનાદિ આસને
રહે, ૧૧મી પડિમા એક અહોરાત્રિની તેમાં ચોવિહારો છઠ કરે;
બીજે દિવસે ગામ બહાર એક અહોરાત્રિનો કાઉસ્સગ કરે. ૧૨મી
પડિમા એક રાત્રિની, તેમાં અઠમભક્ત ચોવિહાર કરે,
સ્મરણભૂમિમાં એક પુદ્ગલ ઉપર સ્થિર દૃષ્ટિ રાખી એક રાત્રિનો
કાઉસ્સગ કરે, આઠમીથી બારમી પ્રતિમા સુધી દેવ, મનુષ્ય અને
તિર્યંચના ઉપસર્ગો સહન કરે.

ક્રિયાના તેર સ્થાનક - ૧. અર્થદંડ (પોતાના પ્રયોજન માટે),
૨. અનર્થદંડ (કારણ વિના ક્રિયા કરે), ૩. હિંસા કરવાનો સંકલ્પ
કરી હિંસા કરે, ૪. અક્સમાત ક્રિયા તે જેમ કોઈ હરણને તીર મારવા
જતાં માણસને વાગે અને તેનો જીવ જાય. ૫. દૃષ્ટિ વિપર્યાસ દંડ

પત્રરસહિં પરમાહિમિઅહિં^x - પંદર પ્રકારના પરમાધામીના
પાપની અનુમોદના વગેરે દોષોથી
નિવર્ત્તુ છું.

સોલસહિં ગાહાસોલસઅહિં - સૂયગડાંગસૂત્રના પ્રથમ શ્રુત-
સુંધના ૧૮ અધ્યયન - સંબંધી
અશ્રદ્ધા, ઉત્સૂત્ર પ્રરૂપણા આદિ

પત્થર સમજુને તેતર ચકલી આદિની હિંસા થવી તે, ૬.
મુસાવાઈક્રિયા તે જૂદું બોલવાથી લાગે, ૭. અદત્તાદાન ક્રિયા તે
ચોરી કરવાથી લાગે, ૮. અધ્યાત્મ પ્રાત્યયિક ક્રિયા તે આર્ત-રૌદ્ર
ધ્યાન ધરવું, ૯. માણવત્તિયા ક્રિયા તે અહંકાર કરવાથી લાગે,
૧૦. અમિત (ક્રિયા) તે પુત્ર, સેવક આદિને થોડે અપરાધે ઘણો
દંડ કરે તે, ૧૧. માયાવત્તિયા તે કપટ કરવું તે, ૧૨ લોભવત્તિયા
તે લોભ કરવો તે અને ૧૩. ઈરિયાવહિયા ક્રિયા તે અક્ષાયી મુનિ
તથા કેવળીને યોગોના પ્રવર્તનથી હોય.

+ સૂક્ષ્મ એકેન્દ્રિયનો અપર્યાપ્તો, ૨. સૂક્ષ્મ એકેન્દ્રિયનો પર્યાપ્તો,
૩. બાદર એકેન્દ્રિયનો અપર્યાપ્તો, ૪. બાદર એકેન્દ્રિયનો પર્યાપ્તો,
૫-૬ બેઈન્દ્રિયનો અપર્યાપ્તો અને પર્યાપ્તો, ૭-૮ તેઈન્દ્રિયનો
અપર્યાપ્તો અને પર્યાપ્તો, ૯-૧૦ ચૌરીન્દ્રિયનો અપર્યાપ્તો અને
પર્યાપ્તો, ૧૧-૧૪ સંશી પંચેન્દ્રિયનો અપર્યાપ્તો-પર્યાપ્તો, એ
જીવના ચૌદ ભેદ.

^x ભવનપતિની જાતિમાં આવા પરમ અધમી દેવો ૧૫
પ્રકારના હોય છે. તેઓ નારકી જીવોને મહાદુઃખો આપવામાં જ
આનંદ માને છે; તેના નામ-અંબ, અંબરિષ, શ્યામ, શબલ, રૌદ્ર,
મહારૌદ્ર, કાલ, મહાકાલ, અસિપત્ર, ધનુ, કુંભ, વાલુ, વૈતરણિ,
ખરસ્વર અને મહાધોષ.

શ્રાવક સામાચિક પ્રતિક્રિમણ સૂત્ર

સત્તરસવિહે ×	- દોષોથી નિવર્તુ છું.
અસંજમે	- સત્તર પ્રકારના અસંયમથી નિવર્તુ છું.
અઢારસવિહે	- અઢાર પ્રકારના અબ્રહાર્યથી
અબંભે ×	નિવર્તુ છું.
એગૂણવીસાએ	- શ્રી જ્ઞાતાજ્ઞસૂત્રના ૧૮
નાયજ્જયધોહિં ×	અધ્યયનો સંબંધી દોષોથી નિવર્તુ છું.

× સત્તર પ્રકારનો અસંયમ - ૧. પૃથ્વી, ૨. પાણી, ૩. અગ્નિ,
વાયરો, ૪ વનસ્પતિ, ૫. બેઈન્ડ્રિય, ૭. તેઈન્ડ્રિય, ૮. ચઉરિન્ડ્રિય,
૯. પંચેન્ડ્રિય. એ નવને હળવા તે અસંયમ, ૧૦. અજીવ તે
અજતનાથી વસ્તુ વાપરે અગાર ઊપકરણાદિનો નાશ કરે, ૧૧. પેહા
તે જોયા વિના જમીન પર બેસે, ૧૨. ઉપેહા એટલે સંયમને વિષે
બેદર્કારી, ૧૩. અપમજ્ઞણા તે પાત્રાદિકને બરાબર પૂંજે નહિ,
૧૪. પરિઠવણા-પાત્રાદિકને અવિધિએ પરઠવે, ૧૫ મન અસંયમ,
૧૬. વચન અસંયમ અને ૧૭ કાયા અસંયમ.

× અઢાર પ્રકારના અબ્રહાર્ય - ઔદારિક (મનુષ્ય તિર્યચ)
સાથે વિષય સેવવો, સેવરાવવો અને અનુભોદવો એ ગ્રાણ મને કરી,
૨ વચને કરી અને ઉ કાયાએ કરી એમ નવ અને તેવી જ રીતે
વૈક્રિય શરીર (દેવ-દેવી) સંબંધી નવ પ્રકાર એટલે કુલ ૧૮ પ્રકારનું
અબ્રહાર્ય.

શ્રાવક સામાયિક પ્રતિકમણ સૂત્ર

વીસાએઅસમાહિ
ઠાણોહિ +

ઈકુવીસાએ સબળોહિ +

- ૨૦ પ્રકારના અસમાધિ સ્વયાનોથી
નિવર્તું છું. (પોતાને અને પરને
અસમાધિ એટલે ચિત્તાની
આસ્થિરતા ઉપજાવતાં સ્વયાનક)
એકવીશ પ્રકારના સબળા દોષો કે
જેથી ચારિત્રને હાનિ પહોંચે તેથી
નિવર્તું છું.

× ૧ મેઘકુમારનું, ૨ વિજયચોર ને ધન્નાશેઠનું, ૩ મોરના ઈડાનું,
૪ કાચબાનું, ૫ થાવચ્ચા પુત્રનું, ૬ તુંબડીનું, ૭ રોછિશીનું, ૮
મહિનાથનું, ૯ જિનરક્ષિત જિનપાલનું, ૧૦ ચંદ્રનું, ૧૧ વૃક્ષને દ્રાઘાતે
સંસારની અસારતાનું, ૧૨ ખાઈના પાણીનું, ૧૩ નંદમહિયારનું, ૧૪.
તેતલીપુત્ર ગ્રધાનનું, ૧૫ નંદીફળ (સમુద્રના વૃક્ષનું), ૧૬ દ્રૌપદીનું, ૧૭
અકીણક દ્વીપના ઘોડાનું, ૧૮ સુસુમા હુંવરીનું, ૧૯ પુંડરીક કંડરીકનું.

÷ વીશ અસમાધિના ઠેકાણા - ૧. ઉતાવળો ચાલે, ૨ વગર પોંજ્યે
ચાલે, ૩ જેમ તેમ પોંજ્ણને ચાલે, ૪ વધારે પાટ પાટલા ભોગવે, ૫
ગુરુ સામું બોલે, ૬ સાધુની ઘાત ચિંતવે, ૭ પ્રાણીની ઘાત ચિંતવે, ૮
વારંવાર કોધ કરે, ૯ પારું વાંકું બોલે, ૧૦ નિશ્ચયકારી ભાષા બોલે,
૧૧ કલેશ કરે, ૧૨ ઉપશાંત ફ્રૂલેશની ઉદ્દીર્ણા કરે, ૧૩ અકાળે સજાય
કરે, ૧૪ બહારથી આવ્યા પછી હાથ પગ પૂંજ્યા વગર બેસે, ૧૫ પહોર
રાત્રિ ગયા પછી ઉંચે સાઢે બોલે, ૧૬ માંહોમાંહે કજિયા કરે, ૧૭ ગરુદ
ભેદ કરે - તડ પડાવે, ૧૮ પોતે તપે-બીજાને તપાવે, ૧૯ સૂર્યોદયથી
સૂર્યાસ્ત સુધી ખા ખા કરે અને ૨૦ અનૈષણિક આહાર આદિનું સેવન
કરવું.

+ એકવીશ પ્રકારના સબળા દોષ - ૧ હસ્તકર્મ કરે તો સબળો
દોષ લાગે, ૨ મૈથુન સેવે તો, ૩ રાત્રિ ભોજન કરે તો, ૪ દોષ
સહિત લીધેલો આહાર જમે તો, ૫ રાજપિંડ ભોગવે તો, ૬ સાધુ

શ્રાવક સામાચિક પ્રતિક્રિમણ સૂત્ર

બાવીસાએ × પરિસહેલિ - બાવીશ પરિષહોમાં લાગેલા દોષોથી નિવર્તુ છું.

તવીસાએ સૂયગડજયષેહિ - સૂયગડાંગસૂત્રના પહેલાં અને બીજા શુતસ્કંધના મળીને ૨૭ અધ્યયન છે. (તેમાં વિપરીત શ્રદ્ધા-પ્રરૂપણા આદિ દોષોથી નિવર્તુ છું.

નિમિત્ત ખરીદેલો, ઉધાર દીઘેલો, એ પાંચ દોષયુક્ત આહારાદિ ભોગવે તો, ૭ વારંવાર પચ્ચકખાણ લઈને ભાંગે તો, ૮ વગર પ્રયોજને છ માસની અંદર સંપ્રદાય બદલે તો, ૯ એક મહિનામાં ત્રણ નદી ઉતરે તો, ૧૦ એક મહિનામાં ત્રણ માયાના સ્થાન સેવે તો, ૧૧ મંકાનમાં ઉત્તરવાની આજ્ઞા આપનારના ઘરનો આહાર ભોગવે તો, ૧૨ જાણી જોઈને હિંસા કરે; ૧૩ જાણી જોઈને અસત્ય બોલે, ૧૪ જાણી જોઈને ચોરી કરે, ૧૫ સચેત પૃથ્વી પર બેસે, ૧૬ પાણીથી ભીજાયેલી જમીન પર બેસવું, ૧૭ સચેત કે જીવજંતુવાળી જમીન કે પાટપાટલા પર બેસે, ૧૮ મૂળ, કંદ, સ્કંધ, શાખા, પ્રતિશાખા, ત્વચા, પ્રવાલ, પાંડડાં, કૂલ, ફળ અને બીજ એ દશ પ્રકારની કાચી વનસ્પતિ ભોગવે, ૧૯ એક વર્ષમાં દશ વખત નદી ઉતરે, ૨૦ એક વર્ષમાં દશ વખત માયાનાં સ્થાન સેવે, ૨૧ સચેત વસ્તુએ કરી હાથ કે વાસણ ખરડાયેલ હોય તેવા પાસેથી આહાર લે, એમ એકવીશ પ્રકારે સબળા દોષ લાગે.

× બાવીસ પરિષહ - ૧ ભૂખનો, ૨ તરસનો, ૩ ટાઢનો, ૪ તડકાનો, ૫ ડાંસ મચ્છરનો, ૬ અચેલનો (વસ્ત્ર જોઈતાં નહિ મળવાનો), ૭ અરતિનો, ૮ સ્ત્રીનો, ૯ ચર્ચા (ચાલવા)નો, ૧૦ બેસવાનો, ૧૧ સેક્ષા (સ્થાનક)નો, ૧૨ આકોશ વચનનો, ૧૩

ચઉવીસાએ દેવાહિ -

- ચોવીસ જાતના દેવોની
આશાતનાનો દોષ લાગ્યો હોય
તેથી નિવર્તુ છું.

પણવીસાએ ભાવણાહિ + -

પાંચ મહાપ્રતોની પચીસ પ્રકારની
ભાવનાઓ નહિ ભાવવાથી
અધવા તે સંબંધી લાગેલા દોષોથી
નિવર્તુ છું.

વધ (માર)નો, ૧૪ જાચવાનો, ૧૫ અલાભનો, ૧૬ રોગનો, ૧૭
તૃષ્ણસ્પર્શનો, ૧૮ મેલનો, ૧૯ સત્કાર પુરસ્કારનો, ૨૦ પ્રજ્ઞાનો,
૨૧ અજ્ઞાનનો અને ૨૨ દર્શનનો.

- ચોવીસ દેવો - ૧૦ ભવનપતિ, ૮ વંતર, ૫ જ્યોતિષી
અને ૧ વૈમાનિક એ કુલ ૨૪ જાતના દેવતા તેમજ ચોવીસ તીર્થકર
દેવો.

+ પચીસ પ્રકારની ભાવના - પાંચ મહાપ્રતની દરેકની પાંચ
પાંચ ભાવના એ પ્રમાણે - પહેલા મહાપ્રતની પાંચ - (૧) ઈરિયા-
ભાવના, (૨) મન ભાવના, (૩) વચનભાવના, (૪)
અખણાભાવના, (૫) નિક્ખલેવણા ભાવના. બીજા મહાપ્રતની પાંચ
ભાવના - ૧ ભાષા વિચારીને બોલે. ૨ હાંસીથી જુહુ ન બોલે.
૩ કોધથી જુહુ ન બોલે. ૪ લોભથી જુહુ ન બોલે. ૫ ભયથી
જુહુ ન બોલે. ત્રીજા મહાપ્રતની પાંચ-૧ જે સ્થાનમાં રહે તેના
માલિકની અથવા તેના માણસની આજ્ઞા લઈને રહેવું, ૨ તેમાંની
વસ્તુ રજા લીધા વિના ભોગવવી નહિ, ૩ સ્થાનક સમારવું નહિ,
૪ સ્વધમી સાથે સંવિભાગ કરી વસ્તુ ભોગવવી, ૫ મોટેરાનો વિનય
કરવો. ચોથા મહાપ્રતની પાંચ-૧ સ્ત્રી, પશુ, નપુંસક રહિત સ્થાનક
સેવવું, ૨ સ્ત્રીની કથા કરવી નહિ, ૩ પૂર્વના કામભોગ સંભારવા

શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર

છૃબીસાએ હસાક્પવવહારાણં- શ્રી દશાશ્વતર્સ્કંધના ૧૦

ઉદેસણ કાલેહિ

બૃહતકલ્યના ૫ અને વ્યવહાર
સૂત્રનાં ૧૦ ઉદેશા એ કુલ ૨૫
ઉદેશા છે તેને વિશે શ્રદ્ધા-પ્રરૂપણા
તથા ફરસના સંબંધી કઈ પણ દોષ
લાગ્યા હોય તો તેથી નિવર્તું છું.

સત્તાવીસાએ અણગાર ગુણોહિં- સાધુજીના સત્તાવીશ ગુણો

સંબંધી * લાગેલા દોષોથી નિવર્તું
છું.

અણાવીસાએ આયારપ્પકષોહિં- સાધુજીના આચારના અણાવીશ
કલ્ય (૨૫ આચારાંગના અને
ત્રણ નિશિથસૂત્રના એમ ૨૮
અધ્યયનો વિરુદ્ધ શ્રદ્ધા પ્રરૂપણા

નહિ, ૪ સરસ સરસ આહાર કરવો નહિ, ૫ સ્ત્રીને આસને બેસવું
નહિ. પાંચમા મહાપતની પાંચ-૧ શ્રોતેંદ્રિય વશ રાખવી, ૨
ચક્ષુઈન્દ્રિય ઉ પ્રાણોન્દ્રિય, ૪ રસેન્દ્રિય અને ૫ સ્પર્શેન્દ્રિય વશ
રાખવી, એ કુલ ૨૫ ભાવના.

* સાધુના ૨૭ ગુણો - ૫ મહાપતોનું પાલન, ૫ ઈન્દ્રિયોનો
નિગ્રહ, ૪ કષાયનો ત્યાગ, એ ચૌદ, ૧૫ ભાવસત્ય, ૧૫
કરણસત્ય, ૧૭ જોગસત્ય, ૧૮ ક્ષમા, ૧૯ વૈરાગ્ય, ૨૦
મનોગુપ્તિ, ૨૧ વચનગુપ્તિ, ૨૨ કાયગુપ્તિ. ૨૩ જ્ઞાનસંપત્તતા,
૨૪ દર્શનસંપત્તતા, ૨૫ ચારિત્રસંપત્તતા, ૨૬ પરિષહ સહન; ૨૭
મરણથી ડરે નહિ. (આ ગુણો જુદી જુદી અનેક રીતે
શાસ્ત્રોમાં છે.)

એગૃહાતીસાએ પાવ
સુયપ્પસંગોહિં+
તીસાએ મહામોહણીય
ઠાણોહિં ×

દારા લાગેલા અતિચારથી નિવર્તું
છુ.)
ઓગણતીશ પાપસૂત્રના
પ્રસંગોથી નિવર્તું છુ.
ત્રીસ મહામોહણીયના સ્થાનકોનું
સેવન કરવાથી નિવર્તું છુ.

+ ૨૮ પાપસૂત્રો - ૧ હાસ્યાદિકનો ગ્રંથ, ૨ રૂધિરાદિક વરસે તેનો ગ્રંથ,
૩ ગ્રહના ચાળાના ફળ લઘ્યાં હોય તે, ૪ ધરતીકંપના ફળનું શાન બતાવે
તે, ૫ શરીરનાં લક્ષણ સંબંધી ગ્રંથ, ૬ મસ તિલાદિના શાન સંબંધી ગ્રંથ ૭
હાથ પગની રેખા પ્રમુખનું શાન બતાવનાર ગ્રંથ, ૮ સ્વરનાં લક્ષણ સંબંધી
ગ્રંથ. આ આઈ મૂળ, આઈ તેની વૃત્તિ અને આઈ વાર્તિક એમ દરેકના ગ્રણ
ત્રણ ભેદ ગણતાં ૨૪ થયા, ૨૫ ગંધર્વ, ૨૬ નાટક, ૨૭ વાસ્તુવિદ્યાના શાસ્ત્ર,
૨૮ આયુર્વેદ અને ૨૯ ધનુર્વેદ, એ ઓગણતીસ પાપસૂત્ર.

× ત્રીશ મહામોહણીયનાં સ્થાનક - ૧. ત્રસ જીવને પાણીમાં તુબાડીને
મારે. ૨. લીલાં ચામડાથી માથું બાંધીને મારવું, ૩. મોઢ દુચો દઈ શાસ વગેરે
રોકીને મારવાં, ૪. અર્જિન, ધૂમાડા વગેરેનો પ્રયોગથી મારવાં. ૫. મસ્તક પર
ખ્રદ્દગ આદિનો મહાર કરી મારવાં, ૬. કપટ કરી અથવા મંત્રેલા ફળથી મારવા,
૭. ગુમ પાપાચરજા કરી માયાચારથી છુપાવે અથવા સૂત્ર-અર્થ ને છુપાવે. ૮.
પોતે કરેલા ઋષિધાતાદિ પાપનો બીજા પર આરોપ મૂકવો, ૯. સત્ય જાણતા
ઇતાં સભામાં મિશ્ર ભાષા બોલવી, ૧૦. રાજાની આમદાની રોકી રાજ્યને
પોતાના કબજ્જામાં લેવું, ૧૧. પોતે કુંવારો ન હોવા ઇતાં કુંવારો છું એમ કહેવું,
૧૨. બ્રહ્મચારી નહિ હોવા ઇતાં બ્રહ્મચારી કહેવરાવવું, ૧૩. જેના આશ્રયે
પોતાની ઉત્ત્રતિ થઈ હોય તે જ માણસનાં મૂળ કાઢવા, ૧૪. જે માણસનાં
સમુદ્દરથી ઉચ્ચ અધિકાર મળ્યો હોય તેનું જ અનિષ્ટ કરવું, ૧૫. પોતાના
રક્ષકનો વિનાશ કરવો, ૧૬. દેશનાં રાજાનો ધાત ચિંતવવો અથવા ધાત કરવો,
૧૭. અનેક દેશનાં સ્વામી રાજા અથવા ધર્મત્યાનો ધાત કરવો, ૧૮. દીક્ષા
લેવા તૈયાર થયેલાં પુરુષનાં પરિણામને પાછા હઠાવી દેવા, ૧૯. વીતરાગના
અવર્ણવાદ કરવા, ૨૦. મોક્ષમાર્ગનો અપકાર અથવા અવર્ણવાદ કરવા, ૨૧.
આચાર્ય, ઉપાધ્યાય આદિથી સૂત્ર વિનય આદિ શીખ્યા હોય તેમની નિન્દા
કરવી, ૨૨. આચાર્ય, ઉપાધ્યાય આદિની યથાશક્તિ વૈયાવયન ન કરવી,

એગતીસાચે સિદ્ધાઈ ગુણોત્તિ × સિદ્ધ ભગવંતના એકનીશ ગુણો
 (વિશુદ્ધ શબ્દ માટે પ્રદૂપણ દાચ
 લાગેલા દોષોથી નિવન્તુ છુ.)

૨૩. બહુશુત નહિ હોવા છતાં પોતે બહુશુત છે બેમ કહેતુ, ૨૪. તાત્કાલીન
 નહિ હોવા છતાં તપસ્વી છું બેમ કહેતુ, ૨૫. વ્યાન આદિની પદ્ધતિઓ
 વૈયાવચ્ચ ન કરવી, ૨૬. લિસાનો ઉપદેશ આપવો અથવા સંખમાં છેદ-બેદ
 પાડવો, ૨૭. પોતાની બડાઈ માટે વારંવાર વશીકરણ આહિ અધાર્મિક પ્રયોગ
 કરવો, ૨૮. આ લોક અથવા પરલોક સંબંધી કામ-ભૌગોળી તીવ્ર લાલસા કરવી,
 ૨૯. ઋદ્ધિયુક્ત દેવોનો અવર્ણવાદ બોલવો, ૩૦. દેવતાને નહિ જોવા છતાં
 હું જોઉં છું તેમ કહેતુ.

× શ્રી સિદ્ધ ભગવંતના ઉ૧ ગુણો - ૫ શાનાવરણીય, ૮ દર્શનાવરણીય,
 ૨ વેદનીય, ૨ મોહનીય, ૪ આયુ, ૨ નામ, ૨ ગૌત્ર અને ૫ અત્તરાયકર્મની
 પ્રકૃતિઓએ કુલ ઉ૧ પ્રકૃતિના કાયરૂપ એકનીશ ગુણો.

× બત્તીશ યોગસંગ્રહ - ૧ ગુરુપાસે જઈ પાપની આલોચના કરવી, ૨.
 બીજાના પાસે શિખ્યોની આલોચન જાહેર કરવી નહિ, ૩. આપત્તિકાળે પાત્ર
 ધર્મમાં દ્રઢ રહેતું, ૪. ફળની વાંદ્ચા રહિત તપ કરવો, ૫. શિક્ષા મળી છે
 તે પ્રમાણે વર્તતું અને ગ્રહણ કરતા જવું, ૬. શરીર સંસ્કારનો પરિત્યાગ ઉ
 છાનો તપ કરવો, ૮ નિર્બોભપણું રાખવું, ૯. પરિષહ છતવો, ૧૦. સરળ
 ચિત્ત રાખવું, ૧૧. શુદ્ધ સંયમ પાળવો, ૧૨. સમક્રિત શુદ્ધ રાખવું, ૧૩. ચિત્તની
 સમાધિ રાખવી, ૧૪. કપટ રહિત આચાર પાળવો, ૧૫. વિનય બરાબર કરવો,
 ૧૬. સંતોષ રાખવો, ૧૭. વૈરાગ્યભાવ રાખવો, ૧૮. કપટરહિતપણું, ૧૯.
 શુદ્ધ કરણી, ૨૦. સંવર, ૨૧ પોતાના દોષ ટાળવા, ૨૨ વિષયોથી વિરમવું,
 ૨૩ મૂળગુણ પર્યક્ખાણ, (પહેલા પાંચ પ્રતોનું પાલન, ૨૪ ઉત્તરગુણ
 પર્યક્ખાણ (દ્રવ્યથી ઉપધિ ત્યાગ, ભાવથી ગવર્ણિકનો ત્યાગ કરવો) ૨૫ ભાવ
 સહિત કાઉસસગ કરે, ૨૬ પ્રમાદ રહિત વર્તે, ૨૭ હંમેશા ચારિત્રને વિશે
 સાવધાન સહે. ૨૮ ધ્યાન ધરે, (સંવર યોગ કરે) ૨૯ મરણાંત દુઃખ પડયે
 ભય ન પામે, ૩૦ સ્ત્રી આદિનાં સંગને છાંડે, (સ્વજનાદિકનો ત્યાગ કરે) ઉ૧
 પ્રાયશ્રિત લે (વિશુદ્ધ કરે.) ઉ૨ મરણકાળે આરાધના કરે (આરાધિક પંડિત
 મરણ થાય તેમ આરાધના કરે.)

શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર

બતીસાએ જોગસંગહેણિ

- બત્રીસ પ્રકારના શુભ યોગ સંગ્રહ
(સંબંધી પ્રમાદાદિદ્વારા લાગેલા
અતિચારોથી નિવર્તુ છું.)

તતીસાએ આસાયણાએ

- તત્રીશ પ્રકારની અશાતના અને
અવિનયને ટાળવો.

અરિહંતાણં આસાયણાએ(૧)

- અરિહંત દેવની આશાતના કરી
હોય એટલે તેના વિષે કાંઈ ખોટું
ચિંતયું હોય તેનું નિવારણ
કરું છું.

સિદ્ધાણં આસાયણાએ (૨)

- સિદ્ધ ભગવાનની આશાતના કરી
હોય તે વિષે કાંઈ સંદેહ આજ્યો
હોય.

આયરિયાણં આસાયણાએ (૩)-આચાર્યજીની આશાતના કરી હોય

ઉવજગાયાણં આસાયણાએ(૪)-ઉપાધ્યાયજીની આશાતના કરી
હોય.

સાધૂણં આસાયણાએ (૫) - સાધુની આશાતના કરી હોય.

સાધૂણીણં આસાયણાએ(૬)- સાધ્વીની આશાતના કરી હોય.

સાવયાણં આસાયણાએ(૭) - શ્રાવકોની આશાતનાથી.

સાવિયાણં આસાયણાએ(૮)- શ્રાવિકાઓની આશાતનાથી.

દેવાણં આસાયણાએ (૯) - દેવોની આશાતનાથી.

દેવીણં આસાયણાએ(૧૦) - દેવીઓની આશાતનાથી.

ઈહલોગસ્સ આસાયણાએ(૧૧)-આ લોકની આશાતનાથી.

શ્રાવક સામાયિક પ્રતિકમણ સૂત્ર

પરલોગસ્સ આસાયણાએ (૧૨) પરલોકની આશાતનાથી.

કેવલિ પત્રતસ્સ ધર્મસ્સ* - કેવલી = સર્વજ્ઞ દ્વારા પ્રરૂપિત
આસાયણાએ (૧૩) ધર્મની આશાતનાથી.

સદેવ મણુષ આસુરસ્સ - દેવ સહિત, મનુષ્ય સહિત,
અસુર

લોગસ્સ આસાયણાએ (૧૪)- સહિત સમગ્ર લોકની
આશાતનાથી.

સત્ય પાણ ભૂય જીવ - બધાં પ્રાણી (= વિકલેન્દ્રિય)

સત્તાણાં આસાયણાએ (૧૫) - ભૂત (= વનસ્પતિ) જીવ
(= પંચેન્દ્રિય,) સત્ત્વો=પૃથ્વી,
પાણી, અર્જિન, વાયુ) એ
જીવોને જીવ નથી એમ માનવા
રૂપ આશાતનાથી.

કાલસ્સ આસાયણાએ (૧૬)- ત્રણે કાળની (ભૂત, વર્તમાન,
ભવિષ્ય) આશાતનાથી.

સુયસ્સ આસાયણાએ (૧૭)- શ્રુતની આશાતનાથી.

સુયદેવયાએઆસાયણાએ (૧૮) શ્રુતદેવતા = ગણધરની
આશાતનાથી.

વાયણારિયસ્સ વાચનાચાર્ય (= વાંચણી

આસાયણાએ (૧૯) આપનાર)ની આશાતનાથી (જે
દોષ લાગ્યા હોય) નિવર્ત્તુ છું.

જું - અને જે (આગમ ભણતાં થકાં)

વાઈદ્ધ (૨૦) - સૂત્રો આધા-પાછાં ભણાયાં હોય.

વચ્ચામેલિયં (૨૧) - ધ્યાન વિના સૂત્રો ભણાયાં હોય.

હીણાકુખરં (૨૨) - અક્ષરો ઓછાં ભણાયાં હોય.

* અહીં 'કેવલીણ આસાયણાએ' આવો પાઠ જૂની પ્રતોમાં નથી. વળી
આ પદોને આશાતનાનાં ઉત્ત બોલ તરીકે ગણાવેલ છે. અને ઉપરોક્ત પદ
સહિત ૩૪ થઈ જાય છે.

શાબક સામાજિક પ્રતિક્રમણ સૂત્ર

- અનુભરો અવિદુ ભલાયાં હોય.
- પદ અનોહુ ભલાયું હોય.
- વિનય રહિત ભલાયું હોય.
- મન, વચન, કાયાના અનિયિર ધોગે ભલાયું હોય.

- શુદ્ધ ઉચ્ચાર વિના ભલાયું હોય.
- હૃદ્દ જ્ઞાન અવિનીતને દીધું હોય.
- સુત્રજ્ઞાનને દુષ્ટ ભાગથી બ્રહ્મા કુરૈલ હોય - ભલોલ હોય.

અકાલે કુઓ સજગાઓ (૩૦)- અકાલે સ્વાધ્યાય કરી હોય.
કાલે ન કુઓ સજગાઓ (૩૧)- સ્વાધ્યાય કાલનાં સમયે સ્વાધ્યાય ન કરી હોય.

અસજગાઈએ સજગાઈયં (૩૨)- સ્વાધ્યાય ન કરવા ધોગ્ય સ્થળે સ્વાધ્યાય કરી હોય.

સજગાઈએ ન સજગાઈયં (૩૩) - સ્વાધ્યાય કરવા ધોગ્ય સ્થળે સ્વાધ્યાય ન કરી હોય.

તસ્સ મિથ્યા મિ દુક્કડ - તેનું મારું પાપ મિથ્યા થાઓ.
એમ એક બોલથી માંડીને તેત્રીસ બોલ સુધી મારા જીવે; (તમારા જીવે), જાણવા જોગ બોલ જાણ્યા ન હોય; આદરવા જોગ બોલ આદર્યા ન હોય; અને છાંડવા જોગ બોલ છાંડ્યા ન હોય, તો અરિહંત, અનંત સિદ્ધ કેવળી ભગવાનની સાક્ષીએ તસ્સ મિથ્યા મિ દુક્કડ.

ઘન્ય છે એ મહાપુરુષોને ! જેઓ જાણવા જોગ બોલ જાણતાં હશે, આદરવા જોગ આદરતા હશે અને છાંડવા જોગ છાંડતા હશે. તેમને મારી (તમારી) સમય સમયની વંદના હોજો.

પાંચમું શ્રમણસૂત્ર

પાઠ : ૨૭ : પ્રતિજ્ઞા-સૂત્ર
(નિર્ગ્રથપ્રવચન વિશુદ્ધિનો પાઠ)

નમો	- નમસ્કાર હોજો
ચુલ્લીસાએ તિત્થયરાણં	- ચોવીશે તીર્થકરોને
ઉસભાઈ મહાવીર	- ઋષભદેવથી માંડીને મહાવીર-
પ્રજ્ઞવસાણાણં	સ્વામી પર્યતનાં.
ઈણામેવ	- આ જ
નિર્ગંથં	- નિર્ગ્રથ
પ્રવચન	- પ્રવચન
સત્યં	- સત્ય છે
અનુત્તરં	- અનુત્તર=સર્વોત્તમ છે.
કેવલિયં	- કેવલ=અદ્વિતીય છે અથવા કેવલિક=કેવલજ્ઞાનીઓ દ્વારા પ્રરૂપિત છે.
પરિપુત્રં	- પ્રતિપૂર્ણ છે.
નેઆઉયં	- ન્યાયયુક્ત છે.
સંસુદ્ધં	- પૂર્ણશુદ્ધ અર્થાત् નિષ્ઠલંક છે.
સલ્લકતાણં	- માયા આદિ શલ્યોને (કાતરની જેમ) કાપનાર; નાશ કરનાર છે.

શ્રાવક સામાયિક પ્રતિક્રિમણ સૂત્ર

સિદ્ધિમંગાં

- સિદ્ધ થવાનો માર્ગ છે.

મુક્તિમંગાં

- આઠ કર્માથી મુક્તિનો માર્ગ છે.

નિક્ષાણમંગાં

- સંસારથી નીકળવાનો માર્ગ છે.

મોક્ષ સ્થાનનો માર્ગ છે.

નિવ્યાણમંગાં

- નિવર્ણનો માર્ગ છે. પરમ શાંતિનો માર્ગ છે.

અવિતહમવિસંધિ

- અવિતહ=મિથ્યાત્વ રહિત છે.

સત્ય છે, યથાર્થ છે.

અવિસંધિ=વિચ્છેદ રહિત અર્થાત् સદા શાશ્વત છે.

સાધ્ય દુક્ખ પહીણમંગાં

- સર્વ દુઃખોનો પૂર્ણ રીતે કષય કરવાનો માર્ગ છે.

ઈતયં

- આ નિર્ગ્રથ પ્રવચનમાં

ઠિઆ

- સ્થિત રહેલાં

જીવા

- જીવો

સિજ્જંતિ

- સિદ્ધ થાય છે.

બુજ્જંતિ

- બુદ્ધ (=સર્વજ્ઞ) થાય છે.

મુખ્યંતિ

- ભવોપગ્રાહી કર્માથી મુક્ત થાય છે.

પરિનિવ્યાયંતિ

- સર્વ પ્રકારે શીતલીભૂત થાય છે.

સાધ્ય દુક્ખભાણ મંતં કરન્તિ

- શારીરિક, માનસિક દુઃખોનો અંત=કષય કરે છે.

તં ધર્મં

- તે, ધર્મની

શાબક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર

સદ્ગામિ	- શ્રદ્ધા કરું છું.
પત્તિઅામિ	- પ્રતીતિ કરું છું.
રોએમિ	- રુચિ કરું છું.
ફાસેમિ	- સ્વર્ણના કરું છું.
પાલેમિ	- પાલના કરું છું.
અણુપાલેમિ	- અણુ=વિશેષ રૂપથી નિરંતર પાલેમિ=પાલના કરું છું.
તં ધર્મં	- તે, ધર્મની
સદ્હંતો	- શ્રદ્ધા કરતો થકો
પત્તિઅંતો	- પ્રતીતિ કરતો થકો
રોઅંતો	- રુચિ કરતો થકો
ફાસંતો	- સ્વર્ણના કરતો થકો
પાલંતો	- પાલના કરતો થકો
અણુપાલંતો	- વિશેષે નિરંતર પાળતો થકો
તસ્સ ધર્મસ્સ	- તે, ધર્મની
કેવલી પત્રતસ્સ	- કેવલી પ્રરૂપિત
અભ્યુહિઓમિ આરાહણાએ-	આરાધનામાં હું ઉધ્ભવંત થયો છું.
વિરામિ વિરાહણાએ	- વિરાધનાથી નિવૃત્ત થયો છું.

* અસંયમ આદિને 'જ' પરિજ્ઞાથી જાણી અને 'પ્રત્યાખ્યાન' પરિજ્ઞાથી ત્યાણીને સાવધ અનુભાનને જાણું છું અને ત્યાણું છું. સંયમ આદિ અનુભાનોનો સ્વીકાર કરું છું. આ રીતે બધામાં સમજ લેવું.

શ્રાવક સામાયિક પ્રતિકમણ સૂત્ર

અસંજમ પરિયાણામિ

- * અસંયમ આદિને જી પરિજ્ઞાથી જાણું છું અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગું છું.

સંજમં ઉવસંપજ્ઝામિ
અબંલં પરિયાણામિ

- સંયમને અંગીકાર કરું છું.
- અભ્રહચર્યને જાણું છું. અને ત્યાગું છું.

બંલં ઉવસંપજ્ઝામિ
અકૃપં પરિયાણામિ

- બ્રહ્મચર્યને અંગીકાર કરું છું.
- અકૃત્ય=અકૃત્યને જાણું છું અને ત્યાગું છું.

કૃપં ઉવસંપજ્ઝામિ
અજ્ઞાણં પરિયાણામિ
નાણં ઉવસંપજ્ઝામિ
અક્ષિરિયં પરિયાણામિ

- કલ્પ=કૃત્યને અંગીકાર કરું છું.
- અજ્ઞાનને જાણું છું અને ત્યાગું છું.
- જ્ઞાનને અંગીકાર કરું છું.
- અક્ષિયા=નાસ્તિકવાદને જાણું છું.
અને ત્યાગું છું.

ક્રિયં ઉવસંપજ્ઝામિ
મિથ્યતં પરિયાણામિ

- ક્રિયા=સમ્યગ્વાદને સ્વીકારું છું.
- મિથ્યાત્વને જાણું છું અને ત્યાગું છું.

સમ્મતં ઉવસંપજ્ઝામિ
અબોહિ પરિયાણામિ

- સમક્ષિતને અંગીકાર કરું છું.
- મિથ્યાત્વના કાર્યને જાણું છું અને ત્યાગું છું.

બોહિ ઉવસંપજ્ઝામિ
અમર્ગં પરિયાણામિ

- સમ્યકૃત્વકાર્યને સ્વીકારું છું.
- જિનમાર્ગથી વિપરીત એવા ઉન્માર્ગને જાણું છું અને ત્યાગું છું.

શ્રાવક સામાયિક પ્રતિક્રિમણ સૂત્ર

મળાં ઉવસંપજ્ઞામિ	- મોક્ષમાર્ગ (જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ)ને અંગીકાર કરું છું.
જું સંભરામિ	- જે દોષ મને યાદ છે.
જું ચ ન સંભરામિ	- અને જે દોષ મને યાદ નથી,
જું પડિક્કમામિ	- જેનું પ્રતિક્રિમણ કરું છું.
જું ચ ન પડિક્કમામિ	- અને જેનું પ્રતિક્રિમણ કરી શક્યો નથી.
તરસ સવ્વસ્સ	- તે સર્વ
દેવસિયરસ્સ x	- દિવસ સંબંધી
અઈયારસ્સ	- અતિચારોનું
પડિક્કમામિ	- પ્રતિક્રિમણ કરું છું.
સમજ્ઞોંડહું	- હું શ્રમણ છું.
સંજ્ય	- સંયતિ છું.
વિરય	- પાપથી નિવૃત્ત છું.
પડિહ્ય	- રોકી દીઘાં છે
પચ્યક્રખાય	- પ્રત્યાખ્યાન કરીને
પાવકમ્મો	- પાપકર્માને જોણો એવો હું છું.
અનિયાણો	- નિદાન રહિત છું.
દિદ્ધિ સંપત્તો	- સમ્યગ્રદૃષ્ટિ યુક્ત છું.

x પથાકાળ પ્રતિક્રિમણ (૧) રાઈયરસ્સ, (૨) પફ્ફિખ્યરસ્સ, (૩)
ચાઉમાસ્સિયરસ્સ અને (૪) સંવચ્છરિયરસ્સ શબ્દ બોલવા.

ગ્રાવક સામાજિક પ્રતિક્રિમણ સૂત્ર

માયામોસો વિવિધાઓ	- કપટ સહિત જૂઠથી સર્વથા રહિત થયો છું (તેથી)
અડુલાઈજેસુ હીવસમુડેસુ	- અદી દીપ અને બે સમુદ્રને વિષે
પન્નરસ ક્રમભૂમિસુ	- પદર કર્મભૂમિઓમાં (૫ ભરત + ૫ ઐરવત + ૫ મહાવિદેહ = ૧૫)
જાવંતિ	- જેટલાં પણ
કુઈ	- કોઈ
સાખૂ રયહરણ ગુચ્છિગ	- સાધુઓ રહેલાં છે (કેવાં છે ?)
પડિંગહંઘરા	- રજોહરણ, ગુચ્છો અને પાત્રાના ધારક છે.
પંચ મહિયયધરા	- પાંચ મહિન્દ્રતના ધારક છે.
અહૃતરસ સહસ્ર	- અઢાર હજાર શીલરૂપી રથના
સીલાંગ રહંઘરા	- ધારક છે.
અકુખય આયાર ચરિતા	- અક્ષત=પરિપૂર્ણ આચારયુક્ત ચારિતના ધારક છે.
તે સવ્યે	- તે સર્વને
સિરસા	- શિરથી (ઉત્તમ અંગ વડે)
મણસા	- શુદ્ધ અંતકરણથી (મનથી)
મત્થઅણાં વંદામિ	- મસ્તક નમાવીને વંદન કરું છું.

ઇતિ અતિચાર આલોવ્યા, પરિક્રમ્યા, નિંદા, નિઃશલ્ય

થયા. વિશેષ વિશેષ અરિહંત, સિદ્ધ, કેવલી, ગાણધરજી,
આચાર્યજી, ઉપાધ્યાયજી, સાધુ-સાધ્વી, ગુરુ આદિને ભુજો ભુજો
કરી ખમાવું છું.

અયમાઉસો !

‘નિગંથે પાવયણે’ અઢે, અયં પરમઢે,
સેસે અણઢે !

હે આયુષ્યમાન્ !

આ નિર્ગંથ પ્રવચન જ અર્થ (સારભૂત) છે.

એ જ પરમાર્થ (વાસ્તવિક) છે.

બાકી સર્વ વચન અનર્થનાં કારણાર્થ છે.

પાઠ : ૨૮ પહેલા ખામણા

(અરિહંત ભગવંતોને)

ખામણાની વિધિ

(ભૂમિ ઉપર બંને ઢીંચણા ઢાળી, બંને હાથની કોણીઓ-
નાભિએ અડાડીને રાખવી તથા બંને હાથ જોડી રાખી સ્થિર
ચિત્તે ખામણા બોલવા)

પહેલા ખામણા

પહેલા ખામણા પંચમહાવિદેહ ક્ષેત્રને વિષે જ્યવંતા તીર્થકરદેવ
બિરાજે છે તેઓને કરું છું. તે જ્ઘન્ય તીર્થકર ૨૦ અને ઉત્કૃષ્ટા
હોય તો ૧૭૦ તેમને મારા તમારા સમય સમયના નમસ્કાર હોજો.
તે સ્વામીના ગુણગ્રામ કરતાં જ્ઘન્ય રસ ઉપજે તો કર્મની કોણું ખપે,
ઉત્કૃષ્ટો રસ ઉપજે તો આ જીવ તીર્થકર નામ ગોત્ર ઉપાર્જે. તે વીશ
સ્વામીના નામ કહું છું. ૧. શ્રી સીમંધરસ્વામી, ૨. શ્રી
જુગમંધરસ્વામી, ૩. શ્રી બાહુસ્વામી, ૪. શ્રી સુબાહુસ્વામી, ૫.
શ્રી સુજાતનાથસ્વામી, ૬. સ્વયંપ્રભસ્વામી ૭. શ્રી
ઋખભાનનસ્વામી, ૮. શ્રી અનંતવીર્ય સ્વામી, ૯. શ્રી
સુરપ્રભસ્વામી, ૧૦. શ્રી વિશાળપ્રભસ્વામી, ૧૧. શ્રી
વજધરસ્વામી, ૧૨. શ્રી ચંદ્રાનનસ્વામી, ૧૩. શ્રી ચંદ્રબાહુસ્વામી,
૧૪. શ્રી ભુજંગદેવસ્વામી, ૧૫. શ્રી ઈશ્વરસ્વામી, ૧૬. શ્રી
નેમપ્રભસ્વામી, ૧૭. શ્રી વીરસેનસ્વામી; ૧૮. શ્રી મહાભ્રસ્વામી,
૧૯. શ્રી દેવજશસ્વામી, ૨૦. શ્રી અજિતસેનસ્વામી, તેમને મારી
તમારી સમય સમયની વંદના હોજો, તે સ્વામી કેવા છે ? મારા
તમારા મન મનની વાત જાણી દેખી રહ્યા છે, ઘટ ઘટની વાત

જાણી દેખી રહ્યા છે, સમય સમયની વાત જાણી દેખી રહ્યા છે,
ચૌદ રાજલોક હસ્તકમલવતુ જાણી દેખી રહ્યા છે, તે સ્વામીને અનંતુ
જ્ઞાન છે, અનંતુ દર્શન છે, અનંતુ ચારિત્ર છે, અનંતુ તપ છે, અનંતુ
ધૈર્ય છે, અનંતુ વીર્ય છે, ખેટે ગુણે કરી સહિત છે, ચોત્રીશ અતિશાયે
કરી બિરાજમાન છે, પાંત્રીશ પ્રકારની સત્યવચન વાણીના ગુણે
કરી સહિત છે, એક હજાર ને અષ ઉત્તમ લક્ષણના ધરણહાર
ચાર ઘનઘાતિ કર્મ ક્ષય કર્યા છે, બાકીનાં ચાર કર્મ પાતળાં પાડ્યાં
છે, મુક્તિ જવાના કામી થકા વિચરે છે, ભવ્ય જીવના સંદેહ ભાંગે
છે, સજોગી, સશરીરી, કેવળજ્ઞાની, કેવળદર્શની, યથાખ્યાત
ચારિત્રના ધારણહાર છે, ક્ષાયક સમક્રિત, શુક્લધ્યાન, શુક્લલેશ્યા,
શુભધ્યાન, શુભજોગ, સહિત છે, ચોસઠ ઈદ્રના પૂજનિક છે,
વંદનિક, અર્ચનિક છે, પંડિતવીર્ય આદિ અનંત ગુણે કરી સહિત
છે. ધન્ય તે સ્વામીનાથ ગામ, નગર, રાયહાણી, ખેડ, કવડ,
પુરપાટણ, એક ગામથી બીજે ગામ. વિહાર કરતા હશે. *

ધન્ય તે ભગવંત જ્યાં દેશના દેતા થકા વિચરતા હશે ત્યાં
રાઈસર, તલવર, માડંબિય, કોડંબિય, શેઠ સેનાપતિ, ગાથાપતિ,
સ્વામીની દેશના સાંભળી કર્ણ પવિત્ર કરતા હશે, દર્શન દેદાર કરી

* ત્યાં જિનેદ્રદેવરૂપી સૂર્ય આગળ ચાલે. તે વાંસે ગણધર ચાલે,
તે વાંસે શેષ સાધુ ચાલે, સ્વામી પગ ધરે ત્યાં લાખ પાંખડીનું
પદ્મકમળ-કૂલ થઈ આવે, પાછો પગ-ઉપાડે ત્યારે વિસરાળ થઈ
જાય, નદી - નાળાં આવે ત્યાં પાળ બંધાઈ જાય, કાંટા સમે મુખે
હોય તે ઉંઘે મુખે થઈ જાય. સ્વામીજી હજારો ગાઉનો વિહાર કરી
બાગ બગીચામાં વનપાળની આજ્ઞા લઈ સમોસરે, ત્યાંથી પચીસ
પચીસ જોજનમાં માર નહિ, મરકી નહિ, સ્વચ્છ પરચકનાં ભય

શ્રાવક સામાચિક પ્રતિક્રમણ સૂત્ર

નેત્ર પવિત્ર કરતા હશે. અશનાદિક ચૌદ પ્રકારનું દાન થઈ કર્યા પવિત્ર કરતા હશે, તેમને ધન્ય છે. ધન્ય સ્વામીનાથ આપ પંચ મહાવિદેહ ક્ષેત્રને વિષે બિરાજો છો, હું અપરાધી, દીનકિંકર, ગુણહીન અહીં બેઠો છું. આપના કેવળજ્ઞાન, કેવળદર્શન ચારિત્ર, તપ સંબંધી અવિનય અભક્તિ, આશાતના, અપરાધ કર્યો હોય તો મન વચન કાયાએ કરી, હાથ જોડી, મસ્તક નમાવી, ભુજો ભુજો કરી ખમાવું છું. (તિકખુતોનો પાઠ ત્રણ વાર કહેવો).

નહિ, સાત પ્રકારની ભીતિ માત્ર રહે નહિ, જાગું મિથ્યાત્વ હોય
ત્રિગડા ગઢની રચના થઈ આવે, રૂપાનો ગઢ ને સોનાના
કાંગરા, સોનાનો ગઢ ને રત્નના કાંગરા, રત્નનો ગઢ અને
મહિનારત્નના કાંગરાં, ચાર દિશાએ ચાર ચાર દરવાજા થઈ આવે,
એક એક દરવાજે વીશ વીશ હજાર પગથિયાં થઈ આવે,
સમોસરણને મધ્ય ભાગે સ્ફટિક રત્નનું સિંહાસન થઈ આવે, ઉપર
ચોવીસ જોડાં ચામરના થઈ આવે, વનપાળ જઈ રાજાદિને વધામણી
આપે, બાર પ્રકારની પ્રખદા વખાણવાણી સાંભળે, સૌ સૌની
ભાષામાં સૌ સમજ જાય, કોઈને શંકા ઉપજે નહિ, ભવનપતિ
અને તેની દેવી, વાણવ્યંતર અને તેની દેવી, જ્યોતિષી અને તેની
દેવી, વैમાનિક અને તેની દેવી. મનુષ્ય અને મનુષ્યાણી, તિર્યં
અને તિર્યંચાણી એ બાર જાતની પ્રખદા વખાણવાણી સાંભળતાં
કોઈ કોઈનું વેર ઉલ્લસે નહિ.

પાઠ ૨૮ બીજા ખામણા

(સિદ્ધ ભગવંતોને)

બીજા ખામણા અનંતા સિદ્ધ ભગવંતોને કહું છું. તે ભગવંતોના ગુણગ્રામ કરતાં જ્યધન્ય રસ આવે તો કર્મની કોડો ખપે, ઉત્કૃષ્ટો રસ ઉપજે તો આ જીવ-તીર્થકર નામ ગોત્ર ઉપાર્જે.

આ ભરતક્ષેત્રને વિષે છેલ્લા ચોવીસ તીર્થકર ભગવંતો સિદ્ધ થયા. તેમના નામ કહું છું ૧. શ્રી ઋષભદેવસ્વામી, ૨. શ્રી અજિતનાથસ્વામી, ૩. શ્રી સંભવનાથસ્વામી, ૪. શ્રી અભિનંદન સ્વામી, ૫. શ્રી સુમતિનાથસ્વામી, ૬. શ્રી પદ્મપ્રભસ્વામી, ૭. શ્રી સુપાર્શ્વનાથસ્વામી, ૮. શ્રી ચંદ્રપ્રભસ્વામી, ૯. શ્રી સુવિધિનાથ સ્વામી, ૧૦. શ્રી શીતલનાથસ્વામી, ૧૧. શ્રી શ્રેયાંસનાથસ્વામી, ૧૨. શ્રી વાસુપૂર્ખસ્વામી, ૧૩. શ્રી વિમળનાથસ્વામી, ૧૪. શ્રી અનંતનાથસ્વામી, ૧૫. શ્રી ધર્મનાથસ્વામી, ૧૬. શ્રી શાંતિનાથ સ્વામી, ૧૭. શ્રી કુંથુનાથસ્વામી, ૧૮. શ્રી અરનાથસ્વામી, ૧૯. શ્રી મલ્લિનાથસ્વામી, ૨૦. શ્રી મુનિસુપ્રતસ્વામી, ૨૧. શ્રી નમિનાથસ્વામી, ૨૨. શ્રી નેમનાથસ્વામી, ૨૩. શ્રી પાર્શ્વનાથસ્વામી, ૨૪. શ્રી મહાવીરસ્વામી, આ ચોવીશી, અનંત ચોવીશી પંદર ભેટ સીજી, બૂગી, આઠ કર્મ ક્ષય કરી મોક્ષ પદ્ધાર્યા છે. તે આઠ કર્મ ક્યા? ૧. જ્ઞાનાવરણીય, ૨. દર્શનાવરણીય, ૩. વેદનીય, ૪. મોહનીય, ૫. આયુર્ધ્ય, ૬. નામ, ૭. ગોત્ર, ૮. અંતરાય. એ આઠ કર્મ ક્ષય કરી સિદ્ધક્ષેત્રમાં પહોંચ્યા છે તે સિદ્ધક્ષેત્ર ક્યાં છે? સમપૃથ્યીથી સાતસેં નેવું જોજન ઊંચપણે તારા મંડળ આવે. ત્યાંથી દશ જોજન ઊંચપણે સૂર્યનું વિમાન છે, ત્યાંથી એશી જોજન ઊંચપણે ચંદ્રમાનું વિમાન છે, ત્યાંથી ચાર જોજન ઊંચપણે નક્ષત્રના વિમાન છે, ત્યાંથી ચાર જોજન ઊંચપણે બુધનો

શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર

તારો છે, ત્યાંથી ત્રણ જોજન ઉંચપણે શુકનો તારો છે; ત્યાંથી ત્રણ જોજન ઉંચપણે બૃહસ્પતિનો તારો છે, ત્યાંથી ત્રણ જોજન ઉંચપણે મંગળનો તારો છે, ત્યાંથી ત્રણ જોજન ઉંચપણે શનિશ્વરનો તારો છે, એમ નવસે જોજન લગી જ્યોતિષચક છે. તે ઉપર અસંખ્યાતા જોજન કોડાકોડી ઉંચપણે પહેલું સુધર્મ નામે અને બીજું ઈશાન નામે દેવલોક છે. એકેકું અર્ધચંદ્રમાને આકારે છે, બે મળી પૂર્ણ ચંદ્રમાને આકારે છે, પહેલામાં બત્રીશ લાખ વિમાન છે, બીજામાં અઢાવીશ લાખ વિમાન છે. ત્યાંથી અસંખ્યાતા જોજન ઉપર ત્રીજું સનત્કુમાર અને ચોથું માહેંદ્ર એ બે દેવલોક છે. એકેકું અર્ધચંદ્રમાને આકારે છે, બે મળી પૂર્ણ ચંદ્રમાને આકારે છે. ત્રીજામાં બાર લાખ અને ચોથામાં આઠ લાખ વિમાન છે. તે ઉપર અસંખ્યાતા જોજન ઉંચે પાંચમું બ્રહ્મલોક દેવલોક છે. એકલું પૂર્ણ ચંદ્રમાને આકારે છે, તેમાં ચાર લાખ વિમાન છે. ત્યાંથી અસંખ્યાતા જોજન ઉપર છતું લાંતક દેવલોક છે. એકલું પૂર્ણ ચંદ્રમાને આકારે છે, તેમાં પચાસ હજાર વિમાન છે. ત્યાંથી અસંખ્યાતા જોજન ઉપર સાતમું મહાશુક દેવલોક છે. એકલું પૂર્ણ ચંદ્રમાને આકારે છે, તેમાં ચાલીસ હજાર વિમાન છે. ત્યાંથી અસંખ્યાતા જોજન ઉપર આઠમું સહભાર દેવલોક છે. એકલું પૂર્ણ ચંદ્રમાને આકારે છે, તેમાં છ હજાર વિમાન છે, ત્યાંથી અસંખ્યાતા જોજન ઉપર નવમું આણત અને દશમું ગ્રાણત એ બે દેવલોક જોડા જોડ છે. એકેકું અર્ધ ચંદ્રમાને આકારે છે, બે મળી પૂર્ણ ચંદ્રમાને આકારે છે. બેમાં મળી ત્રણસો વિમાન છે, ત્યાંથી અસંખ્યાતા જોજન ઉપર અગ્યારમું આરણ અને બારમું અચ્યુત એ બે દેવલોક જોડા જોડ છે. એકેકું અર્ધ ચંદ્રમાને આકારે છે, બે મળી પૂર્ણ ચંદ્રમાને આકારે છે. બેમાં મળી ત્રણસો વિમાન છે, ત્યાંથી અસંખ્યાતા જોજન ઉપર નવ ગ્રૈવેયક છે. તેના-નામ ભદ્ર, સુભદ્ર, સુજાએ, સુમાણસે, પિયદંસણે, સુદંસણે, આમોહે, સુપટિબદ્ધે,

દુલ નાળોન વેગાન્સી ૧૫ દિનાના ૧૯૭૮

Oct 1978 -> ડાયર ૨૩ દિ

શ્રાવક સામાજિક પ્રતિકમણ સૂત્ર

જુસોધરે, તેની ગ્રાણ ત્રિક છે. તે ગાગર બેડાને આકારે છે. તેમાં પહેલી ત્રિકમાં એકસો અગિયાર વિમાન છે, બીજી ત્રિકમાં એકસો સાત વિમાન છે, અને ત્રીજી ત્રિકમાં એકસો વિમાન છે. ત્યાંથી અસંખ્યાતા જોજન ઊંચપણે પાંચ અનુત્તર વિમાન છે, તેનાં નામ-વિજય, વિજયંત, જ્યંત, અપરાજિત, સર્વાર્થસિદ્ધ. તે સર્વાર્થસિદ્ધ મહાવિમાનની ઘજા થકી બાર જોજન ઊંચપણે મુક્તિશિલા છે. તે મુક્તિશિલા કેવી છે? પિસ્તાલીસ લાખ જોજનની લાંબી પહોળી ગોળાકાર છે. મધ્યે આઠ જોજનની જાડી છે, ઉત્તરતા છેદે માખીની પાંચ થકી અધિક પાતળી છે, ઉજળી, ગોખીર, શંખ, ચંદ્ર, અંકરતન, રૂપાનો પટ, મોતીના હાર, ક્ષીરસાગરના પાણી થકી પણ અધિક ઉજળી છે. તે સિદ્ધશિલા ઉપર એક જોજન તેજા છેદ્ધા ગાઉના છઢા ભાગને વિષે સિદ્ધ ભગવંતજી બિરાજ રહ્યા છે. તે સ્વામી કેવા છે? અવરો, અગંધે, અરસે, અફાસે, અમૂર્તિ, અવિનાશી, ભૂખ નહિ, દુઃખ નહિ, રોગ નહિ, શોક નહિ, જન્મ નહિ, જરા નહિ, મરણ નહિ. કાયા નહિ, કર્મ નહિ, અનંત અનંત સુખની લહેરમાં બિરાજ રહ્યા છે. ધન્ય સ્વામીનાથ! આપ ત્યાં બિરાજો છો, હું અપરાધી દીનંકિકર ગુણહીન અહીં બેઠો હું. આપના કેવળજ્ઞાન, કેવળદર્શન સંબંધી * અવિનય, આશાતના, અભક્તિ અપરાધ કર્યો હોય તો મન, વચન, કાયાએ કરી, હાથ જોડી, મસ્તક નમાવી ભુજો ભુજો કરી ખમાવું હું. (તિક્ખુંતોનો પાઠ ત્રાણ વખત કહેવો.)

૫૦૦ ધનુષ્ણની અવગાહનાવાળા સિદ્ધ થયા તે ઉત્ત ધનુષ્ણ ઉર આંગળ પ્રમાણ કેત્ર અવગાહી રહેલ છે. ૭ હાથના સિદ્ધ થયા તે ૪ હાથને ૧૫ આંગળ પ્રમાણ કેત્ર અવગાહી રહેલ છે અને ૨ હાથના સિદ્ધ થયા તે ૧ હાથ ને આઠ આંગુલ પ્રમાણ કેત્રને અવગાહીને રહેલ છે - જ્યાં એક સિદ્ધ ત્યાં અનંતા સિદ્ધ અને જ્યાં અનંતા સિદ્ધ ત્યાં એક સિદ્ધ એમ સિદ્ધ સિદ્ધમાં અંતર નથી અને તેઓ જગ્યા રોકતા નથી.

* સિદ્ધ ભગવંતોને ચારિત્ર, તપ કે વીર કાંઈ ન હોય, તેમને ફક્ત અનંતજ્ઞાન અને અનંતદર્શન જ હોય છે.

પા� : ૩૦ : ત્રીજા ખામણા

(કેવલી ભગવંતોને)

ત્રીજા ખામણા પંચ મહાવિદેહક્ષેત્રને વિષે બિરાજતાં જ્યવંતા
કેવલી ભગવંતોને કરું છું. તે સ્વામી જધન્ય હોય તો બે કોડ અને
ઉત્કૃષ્ટ હોય તો નવ કોડ કેવલી. એ સર્વને મારી તમારી સમ્ય
સમયની વંદના હોજો.

તે સ્વામી કેવા છે ? મારા તમારા મન મનની વાત જાણી
દેખી રહ્યા છે. ઘટ ઘટની વાત જાણી દેખી રહ્યા છે. સમ્ય સમયની
વાત જાણી દેખી રહ્યા છે. ચૌદ રાજલોક અંજલિ જલ પ્રમાણે જાણી
દેખી રહ્યા છે. તેમને અનંતજ્ઞાન છે, અનંતદર્શન છે, અનંત ચારિત્ર
છે, અનંતતપ છે, અનંતધૈર્ય છે, અનંતવીર્ય છે. એ છ (ખટે) ગુજો
કરી સહિત છે. ચાર કર્મ ઘનઘાતી ક્ષય કર્યા છે. બાકીના ચાર
કર્મ બળેલી દોરડી સમાન પાતળા પાડ્યા છે. મુક્તિ જવાના કામી
થકા સ્વામી વિચરે છે. ભવ્ય જીવોના સંદેહ ભાંગે છે. સજોળી,
સશરીરી, કેવલજ્ઞાની, કેવલદર્શની, યથાખ્યાત ચારિત્રના ઘરણાદાર
છે. ક્ષાયિક-સમકિત, શુક્લધ્યાન, શુક્લલેશ્યા, શુભધ્યાન,
શુભજોગ, પંડિતવીર્ય આદિ અનંત ગુજો કરી સહિત છે.

ધન્ય સ્વામીનાથ ! આપ ગામ, નગર, રાયઢાણી, ખેડ, કવડ,
પુર, પાટણને વિષે જ્યાં જ્યાં દેશના દેતાં થકા વિચરતાં હશે, ત્યાં
ત્યાં રાઈસર, તલવર, માર્ડબિય, કોર્ડબિય, શેઠ, સેનાપતિ,
ગાથાપતિ સ્વામીની દેશના સાંભળી કર્ઝી પવિત્ર કરતા હશે તેમને
ધન્ય છે, સ્વામીના દર્શન દેદાર કરી નેત્ર પવિત્ર કરતા હશે તેમને
ધન્ય છે, સ્વામીને અશનાદિક ચૌદ પ્રકારનું દાન દઈ કર પવિત્ર
કરતા હશે તેમને પણ ધન્ય છે.

ધન્ય સ્વામીનાથ ! આપશ્રી પંચ મહાવિદેહક્ષેત્રને વિષે બિરાજો

શ્રાવક સામાચિક પ્રતિકમણ સૂત્ર

છે, હું અપરાધી, દીનકિંકર, ગુણહીન અહીં બેઠો છું. આજના દિવસ સંબંધી આપના કેવળજ્ઞાન, કેવળદર્શન, યથાખ્યાત ચારિત્ર, અને તપને વિષે અવિનય, આશાતના, અભક્તિ અપરાધ થયો હોય; તો હાથ જોડી, માન મોડી મસ્તક નમાવી ભુજો ભુજો કરી ખમાવું છું.

પાઠ : ૩૧ : ચોથા ખામણા

(ગણધરજી, આચાર્યજી, ઉપાધ્યાયજીને)

ચોથા ખામણા ગણધરજી આચાર્યજી ઉપાધ્યાયજીને કરું છું.
 ગણધરજી બાવનગુણો કરી સહિત છે. આચાર્યજી છત્રીસ ગુણો કરી સહિત છે. ઉપાધ્યાયજી પચીસ ગુણોથી સહિત છે. તેમને કરવાના છે. મારા તમારા ધર્મગુરુ, ધર્મચાર્ય, ધર્મ ઉપદેશના દાતાર મહાપુરુષ પંડિતરાજ, મુનિરાજ, ગીતાર્થ, બહુસૂત્રી, સૂત્ર સિદ્ધાંતના પારગામી, તરણ તારણતારણી નાવા સમાન, સફરી જહાજ સમાન,
 રત્ન ચિંતામણિ સમાન, પાર્શ્વમણિ સમાન, જિનશાસનના શાણગાર,
 ધર્મના અગ્રેસર, ધર્મના નાયક, ધર્મના મુખી, સંઘના નાયક, સંઘના મુખી આદિ અનેક શુભોપમાએ કરી બિરાજમાન હતા. પૂજ્ય સાહેબ
 શ્રી ઈન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યક્તજી, સુધર્મસ્વામી,
 મંડિતજી, મૌર્યપૂત્ર, અંક્રમિતજી, અચલભાતા, મેતાર્થ, પ્રભાસ,
 આદિ ગણધરો તથા જંબુસ્વામી, પ્રભવસ્વામી, સ્વયંપ્રભસ્વામી
 યુગભદ્રસ્વામી સંભૂતિવિજ્યસ્વામી, ભદ્રભાહુસ્વામી, સ્થુલિભદ્ર
 સ્વામી, તથા સૂત્રો લિપિબદ્ધ કરનાર દેવર્ધિગણિ ક્ષમા શ્રમણ આદિ
 પૂર્વધરો, તેમજ ધર્મના શુદ્ધ સ્વરૂપને ઓળખાવનાર લવજીઅધિ,
 ધર્મસિદ્ધજી મહારાજ તથા ધર્મદાસજી મહારાજશ્રી આદિ મહાપુરુષો

૨૧૯૨૧૯૨૭ ૨૦૧૩

શ્રાવક સામાચિક પ્રતિક્રિયા સૂત્ર

તથા તેમની પાટાનુપાટે જે સાધુ-સાધ્યી....આલોવી પડિકુંભી નિન્હી નિશાલ્ય થઈ, મોક્ષગતિમાં તથા પ્રાય: દેવલોકે પધાર્યા છે, તે બધાનો આપણા ઉપર મહાન ઉપકાર છે.

આજ વર્તમાનકાળે તરણ તારણતારણી નાવા સમાન, સફરી, જહાજ સમાન, રલાયિન્ટામણિ સમાન, જિનશાસનના શાણગાર, ધર્મના અશ્રેસર, ધર્મના નાયક, સંઘના મુખી, સંઘના નાયક આદિ અનેક શુભોપમાએ કરી જે જે આચાર્યજી ઉપાધ્યાયજીઓ વીતરાગ-દેવની આજીવામાં બિરાજતા હોય તે સર્વને મારી તમારી સમય સમયની વંદળા હોજો. તે સ્વામિ કેવા છે? શુદ્ધ પંચ મહાપ્રતના પાલણહાર, પાંચ સમિતિથી સમિતા, ત્રણ ગુપ્તિએ ગુપ્તા છકાયના પીપર, છકાયના પાલણહાર; સાત ભયના ટાળનાર, આઠ મદના ગાળનાર, નવવાડ વિશુદ્ધ બ્રહ્મચર્યના પાળનાર, દશવિધ પતિધર્મના અજવાળિક, અગિયાર શ્રાવકની અને બાર સાધુની પડિમાના જાગ્રત બાર ભેદે તપશ્ચર્યાના કરણહાર, સત્તર ભેદે સંયમના ધરણહાર, વીસઅસમાધિ દોષના ટાલણહાર, બાવીસ પરિષહના જિતણહાર; સત્તાવીશ સાધુજીના ગુણો કરી સહિત, તેત્રીસ આશાતનાના ટાલણહાર, ૪૨-૪૭-૮૬ દોષ રહિત આહાર પાણીના લેવણહાર; બાવન અનાચારના ટાલણહાર, સચેતના ત્યાગી, અચેતના ભોગી; કંચન-કામિનીના ત્યાગી, માયા મમતાના ત્યાગી, મહા વૈરાગી, સમતાના સાગર, દ્યાના આગર; આદિ અનેક ગુણો કરી સહિત છે.

ધન્ય ગુરુ ભગવંતો! આપશ્રી ગામ, નગર, રાયહાણી, પુર, પાટણને વિષે બિરાજો છો. હું અપરાધી, દીનકિંકર, ગુણહીન અહીં બેઠો છું. આજના દિવસ સંબંધી આપના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપને વિષે અવિનય, અભક્તિ આશાતના, અપરાધ થયો હોય, તો હાથ જોડી, માન મોડી, મસ્તક નમાવી પંચઅંગ નમાવી ભુજો ભુજો કરી ખમાવું છું.

પાઠ : તૃતીય : પાંચમા ખામણા

(સાધુ-સાધ્વીજીઓને)

પાંચમા ખામણા પાંચ ભરત, પાંચ ઐરવત, પાંચ મહાવિદેહ;
એ અહીંદીપ કોત્રને વિષે બિરાજતા સાધુ-સાધ્વીજીઓને કરું છું.
તેઓ જ્યાન્ય હોય તો બે હજાર કોડ સાધુ-સાધ્વી, અને ઉત્કૃષ્ટ
હોય તો નવ હજાર કોડ સાધુ-સાધ્વી તેમને મારી તમારી સમય-
સમયની વંદના હોજો.

તે સ્વામી કેવા છે ! પાંચ મહાવ્રતના પાલણાહાર છે, પાંચ
સમિતિએ અને ત્રણ ગુપ્તિએ સહિત, છ કાયના પિયર, છ કાયના
નાથ, સાત ભયના ટાલણાહાર, આઠ મદના ગાલણાહાર, નવ વાડ
વિશુદ્ધ બ્રહ્મચર્યના પાલણાહાર, દશવિધ પતિધર્મના અજવાલિક,
અગિયાર શ્રાવકની તથા બાર લિક્ષુની પડિમાના જાળા, બાર બેદે
તપશ્ચયના કરણાહાર, સત્તર બેદે સંયમના ઘરણાહાર, વીસ
અસમાધિના ટાલણાહાર, બાવીશ પરિષહના જિતણાહાર, સત્તાવીશ
સાધુજીના ગુણો કરી સહિત, તેત્રીસ આશાતનાના ટાલણાહાર, ૪૨-
૪૭-૫૬ દોષ રહિત આહાર પાણીના લેવણાહાર, બાવન
અનાચારના ટાલણાહાર, સચેતના ત્યાગી, અચેતના ભોગી, કંચન-
કામિનીના ત્યાગી, માયા મમતાના ત્યાગી, મહાવૈરાગી, સમતાના
સાગર, દયાના સાગર આદિ અનેક ગુણો કરી સહિત છે.

ધન્ય સ્વામીનાથ ! આપશ્રી ગામ, નગર, રાયણહારી, પુર,
પાટણને વિષે બિરાજો છો. હું અપરાધી, દીનક્રિકર, ગુણહીન અહીં
બેઠો છું. આજના દિવસ સંબંધી આપના જ્ઞાન, દર્શન, ચારિત્ર,
તપને વિષે અવિનય, અભક્તિ, આશાતના, અપરાધ થયો હોય,
તો હાથ જોડી, માન મોડી, મસ્તક નમાવી પંચ અંગ નમાવી ભુજો
ભુજો કરી ખમાવું છું.

શ્રાવક સામાયિક પ્રતિકમણ સૂત્ર

(અહીં સાધુ-સાધીજી બિરાજતાં હોય, તો તેમની પાસે જઈ
નાચેની ગાથા બોલી ત્રણ વખત વિધિપૂર્વક વંદના કરવી.)

સાધુ વંદે તે સુખીયા થાય, ભવો ભવનાં તો પાતક જાય;
ભાવ ધરીને વંદે જેહ, વહેલો મુક્તિમાં જાશે તેહ.

પાઠ : ઉત્ત : છઢા ખામણા

(શ્રાવક-શ્રાવિકાજીઓને)

છઢા ખામણા અઢીદીપ માંહેના સંખ્યાતા, અઢીદીપ બહારના
અસંખ્યાતા × શ્રાવક-શ્રાવિકાજીઓને કરું છું. તે શ્રાવક-
શ્રાવિકાજીઓ કેવા છે ?

મુજથી, તમથી, દાને, શીલે, તપે, ભાવે ગુણે કરી અધિક
છે. બે વખત આવશ્યક પ્રતિકમણના કરનાર છે. મહિનામાં બે,
ચાર છ પૌષધના કરનાર છે. સમક્ષિત સહિત બાર પ્રતધારી,
અગિયાર પડિમાના સેવણાહાર છે. ત્રણ મનોરથના ચિંતવનાર છે.
(૧) × ક્યારે આરંભ અને પરિગ્રહ ઓછો કરું. (૨) ક્યારે સંયમ
અંગીકાર કરું. (૩) ક્યારે સંથારો કરી પંડિત મરણે મરું. દૂબળા-
પાતળા જીવની દ્યાના આણનાર છે, જીવ, અજીવ આદિ નવ
તત્ત્વના જાણનાર છે. શ્રાવકજીના એકવીશ ગુણે સહિત છે. પર
ધન પત્થર સમાન લેખે છે. પરસ્ત્રી માતા - બેન સમાન લેખે છે.

× મનુષ્યો સંખ્યાતા જ હોય છે, તેથી શ્રાવક-શ્રાવિકા સંખ્યાતા
હોવા જોઈએ, પણ અઢી દીપની બહારના તિર્યચો પણ શ્રાવકના
પ્રતો ધારણ કરે છે. આ તિર્યચોને ચંદ્રસૂર્યના માંડલા વગેરેને જોવાથી
જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પત્ત થાય છે. અને તેઓ દેશવિરતિ ધર્મની
પાલના કરે છે. આ હિસાબે શ્રાવક-શ્રાવિકા અસંખ્યાત કહેલ છે.

શ્રાવક સામાયિક પ્રતિકમણ સૂત્ર

(બહેનો માટે પરપુરુષ પિતા-ભાઈ સમાન એમ બોલવું) દૃઢધર્મા
 'પ્રિયધર્મા', દેવતાના ડગાવ્યા ડગે નહિ એવા છે, ધર્મનો રંગ હાડ-
 હાડની મિંજજાએ લાગ્યો છે. એવા શ્રાવક શ્રાવિકાળ સંવર, પૌષ્ઠધ,
 પ્રતિકમણમાં બિરાજતા હશે, તેમનો આજના દિવસ સંબંધી
 અવિનય, અભક્તિ આશાતના, અપરાધ કર્યો હોય તો હાથ જોડી,
 માન મોડી, મસ્તક નમાવી ભુજો ભુજો કરી ખમાવું છું.

સાધુ-સાધીજીઓને વાંદુ છું. શ્રાવક-શ્રાવિકાળાંને ખમાવું
 છું. સમકિતદૃષ્ટિ જીવોને ખમાવું છું. ઉપકારી ભાઈ-બહેનોને ખમાવું
 છું તથા ચોરાશી લાખ જીવાયોનિના જીવોને ખમાવું છું.

ચોરાશી લાખ જીવાયોનિ - સૂત્ર

સાત લાખ પૃથ્વીકાય, સાત લાખ અપકાય, સાત લાખ
 તઉકાય, સાત લાખ વાઉકાય, દશ લાખ પ્રત્યેક વનસ્પતિકાય,
 ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાય, બે લાખ બેઈન્દ્રિય, બે લાખ
 તઈન્દ્રિય, બે લાખ ચૌરેન્દ્રિય, ચાર લાખ નારકી, ચાર લાખ
 દેવતા, ચાર લાખ તિર્યંચ પંચેન્દ્રિય, ચૌદ લાખ મનુષ્યની જાતિ
 (કુલ ૮૪ લાખ જીવાયોનિ)

આ ચોરાશી લાખ જીવાયોનિના જીવોને મારા જીવે, તમારા
 જીવે હાલતાં-ચાલતાં, ઊઠતાં-બેસતાં, જાણતાં-અજાણતાં,
 હણ્યા હોય; હણાવ્યા હોય, છેદા હોય, બેદા હોય, પરિતાપના-
 કુલામના ઉપજાવી હોય, તો અરિહંત, અનંત સિદ્ધ ભગવાનની
 સાક્ષીએ તસ્સ મિચ્છા મિ દુકુડું.

પાઠ : ઉપ : ક્ષમાપના-સૂત્ર

(અનુષ્ટુપ છંદ)

ખામેમિ સવ્યે જીવા, સવ્યે જીવા વિ ખમન્તુ મે
મિત્તી મે સવ્યભૂઅસુ, વેરં મજાં ન કેણાઈ. ૧
એવમહં આલોઈયં, નિંદિયં ગરહિયં - દુગાછિયં,
સમ્બં તિવિહેણં પડિકુંતો, વન્દામિ જિરો ચઉવ્યાસં. ૨

ખામેમિ	- ખમાવું છું,
સવ્યે	- સર્વ (બધાં)
જીવા	- જીવોને
સવ્યે	- સર્વ
જીવા	- જીવો
ખમન્તુ	- મારા અપરાધની ક્ષમા કરે.
મે	- મને
મિત્તી	- (ક્રમ કે) મિત્રતા છે.
મે	- મારી
સવ્યભૂઅસુ	- બધા જીવોથી
વેરં	- વૈરભાવ (શત્રુતા)
મજાં	- મારે
ન	- નથી
કેણાઈ	- કોઈની સાથે
એવ	- આ રીતે
મહં	- હું
આલોઈયં	- આલોચના કરીને
નિંદિયં	- આત્મ સાક્ષીએ નિંદા કરીને
ગરહિયં	- ગુરુ સાક્ષીએ ગર્દા કરીને

શ્રાવક સામાયિક પ્રતિકમણ સૂત્ર

દુગંધિયં	- જુગુપ્સા (ગ્લાનિ-ધૃષા) કરીને
સમ્મં	- સમ્યક્ પ્રકારે
તિવિહેણ	- ત્રણે યોગોથી
પડિકુંતો	- પાપકર્માથી નિવૃત્ત થઈને
વંદામિ	- વંદન કરું છું
જિષા	- અરિહંત ભગવંતોને
ચઉવીસં	- ચોવીશે

ઇતિ અતિચાર આલોવ્યા; પડિકુંમ્યા, નિંધા, ગહંચા
નિઃશલ્ય થયા. વિશેષ વિશેષે અરિહંત, સિદ્ધ, કેવલી,
ગણધરજી, આચાર્યજી, ઉપાધ્યાયજી, સાધુ, સાધ્વી, ગુરુ
આદ્ધને ભુજો-ભુજો કરી ખમાવ્યા છે.

(આ સ્થાને પ્રતિકમણ સૂત્રનો ત્રીજો 'દ્વાદશાવર્ત' ગુરુવંદન
સૂત્ર' નો "પાઠ ઇચ્છામિ ખમાસમણો ! વંદિં.....
થી.....વોસિરામિ." સુધી. બે વાર ઉત્કૃષ્ટ આસને બોલવો.
(ત્યાર પછી)

સ્વામીનાથ ! સામાયિક એક, ચઉવીસત્થો બે, વંદના ત્રણ
અને પ્રતિકમણ ચાર. આ ચાર આવશ્યક પૂરાં થયાં. એને વિષે
શ્રી વીતરાગદેવની આજ્ઞામાં કાનો, માત્રા, મીંડુ, પદ, અક્ષર,
ગાથા, સૂત્ર, ઓછું, અધિક, વિપરીત ભણાયું હોય, તો
અરિહંત, અનંત સિદ્ધ ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છા મિ
દુકું.

(ઇતિ ચોથો પ્રતિકમણ આવશ્યક સમાપ્ત)

(૫) કાઉસ્સગું આવશ્યક

(અહીં જીભા થઈને સવિધિ વંદના કરીને પાંચમા આવશ્યકની આજા માંગવી.)

- | | |
|--------------|---------------------------------------|
| દેવસિય | - દિવસ સંબંધી |
| પાયચિંતા | - પ્રાયશ્ચિત્ત (સ્થાન, અતિચારો)ની |
| વિશુદ્ધનાર્થ | - વિશેષ શુદ્ધિ કરવા માટે |
| કરેમિ | - કરું છું |
| કાઉસ્સગું | - કાયોત્સર્ગ (શરીરના વ્યાપારનો ત્યાગ) |

ભૂમિકા :

- (ક) અહીં 'નમસ્કાર મંત્ર'નો પા�. (ત્યાર પણી)
- (ખ) કરેમિ ભન્તે ! સામાઈયં.... 'જાવ' પછ્યુવાસામિ.
- (ગ) ઈચ્છામિ ઠામિ કાઉસ્સગું..... 'જાવ' જું ખંડિયં, જું વિરાહિયં તસ્સ મિચ્છા મિ દુકુડં.
- (ધ) તસ્સ ઉત્તરી કરણોણં.... 'જાવ' અપ્પાણં વોસિરામિ.

● કાયોત્સર્ગ ●

દેવસિય પ્રતિક્રમણમાં ચાર "લોગસ્સ" નો કાયોત્સર્ગ કરવો.
રાત્રિ પ્રતિક્રમણમાં ચાર લોગસ્સનો કાયોત્સર્ગ કરવો.
કોઈ કોઈ સંપ્રદાયમાં 'ધર્મધ્યાન'નો કાઉસ્સગું પણ થાય છે તેથી અહીં આપેલ છે.

નોંધ:

- પદ્મિંદ્ર પ્રતિક્રમણમાં ૮ અથવા ૧૨ લોગસ્સનો કાઉસ્સગું કરવો.
ચૌમાસી પ્રતિક્રમણમાં ૧૨ અથવા ૨૦ લોગસ્સનો કાઉસ્સગું કરવો.
સંવત્સરી પ્રતિક્રમણમાં ૨૦ અથવા ૪૦ લોગસ્સનો કાઉસ્સગું કરવો.

ધર્મધ્યાનનો કાઉસ્સગ

- | | |
|-------------------------|--|
| સેકિંત ધર્મજગ્ઝાણો ? | - ધર્મધ્યાન તે શું છે ? |
| ધર્મજગ્ઝાણો ચઉબ્બિહે | - ધર્મધ્યાન ચાર પ્રકારનાં છે. |
| ચઉખ્પડિયારે | - તે દરેકનાં ચાર ચાર પડલેદ. |
| પત્રતો | - પ્રરૂપ્યા. |
| તં જહા | - તે આ પ્રમાણો, |
| આણાવિજાએ | - આશાનો વિચાર ચિંતવવો. |
| અવાયવિજાએ | - દુઃખનો વિચાર ચિંતવવો. |
| વિવાગવિજાએ | - જીવ સુખ-દુઃખ શાથી ભોગવે છે;
તેનો વિચાર ચિંતવવો. |
| સંઠાણવિજાએ | - લોકના આકારનો વિચાર
ચિંતવવો. |
| ધર્મસ્સ ણાં જાણસ્સ | - ધર્મધ્યાનના |
| ચત્તારિ લક્ષ્મણા પત્રતા | - ચાર લક્ષણ પ્રરૂપ્યા |
| તં જહા | - તે આ પ્રમાણો, |
| આણારુઈ | - આશાની રૂચિ. |
| નિસ્સગરુઈ | - શ્રદ્ધાની રૂચિ. |
| ઉવએસરુઈ | - ઉપદેશની રૂચિ. |
| સુતરુઈ | - સૂત્ર-સિદ્ધાંતની રૂચિ. |
| ધર્મસ્સ ણાં જાણસ્સ | - ધર્મધ્યાનના |
| ચત્તારિ આલંબણા પત્રતા | - ચાર આલંબન પ્રરૂપ્યા. |
| તં જહા | - તે આ પ્રમાણો, |
| વાયણા | - વાંચવું. |
| પુચ્છણા | - પૂછવું. |
| પરિયદ્રણા | - શીખેલું સંભાળવું. |

શ્રાવક સામાયિક પ્રતિકમણ સૂત્ર

- ધર્મકથા કરવી.
- ધર્મધ્યાનની,
- ચાર અનુપ્રેક્ષાઓ, (વિચારણા)
- પ્રરૂપી
- તે આ પ્રમાણો,
- એકલાપણાનો વિચાર ચિંતવવો.
(કુ-આ જીવ એકલો આવ્યો છે;
અને એકલો જ જશો.)
- અનિત્યપણાનો વિચાર ચિંતવવો.
(કુ-સંસાર અનિત્ય છે. વગેરે)
- અશરણપણાનો વિચાર ચિંતવવો.
(કુ-સંસારમાં કોઈ કોઈને ત્રાણ-
શરણભૂત નથી. વગેરે)
- સંસાર વિષે વિચાર ચિંતવવો.
(કુ-સંસાર કેવો વિચિત્ર છે.
વગેરે)

આ ધર્મધ્યાનનો સૂત્ર પાઠ કહ્યો હવે તેના અર્થ કહે છે.

ધર્મધ્યાનના પહેલા ચાર ભેદ

- | | |
|----------------|----------------|
| (૧) આણાવિજાએ | (૨) અવાયવિજાએ |
| (૩) વિવાગવિજાએ | (૪) સંઠાણવિજાએ |

પહેલો ભેદ - આણાવિજાએ :

આણાવિજાએ કહેતાં વીતરાગદેવની આશાનો વિચાર

ચિંતવવો. વીતરાગદેવની આજ્ઞા એવી છે કે - સમકિત સહિત
શ્રાવકના બાર પ્રત, અગિયાર પડિમા, સાધુજીનાં પાંચ મહાપ્રત
તથા બાર લિખુની પડિમા, શુભધ્યાન. શુભજોગ, જ્ઞાન, દર્શન,
ચારિત્ર, તપ અને છકાય જીવની રક્ષા : એ વીતરાગદેવની આજ્ઞા
આરાધવી. તેમાં સમય માત્રનો પ્રમાદ ન કરવો. ચતુર્વિધ સંઘના
ગુણકીર્તન કરવા. આ ધર્મધ્યાનનો પહેલો ભેદ કહ્યો.

બીજો ભેદ - અવાયવિજાને :

અવાયવિજાને કહેતાં - જીવ સંસારમાં દુઃખ શા માટે ભોગવે
છે ? તેનો વિચાર ચિંતવવો. તેનો વિચાર એ છે કે - મિથ્યાત્વ,
અપ્રત, પ્રમાદ, કખાય, અશુભયોગ, અઢાર પાપસ્થાનક અને છકાય
જીવની હિંસા. એથી કરીને જીવ દુઃખ પામે છે. માટે એવું દુઃખનું
કારણ જાણી, એવો આશ્રવમાર્ગ ત્યાગી, સંવરમાર્ગ આદરવો. જેથી
જીવ દુઃખ ન પામે. આ ધર્મધ્યાનનો બીજો ભેદ કહ્યો.

ત્રીજો ભેદ - વિવાગવિજાને :

વિવાગવિજાને કહેતાં-જીવ સંસારમાં સુખ અને દુઃખ ભોગવે
છે તે શા થકી ? તેનો વિચાર ચિંતવવો. તેનો વિચાર એ છે કે
- જીવે જેવે રસે કરી પૂર્વે જેવાં શુભાશુભ જ્ઞાનાવરણીય આદિ આઈ
કર્મ ઉપાર્જન કર્યા છે, તે શુભાશુભ કર્મના ઉદ્યથી, જીવ તે પ્રમાણે
સુખ અને દુઃખ અનુભવે છે. તે અનુભવતાં થકા કોઈ ઉપર રાગ-
દ્રોષ ન આણી, મમતાભાવ રાખી, મન, વચન, કાયાના શુભ યોગ
સહિત શ્રી જૈનધર્મને વિષે પ્રવતીએ. જેથી નિરાબાધ પરમસુખને
પામીએ. આ ધર્મધ્યાનનો ત્રીજો ભેદ કહ્યો.

ચોથો બેદ - સંઠાણવિજાને : -

સંઠાણવિજાને કહેતાં-ગ્રાણ લોકના આકારનો વિચાર ચિંતવવો. ગ્રાણ લોકના આકારનું સ્વરૂપ સુપર્છીક (= સરાવલા) ને આકારે છે. લોક જીવ-અજીવથી સંપૂર્ણ ભર્યો છે. મધ્યભાગે અસંખ્યાતા છે. લોક જીવ-અજીવથી સંપૂર્ણ ભર્યો છે. મધ્યભાગે અસંખ્યાતા છે. લોકા-કોડી પ્રમાણે તિચ્છાલોક છે. તેમાં અસંખ્યાતા દીપ-જોજનની કોડા-કોડી પ્રમાણે તિચ્છાલોક છે. તેમાં અસંખ્યાતા દીપ-સમુદ્ર છે. અસંખ્યાતા વાળાવ્યંતરના નગરો છે. અસંખ્યાતા જ્યોતિષીના વિમાનો છે તથા અસંખ્યાતી દેવતાની રાજધાનીઓ છે. તેને મધ્યભાગે અઢીદીપ છે. તેમાં જીવન્ય તીર્થકર વીસ અને ઉત્કૃષ્ટ હોય તો ૧૬૦ અથવા ૧૭૦. જીવન્ય બે કોડ કેવલી અને ઉત્કૃષ્ટ હોય તો નવ કોડ કેવલી તથા જીવન્ય બે હજાર કોડ સાધુ-સાધ્વી અને ઉત્કૃષ્ટ હોય તો નવ હજાર કોડ સાધુ-સાધ્વી તેમને વંદામિ, નમંસામિ, સક્કારેમિ, સમ્માણેમિ, કલ્ષાણં, મંગલં, દેવયં, ચેઈયં, પદ્માવાસામિ તેમજ તિચ્છાલોકમાં અસંખ્યાતા શ્રાવક-શ્રાવિકાજીઓ છે, તેમના ગુણગ્રામ કરવા.

તિચ્છાલોકથી અસંખ્યાત ગુણો અધિક (મોટો) ઉર્ધ્વલોક છે. તેમાં બાર દેવલોક; નવ ગ્રૈવેયક અને પાંચ અનુતાર વિમાન છે. તે સર્વ મળીને કુલ ચોરાશી લાખ, સત્તાશું હજાર, ત્રેવીશ (૮૪,૮૭,૦૨૩) વિમાનો છે. તે ઉપર (લોકાએ) સિદ્ધક્ષેત્ર છે. ત્યાં સિદ્ધ ભગવંતજી નિરંજન, નિરાકાર બિરાજ રહ્યા છે. તેમને વંદામિ, નમંસામિ, સક્કારેમિ, સમ્માણેમિ, કલ્ષાણં, મંગલ, દેવયં, ચેઈયં, પદ્માવાસામિ.

તે ઉર્ધ્વલોકથી કાંઈક વિશેષ અધિક (મોટો) અધોલોક છે. તેમાં સાત નરકના ચોરાશી લાખ નરકાવાસા છે. સાત કરોડ બહોંતેર લાખ ભવનપતિના ભવનો છે.

એવા ત્રણે લોકના સર્વ સ્થાનોમાં (પાંચ અનુગ્રહ વિમાનનાં દેવો સિવાય) સમકિત રહિત કરણી કરીને, આ જીવે અનંતીવાર જન્મ-મરણે કરી સ્પર્શી મૂક્યા છે. તો પણ આ જીવનો પાર આવ્યો નહિ. એવું જાણી સમકિત સહિત શ્રુત (જ્ઞાન, દર્શન) અને ચારિત્ર ધર્મની આરાધના કરવી. જેથી અજર, અમર, નિરાબાધ, પરમ સુખને પામીએ. આ ધર્મધ્યાનનો ચોથો ભેદ કહ્યો.

ઈતિ ધર્મધ્યાનનો કાઉસ્સગ સમાપ્ત

(ક) અહીં કાઉસ્સગ પાળીને સામાયિક સૂત્રનો પાંચમો પાઠ “ચતુર્વિંશતિ સત્તવ-લોગસ્સ સૂત્ર” કાવ્યરૂપે બોલીને તીર્થીકરોના ગુણકીર્તન કરવા.

(ખ) ત્યાર પછી “દ્વાદશાવર્ત ગુરુવંદના સૂત્ર” પ્રતિકમણ સૂત્રનો ત્રીજો પાઠ-ઈચ્છામિ ખમાસમણો ! થી વોસિરામિ. સુધીનો પાઠ બે વાર ઉભડક (ઉત્કટુક) આસને બોલવો.

સ્વામીનાથ ! સામાયિક એક, ચારુવીસત્થો બે, વંદના ત્રણ, પ્રતિકમણ ચાર અને કાઉસ્સગ પાંચ. આ પાંચે આવશ્યક પૂરાં થયાં. એને વિષે શ્રી વીતરાગદેવની આજ્ઞામાં કાનો, માત્રા, મીંડુ, પદ, અક્ષર, ગાથા, સૂત્ર, ઓછું, અધિક, વિપરીત ભણાયું હોય, તો અરિહંત, અનંત સિદ્ધ ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છા મિ દુકુકું.

પર્યક્ખાણ આવશ્યક

(પૂર્ણ સાધુ-સાધીજીઓ બિરાજતા હોય તો તેમને સવિધિ ત્રણ વંદના કરી અને ‘પર્યક્ખાણ ફરમાવશોજ’ એમ વિનંતિ કરી અને પર્યક્ખાણ કરવા. પૂ. સાધુ-સાધીજી બિરાજતા ન હોય તો વડિલ શ્રાવકજીને વિનંતિ કરવી અને કોઈ ન હોય તો પોતાની મેળે નીચે મુજબ પ્રત્યાખ્યાનનો પાઠ બોલી પર્યક્ખાણ કરવા.)

યૌવિહારના પર્યક્ખાણ :-

ધારણા પ્રમાણે ચઉલ્લિહું પિ આહારં પર્યક્ખામિ-અસણાં;
પાણાં, ખાઈમં, સાઈમં, અત્રાથાણાભોગેણાં, સહસાગારેણાં,
મહત્તરાગારેણાં, સવ્વંસમાહિ વત્તિયાગારેણાં અપ્પાણાં
વોસિરામિ.

પ્રતિકમણ સમાપ્તિ - સૂત્ર

સ્વામીનાથ ! સામાયિક એક, ચઉલીસત્થો બે, વંદના ત્રણ,
પ્રતિકમણ ચાર, કાઉસ્સંગ પાંચ અને છઢા પર્યક્ખાણ. આ
ઇ એ આવશ્યક પૂરાં થયા એને વિષે શ્રી વીતરાગદેવની
આજ્ઞામાં કાનો, માત્રા, મીંડું, પદ, હસ્ત અક્ષર, ગાથા, સૂત્ર,
ઓછું, અધિક, વિપરીત ભણાયું હોય, તો અરિહંત અનંતા
સિદ્ધ ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છા મિ દુક્કડં.

મિથ્યાત્વનું પ્રતિકમણ, અત્રતનું પ્રતિકમણ, પ્રમાદનું
પ્રતિકમણ, કષાયનું પ્રતિકમણ; અશુભયોગનું પ્રતિકમણ. આ
સર્વ મળી ૮૨ બોલનું પ્રતિકમણ ૧૨૪ દોષ ટાળી સમીરીતે
ન પડિકમ્યું હોય. એને વિષે અતિકમ, વ્યતિકમ, અતિચાર,
અનાચાર, જાણતાં-અજાણતાં, મન, વચન, કાયાએ કરી કોઈ
પણ પાપ દોષ લાગ્યો હોય, તો અરિહંત અનંતા સિદ્ધ
ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છા મિ દુક્કડં.

ગયા કાળનું પ્રતિકમણ, વર્તમાન કાળનો સંવર અને આવતાં
કાળના પર્યક્ખાણ. એને વિષે કોઈ પાપ દોષ લાગ્યો હોય,
તો અરિહંત અનંતા સિદ્ધ ભગવાનની સાક્ષીએ
તસ્સ મિચ્છા મિ દુક્કડં.

સમ, સંવેગ, નિર્વદ, અનુકૂળા, અને આસ્થા. સાચાની શ્રદ્ધા, ખોટાનું વારંવાર મિચ્છા મિ દુકુડં.

દેવ અરિહંત, ગુરુ નિર્ગ્રથ, કેવલી ભાષિત દ્યામય ધર્મ.
આ ત્રણ તત્ત્વ સાર, સંસાર અસાર.

ભગવંત ! આપનો માર્ગ સત્ય છે.

તમેવ સર્ચં ! તમેવ સર્ચં !

કરેમિ મંગલં, મહામંગલં, થવ થુઈ મંગલં.

અહીં ત્રણ “નમોત્થુણં” બોલવા.

ક્ષેત્રવિશુદ્ધિની વિધિ :

પૌષ્ઠ્ર, સંવર, યા સામાયિક ગ્રહણ કરેલ હોય. અને ૨૪ મિનિટ (= ૧ ઘડી) થઈ ગયેલ હોય, તો “ક્ષેત્રવિશુદ્ધિ” ની આજા એમ બોલીને પૂર્વ તથા ઉત્તરદિશા (ઇશાનકોણ) તરફ મુખ કરીને સીમંઘરસ્વામીને સવિધિ ત્રણ વંદના કરવી. (પૂ. સાધુ-સાધીજીઓ બિરાજતાં હોય તો તેઓને વંદના કરી આજા લેવી.)

યથાશક્તિ ઊભા રહીને ‘સામાયિકસૂત્ર’ ના ૧ થી ૪ પાઠ બોલવા. ત્યારપછી કાઉસ્સગ્ગ કરવો. કાઉસ્સગ્ગમાં “ઇચ્છામિ પદિક્કમિઉ થી....તસ્સ આલોઉ” (કાઉસ્સગ્ગમાં ‘મિચ્છા મિ દુકુડં’ શબ્દ બોલવો નહિ.) સુધી મનમાં બોલી પ્રગટ પણે “નમો અરિહંતાણં” બોલી કાઉસ્સગ્ગ પારવો. ત્યાર પછી “લોગસ્સ” બોલવો. ત્યાર પછી ડાબો ઢીંચણ ઊભો રાખીને “ત્રણ નમોત્થુણં બોલવા.

ક્ષેત્રવિશુદ્ધિની વિધિ સમાપ્ત

પ્રતિકમણ કરવાની વિધિ

પુ. સાધુ-સાધ્વીજીઓ બિરાજતાં હોય તો સવિધિ ત્રણ વંદના કરી. ‘દેવસિય પ્રતિકમણ’ ની આજી માગવી, બિરાજમાન ન હોય તો ઈશાનકોણમાં સીમંઘરસ્વામીને સવિધિ ત્રણ વંદના કરી આજી લેવી. યથાશક્તિ પ્રતિકમણ ઉભા રહીને કરવું.

‘ઈચ્છામણાં ભંતે !’ અને ‘નમસ્કારમંત્ર’નો પાઠ બોલીને સવિધિ વંદના કરીને પહેલા આવશ્યકની આજી એમ કહીને

(૧) સામાયિક આવશ્યકમાં ‘કરેમિ ભંતે !’ ‘ઈચ્છામિ ઠામિ કાઉસ્સગાં’ અને ‘તસ્સ ઉતારી કરણોણાં’ ના પાઠ બોલી કાઉસ્સગા કરવો, કાઉસ્સગામાં ૮૮ અતિચાર બોલવા. (૮૮ અતિચાર ન આવડતાં હોય તો ૪ લોગસ્સ યા ઉર નમસ્કારમંત્રનો કાઉસ્સગા કરવામાં આવે છે.) ૮૮ અતિચારમાં “જે વાઈદું...આદિ કામભોગાસંસ્પર્ખઓગે ‘તસ્સ ભિચ્છા મિ દુક્કડં.’ સુધી બોલી ‘નમો અરિહંતાણાં બોલી કાઉસ્સગા પાળવો. ત્યાર પછી ‘કાઉસ્સગામાં કાનો, માત્રા,... તસ્સ ભિચ્છા મિ દુક્કડં. સુધીનો ‘કાઉસ્સગા શુદ્ધિ પાઠ’ બોલવો. અહીં પહેલો સામાયિક આવશ્યક સમાપ્ત થયો. ત્યાર પછી સવિધિ વંદના કરી બીજા આવશ્યકની આજી એમ કહીને.

૨ ચર્ચાવીસત્થો આવશ્યકમાં ‘લોગસ્સ’ નો પાઠ બોલવો. અહીં બીજો ‘ચર્ચાવીસત્થો આવશ્યક’ સમાપ્ત થયો. ત્યાર પછી ત્રીજા આવશ્યકની આજી એમ કહીને.

(૩) વંદના આવશ્યકમાં ‘ઈચ્છામિ ખમાસમણો ! આ પાઠ ઉત્કટુક આસને વિધિપૂર્વક બે વાર બોલવો. અહીં ત્રીજો આવશ્યક સમાપ્ત થયો. સવિધિ વંદના કરી ચોથા આવશ્યકની આજી. એમ કહીને.

શ્રાવક સામાયિક પ્રતિકમણ સૂત્ર

(૪) પ્રતિકમણ આવશ્યકમાં ઉભા થઈને પા� : ૪ ‘જ્ઞાનના અતિચાર’ થી શરૂ કરી કમશ પાઠ : ૨૧ સુધી બોલવા ત્યારપછી “ઇચ્છામિ પડિકુમિઉ જો મે * (બીજો પાઠ) ‘નમસ્કાર મંત્ર’ અને ‘કરેમિ ભંતે’ ના પાઠ બોલવા. ત્યારપછી જમણો ઢીંચણ ઉભો રાખી ‘મંગલ સૂત્ર-માંગલિક’ કહેવું, ત્યાર પછી શ્રમણસૂત્રની ભૂમિકારૂપે ‘ઇચ્છામિ પડિકુમિઉ, જો મે દેવસિંહોથી ત.મિ. દુકુંડ,’ અને ‘ઇચ્છામિ પડિકુમિઉ ઈરિયાવહિયાએનો પૂરો પાઠ બોલી, “આલોયણા” બોલવી. ત્યાર પછી “પાંચ શ્રમણસૂત્ર” બીજું બોલવા. તે આ ગ્રમાણે પહેલું શ્રમણસૂત્ર “શયા-સૂત્ર” બીજું શ્રમણસૂત્ર-“ગોચર-ચયાસૂત્ર” ગીજું શ્રમણસૂત્ર-“કાલ પ્રતિલેખના સૂત્ર” ચોથું શ્રમણસૂત્ર-“અસંયમસૂત્ર” પાંચમું શ્રમણ સૂત્ર “પ્રતિજ્ઞા સૂત્ર” પછી “ઈતિ અતિચાર આલોવ્યા બોલીને ઘરતી ઉપર બંને પગના ઢીંચણ સ્થાપીને ખામણા બોલવા.

દરેક ખામણાના અંતમાં બેઠા-બેઠા “વંદામિ...નમંસામિથી પજ્ઞુવાસામિ” સુધી પૂરો પાઠ ત્રણ વાર બોલવો. પાંચમા ખામણા પૂરાં થયા પછી ‘સાધુ વંદે તે સુખીયા થાય...’ દોહો બોલી સવિધિ ત્રણ વંદના કરવી. ત્યાર પછી છકા ખામણા, ‘ચોરાશી લાખ જીવાયોનિ તથા ખામેમિ સંઘે જીવાની ગાથા બોલવી. ત્યારપછી બધાંની સાથે ખમત-ખામણા કરવા, ઈતિ અતિચાર આલોવ્યા બોલવ્યા પછી સ્વામીનાથ ! સામાયિક એક આવશ્યક સમાપ્તિ પાઠ બોલવો. અહીં ચોથો પ્રતિકમણ આવશ્યક સમાપ્ત થયો. ફરી ‘તિકખુતોના પાઠથી સવિધિ વંદના કરી પાંચમા આવશ્યકની આશા, એમ કહીને.

પાંચમા કાઉસરગ આવશ્યકમાં (૧) ‘દેવસિય પાયચ્છિતનો પાઠ, (૨) ‘નમસ્કારમંત્ર’, (૩) ‘કરેમિભંતે !’ (૪) ‘ઇચ્છામિ

આવક સામાયિક પ્રતિકમણ સૂત્ર

શાખા કાઉસ્સગાં તથા (૫) તસ્સ ઉત્તરી સૂત્રના પાઠ બોલીને કાઉસ્સગા કરવો. કાઉસ્સગમાં ‘ચાર લોગસ્સ’નો કાઉસ્સગ અધ્યવા ધર્મધ્યાનનો (પરંપરા પ્રમાણે) કાઉસ્સગ કરવો, ‘નમો અરિહંતાણાં’ પ્રગટપણે બોલીને કાઉસ્સગ પાળવો.

ત્યાર પછી ‘લોગસ્સ-સૂત્ર’ પ્રગટપણે બોલીને ઉત્કટુક આસને ‘દુઃખાભિ ખમાસમજ્ઞો ! નો પાઠ બે વાર બોલવો. સ્વામીનાથ ! સામાયિક એક, આવશ્યક સમાપ્તિ પાઠ બોલવો. અહીં પાંચમો કાઉસ્સગ આવશ્યક સમાપ્ત થયો. ‘તિકખુત્તો’નાં પાઠથી સવિધિ વંદના કરી છઢા આવશ્યકની આજા.’ એમ કહીને....

(૬) પચ્ચકખાજા આવશ્યકમાં પથાશક્તિ પચ્ચકખાજા કરવા. ત્રણ નમોત્થુણાં બોલવા.

દેશાવગાશિકની વિધિ

આ પ્રદેશમાં જે વિધિથી આ પ્રતનું પાલન થાય છે તે લખું છું.

એક દિવસ રાત્રિ ધર્મસ્થાનમાં રહેવું; સચિત્ત વસ્તુનો ત્યાગ કરવો; ઉઘાડે મુખે બોલવું નહિ; પગરખાં પહેરવાં નહિ, સ્ત્રીનો સ્પર્શ કરવો નહિ. વ્યવહારિક વ્યાપાર કરવો નહિ. નિરારંભી આહાર જેમ બને તેમ ઓછો પેટને ભાડા પૂરતો એક ટંક લેવો; આ પ્રમાણે રહી દિવસ રાત્રિ ધર્મધ્યાન, જ્ઞાનાભ્યાસ વગેરેમાં પસાર કરવાં. આ ક્રિયાને ‘દ્યાપાલન પ્રત’ પણ કહે છે.

પ્રત અંગીકાર

સામાયિક - અંદરના પહેલેથી પાંચ પાઠ સુધીના પાઠ અને વિધિ સરખાં છે.

ત્યારબાદ ગુરુ મહારાજને સવિનય નમસ્કાર કરી નીચેનો પાઠ બોલવો.

શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર

(દ્વય થકી સાવજ્ઝોગ સેવવાનાં પચ્ચક્ખાણ, ક્ષેત્ર થકી, આખા લોક પ્રમાણે, કાળ થકી દિવસ ઉગ્યા સુધી અને ભાવ થકી ઉપયોગ સહિત છ કોટિએ પચ્ચક્ખાણ.)

કરેમિલંતે ! દેસાવગાસિયં; જાવ અહોરતાં પછ્છુવાસામિ ક્ષેત્ર સંબંધી દુવિહં તિવિહેણાં, ન કરેમિ, ન કારવેમિ, મણસા વયસા કાયસા ઉપભોગ પરિભોગ સંબંધી એગવિહં તિવિહેણાં ન કરેમિ મણસા વયસા કાયસા તસ્સ ભન્તે ! પડિક્કમામિ, નિંદામિ, ગરિધામિ, અખ્યાણાં વોસિરામિ.

ત્યારબાદ સામાયિકની માફક નમોત્થુણાં ગાળવાં.

આખા દિવસ રાત્રિનો કિયા-વિધિ પૌષ્ઠ-પ્રત પ્રમાણે જાળવો.'

બીજે દિવસે સવારે પડિલેહણ કરવું તે પહેલા પ્રત પળાય નહિ.

દેશાવગાશિકપ્રત પારવાની વિધિ

સામાયિકની માફક પહેલા પાઠથી પાંચમાં પાઠ સુધીનાં બોલવા અને વિધિ સરખી જાળવી. ત્યારબાદ નીચેનો પાઠ બોલવો.

એઅસ્સ દસમસ્સ દેસાવગાસિયવયસ્સ સમજોવાસાંએણ પંચ અઈયારા જાણિયંબા ન સમાયરિયંબા તં જહા તે આલોઉ - આણવજાપ્પાગો, પેસવજાપ્પાગો, સદાણુવાએ, રૂવાણુવાએ, બહિયાપોગલપ્ફખેવે તસ્સ મિચ્છા મિ દુક્કડં.

દેસાવગાસિયં સમ્મંકાએણાં, ન ફાસિયં, ન પાલિયં, ન સોદિયં, ન તિરિયં, ન કિછિયં, ન આરાદિયં, આણાએ અણુપાલિયં, ન ભવઈ તસ્સ મિચ્છા મિ દુક્કડં.

દેશાવગાશિક પ્રતમાં લાગતા દોષ માંદિલો જે કોઈ દોષ લાગ્યો હોય તો તસ્સ મિચ્છા મિ દુક્કડં.

શ્રાવક સામાયિક પ્રતિકમણ સૂત્ર

દેશાવગાશિકપ્રતમાં સ્ત્રીકથા, ભોજનકથા, દેશકથા, રાજકથા આ ચાર વિકથા માંહેલી કોઈ વિકથા કરી હોય તો તસ્સ મિથ્યા મિ દુક્કડં.

દેશાવગાશિક પ્રતમાં આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા, એ ચાર સંજ્ઞા માંહેલી કોઈ સંજ્ઞા સેવી હોય તો તસ્સ મિથ્યા મિ દુક્કડં.

દેશાવગાશિક પ્રત વિધિએ લીધું, વિધિએ પાણ્યું છતાં અવિધિએ થયું હોય તો તસ્સ મિથ્યા મિ દુક્કડં.

દેશાવગાશિક પ્રતમાં અતિકમ, વ્યતિકમ, અતિચાર, અનાચાર, જાણતાં અજાણતાં, મન વચન અને કાયાએ કરી જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ સંબંધી કાંઈ દોષ લાગ્યા હોય તો તસ્સ મિથ્યા મિ દુક્કડં.

કાનો, માત્રા, અનુસ્વાર પદ, ગાથા, સૂત્ર, - ઓછું અધિક કે વિપરીત ભણાયું હોય તો અનન્ત સિદ્ધ કેવલી ભગવાનની સાક્ષીએ તસ્સ મિથ્યા મિ દુક્કડં.

ત્યારબાદ સામાયિકની માફક 'નમોત્થ્યણ' ગણવા છેવટે ત્રણ નમસ્કારસૂત્રનો કાયોત્સર્ગ કરવો.

વિધિ સંપૂર્ણ

પૌષધોપવાસ અંગીકાર

સામાયિકની માફક પ્રથમથી પાંચમા પાઠ સુધીના પાઠ અને કિયા સરખા છે. ત્યારબાદ ગુરુમહારાજ. (હાજર ન હોય તો શ્રી સીમંઘરપ્રભુ)ને સવિનય વંદન કરી પૌષધપ્રત લેવાની આજા માગવાને નીચેનો પાઠ બોલવો.

કરેમિ ભન્તે ! પદિપુષ્ટપોસહં; અસણં, પાણં, ખાઈમં સાઈમં, પચ્યકખામિ; અબંભંપચ્યકખામિ; ઉમ્મુક્ક મહિસુવણણં

શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર

પર્યાયભાષિ; માલાવણણગ વિલેવણાં પર્યાયભાષિ; સત્યમુસલાદિ
સાવજ્ઞાં જોગાં પર્યાયભાષિ; જાવ અહોરતાં અથવા જાવ નિયમાં
પજ્ઞુવાસાભિ; દુવિહં તિવિહેણાં, ન કરેભિ, ન કારવેભિ, મણસા,
વયસા, કાયસા; તસ્સ ભન્તે ! પડિક્કમાભિ, નિંદાભિ ગરિધાભિ,
અષ્પાણાં વોસિરાભિ.

ત્યારબાદ સામાયિકની જેમ નમોત્થુણાં ગણવાં.

પૌર્ખધોપવાસ પારવાની વિધિ

દશમા વ્રતની જેમ જ પરંતુ જ્યાં દશમુક્રત છે ત્યાં અગ્યારમાં
વ્રતમાં એમ બોલવું અને અતિચાર અગ્યારમાં વ્રતના બોલવા.
તથા પૌર્ખધના ૧૮ દોષ માંછેના કોઈ દોષનું સેવન થયું હોય તો
મિથ્યા મિ દુક્કડ બોલવું.

પૌર્ખધનાં ૧૮ દોષ

પૌર્ખધ કરવાનાં આગળના દિવસે લાગતા દોષો

- (૧) ચાંપી ચાંપીને વધારે ખાવું.
- (૨) નખ-વાળ વગેરે સજાવવા
- (૩) મૈથુન સેવન કરવું
- (૪) પૌર્ખધ માટેનાં વસ્ત્રાદિ ધોવા કે ધોવરાવવા.
- (૫) શરીરની સ્નાનાદિ સુશ્વષા કરવી.
- (૬) પૌર્ખધ નિભિતે આભૂષણો પહેરવા.
- (૭) અવિરતિ પાસે પોતાની સેવા કરાવવી.
- (૮) શરીર પરનો મેલ ઉતારવો.
- (૯) પૂંજ્યા વગર શરીર ખંજોળવું.
- (૧૦) દિવસે કે એક પ્રહર રાત્રિ ગયાં પહેલાં ઉંઘવું અને
રાત્રે છેલ્ખા પહોરમાં ધર્મ જાગરણ ન કરવું.

શ્રાવક સામાયિક પ્રતિકમણ સૂત્ર

- (૧૧) પૂજ્યા વગર પરંઠવું.
- (૧૨) નિંદા - વિકથા કરવી - છાસ્ય, ઠઢા મશકરી કરવાં.
- (૧૩) સાંસારિક વિષયોની ચર્ચા, વાર્તા કરવી.
- (૧૪) પોતે ડરવું કે બીજાને ડરાવવા.
- (૧૫) કલેશ કરવો.
- (૧૬) અયતનાથી (ખુલ્લે મોઢે તથા સાવધ ભાષા વ.)
બોલવું.
- (૧૭) સ્ત્રીનાં અંગોપાંગ નિરખવા - મોહક દ્રશ્યો જોવા -
મોહક રાગ સાંભળવા - સુગંધ સુંઘવી વ. ઈન્દ્રિયનાં
વિષયો પોષવા
- (૧૮) સાંસારિક સંબંધથી કોઈને બોલાવવા.
ઉપરોક્ત અદાર દોષ રહિતં શુદ્ધ પૌષ્ટ કરવો જોઈએ.

તા.ક.

આ દોષો ફક્ત જાણ પણા માટે છે. પરીક્ષામાં પૂછાશે નહીં.

- : વિધિ સમાપ્ત :-

